

# મુદ્રાક્ષ

અનુકૂળ

જાન્યુઆરી-માર્ચ ૨૦૦૬

## પ્રત્યક્ષીય

ભાતીગળ અવાજોનો એકલક્ષી ઘોષ ત

## સમીક્ષા

૫૬ પ્રાંજલિ (કવિતા : હરીશ મીનાશ્રુ) રાજેશ પંડ્યા ૭

રાઈનાં ફૂલ (વંગકવિતા : હરિકૃષ્ણ પાઠક) રમણ સોની ૧૧

અતિરેક (વાર્તા : જિતેન્દ્ર પટેલ) જ્યંત ઉમરેઠિયા ૧૩

પરોઢીયે કલરવ (નિબંધ : ગુણવંત શાહ) રાહીશયામ શર્મા ૧૬

નિગ્રંથ ઐતિહાસિક લેખસમુચ્ચય (સંશોધન : મધુસૂદન ઠાંકી) હેમંત દવે ૧૮

## વરેણ્ય

ગાજેન્દ્રમૌક્ષિક્તિકો (કવિતા : ગાજેન્દ્ર બુચ) ચંદ્રકાન્ત ટોપીવાળા ૨૪

પત્રચાર્યા : 'પરિષદની આરપાર' વિશે ૨૬

રસિક શાહ ૦ ચંદ્રકાન્ત ટોપીવાળા ૦ લાભશંકર ઠાકર ૦ રાહીશયામ શર્મા  
૦ સુમન શાહ ૦ જ્યંત ગાડીત ૦ પરેશ નાયક ૦ ડંકેશ ઓજા ૦ મહેન્દ્ર મેઘાઙ્ગી  
૦ સુભાષ દવે ૦ જ્યેશ ભોગાયતા ૦ માવજી સાવલા ૦ બાબુ સુથાર  
૦ ભરત મહેતા ૦ કિશોર વ્યાસ ૦ મહેશ ધોળકિયા ૦ મનોજ રાવલ  
૦ બાબુલાલ ગોર ૦ રજનીકુમાર પંડ્યા ૦ રજનીકાન્ત સોની

# પ્રત્યક્ષ

વર્ષ ૧૫ અંક ૧ જાન્યુઆરી-માર્ચ ૨૦૦૬ સર્જંગ અંક ૫૭ સંપાદક રમણ સોની

પ્રકાશક અને મુદ્રક શારદા સોની ૧૮, હેમદીપ સોસાયટી, દીવાળીપુરા, જૂના પાદરા રોડ, વડોદરા ૩૮૦૦૧૫  
વાઈપ્સોટિંગ : શારદા મુદ્રણાલય, ૨૦૧, તિલકરાજ, પંચવટી પહેલી લેન, આંબાવાડી, અમદાવાદ - ૦૬ ફોન : ૨૬૫૬૪૨૭૮  
મુદ્રણસ્થાન : મધુ પ્રિન્ટરી, કારેલીબાગ, વડોદરા - ૩૮૦ ૦૧૮

લવાજમ અંગેની વિગતો

વાર્ષિક રૂ. ૧૫૦ દ્વિવાર્ષિક રૂ. ૨૫૦

આજવન સત્ત્યપદ : વ્યક્તિ રૂ. ૧૨૦૦ સંસ્થા રૂ. ૧૫૦૦

શુભેચ્છક સત્ત્યપદ : વ્યક્તિ તેમજ સંસ્થા રૂ. ૨૫૦૦

વિદેશ માટે લવાજમ : વાર્ષિક : ડોલર ૧૫, પાઉંડ ૧૨; આજવન : ડોલર ૧૦૦, પાઉંડ ૭૫.

લવાજમની રૂકમ હાથોહાથ, મનીઓર્ડરથી કે ડ્રાફ્ટથી મોકલી શકશે. બહારગામના ચેક સ્વીકારતા નથી.

**ચેક / ડ્રાફ્ટ 'શારદા સોની પ્રકાશક પ્રત્યક્ષ' એ નામે જ લખવા વિનંતી.**

મ. ઓ. મોકલનારે સંદેશાની જગાએ પોતાનું પૂરું સરનામું અવશ્ય લખવું.

લવાજમ મોકલવાનાં સરનામાં

વડોદરા : શારદા સોની, ૧૮, હેમદીપ સોસાયટી, ટાગોરનગર પાછળ, જૂના પાદરા રોડ, વડોદરા ૩૮૦૦૧૫

હાથોહાથ લવાજમ નીચેનાં સરનામે પણ આપી શકશે : અહીં મ.ઓ. કે ચેક ન મોકલવાં.)

મુંબઈ : નીતિન મહેતા ૪૦૧/બી, શિલ્પા ટેરેસ (ન્યू), શિમ્પોલી રોડ બોરિવલી (૪.) મુંબઈ૪૦૦૦૮૨

ભાવનગર : જયંત મેધાણી પ્રસાર, ૧૮૮૮ આતાભાઈ એવન્યૂ ભાવનગર ૩૬૪૦૦૨

રાજકોટ : નીતિન વડગામા 'તાંકુલ' સ્વાતિ સોસાયટી, વિરાણી સાયંસ કોલેજ પાછળ, રાજકોટ ૩૬૦૦૦૪

વલસાડ : ઝકળ એજન્સી, ૧૮, માણિબાગ, ધરમપુર રોડ, અંબામા, વલસાડ - ૩૮૬૦૦૭

અમદાવાદ : ઈમેજ પલિકેશન : ૧-૨, અપર લેવલ, સેન્ટ્રુલ માર્કેટ, આંબાવાડી, અમદાવાદ - ૩૮૦ ૦૦૬

(ઈમેજમાંથી છૂટક નકલ પણ મળી શકશે. આ અંકની ડિસ્પ્લે રૂ. ૫૦)

'પ્રત્યક્ષ'નું લવાજમ જાન્યુઆરીથી ડિસેમ્બર મુજબ ગણ્યા છે એટલે અધવચ્યે ન મોકલતાં ડિસેમ્બર (મોડામાં મોડું ફેબ્રુઆરી) સુધીમાં લવાજમ મોકલી આપવા વિનંતી

'પ્રત્યક્ષ' વર્ષમાં ચાર વાર - માર્ચ, જૂન, સપ્ટેમ્બર અને ડિસેમ્બરના અંતે - પ્રકાશિત થાય છે. એના પંદરેક દિવસમાં અંક ન મળે તો, સ્થાનિક ટ્પાલ-કરોરીમાં તપાસ કર્યા પછી, જાણ કરવી.

સંપાદકીય પત્રવ્યવહાર

રમણ સોની ૧૮, હેમદીપ સોસાયટી, દીવાળીપુરા, જૂના પાદરા રોડ, વડોદરા ૩૮૦૦૧૫

ફોન : (૦૨૬૫) ૨૩૪૭૧૮૭, ૯૨૨૮૨૧૫૨૫૭ E-mail : ramansonii@yahoo.com

## પ્રત્યક્ષીય

### ભાતીગળ અવાજોનો એકલક્ષી ઘોષ

એક સદી પછીના નવા પ્રસ્થાનબેંદુ આગળ ઊભેલી કોઈ પણ સાહિત્યસંસ્થાએ, પોતે સમયના ધક્કાથી નહીં પણ સમયની સાથે સંકિય રહીને સદી વટાવી છે એ ગૌરવ સ્થાપિત કરવાનું રહે. એ સંદર્ભે, ગુજરાતી સાહિત્ય પરિષદનું, ગયા અંકના પ્રત્યક્ષીયમાં દોરેલું જડ્પી પણ પાર-દર્શી ચિત્ર ઘણા સાહિત્યકારોને સંદિંદત કરી ગયું એ મને એક બંધુ જ મહત્વની ઘટના લાગે છે. પરિષદે, વિદ્યાકાર્યોની આવી ખાદ્ય સાથે, હવે નવી પ્રસ્થાનરેખા પરથી કેવી રીતે સંકિય થવું જોઈશે એ અંગેનાં અનેક સુચિત્તિત સૂચનાં, પૂરતી ચિકિત્સા અને ચેતવણી સાથે, આપણા આ વિદ્યાધ લેખકો અને સાહિત્યરસિકોએ આ અંકના પત્રચર્ચા વિભાગમાં રજૂ કર્યા છે. એટલે અહીં આરંભે જ, એ બધા અવાજોના મર્મ-અંશોનું સંકલન હું રજૂ કર્યું છું. આ વાંચતાં પહેલાં વાચકો એ સર્વ પત્રો વાંચી ગયા હશે તો મારી આ વાત સાથે એની વિશેષ સંગતિ રચાશે. સંપાદકીય લેખ ‘પરિષદની આરપાર’ વિશે આત્તા સુચિત્તિત પ્રતિભાવો સંપદગ્યા એ, એક વૈચારિક આંદોલનની રીતે, આનંદ થાય એવું છે. એ મને ઈષ્ટ પણ હતું – ઈષ્ટ એટલા માટે કે વિચાર-સંકિય કેટલાક અવાજો ઉપર ઉઠે તો કેટલાંક મનસ્વી – ને પરિણામે દૂધણા વધારનાર તત્ત્વો – કંઈક અટકે અને બીજા કેટલાક અકારણ પરાવલંબી રહેવામાંથી નીકળી કર્તૃવ્યસભાન બને. અને તો, પરિષદ નિરવરોધપણે સાહિત્યલક્ષી, વિદ્યાલક્ષી બને.

લેખ સમયસરનો ને ઉપયોગો છે એવો રાજ્યો ઝોનથી ને રૂબરૂ વાતચીતમાં વક્ત કરનાર પણ ઘણા મિત્રો છે. એવા અવાજોનું પણ ઘણું મૂલ્ય છે – વિધાયક સંમતિ અને જાગૃકતાની દાખિયો.

આ બાબત અંગે રસિક શાહ જેવા તત્ત્વ-વિચારકે પોતાની સંગીવણી વ્યક્ત કરી એ રજી થવા જેવું છે. સાહિત્યકારોની નબળાઈને એ સમજે છે એટલે, એમને ખૂબ જરૂરી લાગ્યો હોવા છતાં, વૈકલ્પિક સંગીન કાર્યક્રમની શક્કતા એમને ઓછી દેખાય છે. પણ સુચિત્ત વિદ્યાકાર્યો જ સાહિત્યકારોની ‘ઈમેજ’ ઊજળી કરશે એ એમની વાત માર્મિક છે. પણ એટલે જ, અસહકારવાળી એમની વાત સ્વીકારી શકાય એવી નથી, કેમકે એથી તો, ઊલટું, અનિષ્ટ કરનારને જ મોકળું મેદાન મળે. – એવું થયું પણ છે. ધીરુબહેને પ્રમુખ હોવા છતાં વહીવટી દાબનો અનુભવ કરેલો એ શું બતાવે છે ? રસિકભાઈ ગયા બે વર્ષનાં ‘પરબ’નાં એટલાંક પાનાં, ન જોયાં હોય તો, જોઈ જાય તો ‘ગાદગદ ગાન’ શા માટે એનો એમનેય અનુભવ થશે.

ચંદ્રકાન્ત ટોપીવાળાએ આખા ઉપકમને ‘વ્યાપક હિત’નો ગણીને એને યોગ્ય પરિણક્ષેમાં મૂકી આપ્યો છે ને મહત્વનાં નિરીક્ષણો આપ્યાં છે. એમણે કહી એ સલાહકાર સમિતિ ઘડી મોટી – ત્ય વ્યક્તિઓની હતી. એ બધાં નામ ‘સાહિત્યનો હિતિહાસ’ના પાંચમાં ખંડમાં છધાયાં છે. એમાં, સાહિત્યના હિતિહાસ સાથે દૂરનો સંબંધ પણ ન હોય એવાં કેટલાંક નામ, કદાચ તત્કાલીન હોદેદારો હોવાને જોરે, પણ પ્રવેશોવાં છે. એ તો ઠીક, પણ એમાંથી છેવટે જે પરામર્શન સમિતિ તારવામાં આવી એમાં સાહિત્યકોશનાં ન હિતિહાસનાં કાર્યોમાં સીધું પ્રદાન ધરાવનાર ચંદ્રકાન્ત ટોપીવાળા, જયંત ગારીત, ધીરુભાઈ ઢાકર, જેવા કોઈ જ નથી ને પ્રકાશ ન. શાહ જેવાનું નામ છે ! શ્રી ટોપીવાળા કહે છે એમે, હિતિહાસના આ જંડનાં કેટલાંક પ્રકરણો આસ્વાદ લેખો જેવાં છે ને હિતિહાસની કશી સંકલના ઊભી થઈ નથી – એમાં, સંપાદક ઉપરાંત, આ પરામર્શકોનો દોષ પણ ખરો ને ? એમણે છેવટે શું જોયું - ચકાસ્યું ?

લાનશાંકર દાકરે ટૂંક નિર્દેશો કર્યા છે પણ એમની નિસબ્બત ઉપર ઊઠતી રહી છે. પરિષદ ચર્ચા-સંવાદની (દાયલોગ – સંભાસા – ની) ભૂમિકાએ પ્રવૃત્ત થાય તો એક ‘સાહિત્યારો આદેખ’ થાય એ એમનો મુદ્દો વિચારણીય છે. પણ, પગથિયાં રચીને, પોતે સોચી ઉપરને પગથિયે બેસી જનાર ‘ગુરુ’ઓ, આવા સમાન સ્તરે રહેતા મંડળી-વર્તુળમાં બેસવા તૈયાર હશે ? એ માટે તો અવર્થીન સુધારકોના અગ્રણી દુર્ગારામ મહેતાજના જેવી સમજ-સંયમતમરી સાચી નમતા જોઈએ. હૈતિહાસિક ‘માનવધર્મ સભા’ના આ સ્થાપકે છેક ૧૮૪૭માં કહેલું : ‘આ સભામાં કોઈ મુખ્ય ગુરુ નથી, અન્યોન્ય વિચાર કરવાનો સર્વને અખત્યાર છે.’

રાધેશ્યામ શમઈએ ‘રંગીન સવાર’નો આશાવાદ પ્રગટ કર્યો છે એ, આમ તો, આપણને સૌને ઈષ્ટ છે. પરંતુ એમના આખા પત્રમાં ચિંતાનો ભાર, વિમાસણા, પણ છે જ; ને એમાં એમની વિચારશીલ સંડોવણી વરતાય છે. તંત્રો વિશે ‘ઘોર અશ્વાન’ હોવાની સ્વીકાર-દિલગીરી એમણે બતાવી છે, પણ એ જરૂરી ન હતું કેમકે તંત્રોમાં અંદર શું ચાલે છે એ ન જાણ્યું હોય તોપણ એનાં પરિણામો કેવાં આવે છે એ જોઈને પણ તોલ થઈ જ શકે – ને એ રાધેશ્યામભાઈના પત્રમાં નિર્દેશ પામ્યું જ છે. (બીજા પણ ઘણા મિત્રોએ ઝોન પર કહેલું કે, એમે ‘અંદરનું’ કશું જાણતા નથી.)

સુમન શાહે એક ખૂબ જ મહત્વનું રોગલક્ષણ – સ્થિરમ – ચીધી આપ્યું છે : પરિષદમાં લોકશાહી છે કે લોકશાહીનું માત્ર ખોણ્યું ? અને ઉમેર્યું છે કે ખરેખર તો ઠકોર-ભાયાત રસમ ચાલે છે. વળી ઉમેરી શક્ય કે મુજી-પસાયતા પદ્ધતિ ચાલે છે. ટૂંકમાં, ખોજાનો લાભ લેનાર વધ્યા છે કેમ કે ચહેરા-અવાજ ધરાવનાર સાવ ઘટી ગયા છે. એમણે પણ, લાભશાંકર ઠાકરની જેમ, પરિષદ ચર્ચા-મંચ પર આ આખી વાત લઈ જવામાં શ્રેય છે એના પર ભાર મૂક્યો છે. તો, એમણે કલેલો વીરબદ્ધ ઊભો થાય...)

જ્યંત ગાડીટે પરિષદમાં, સાહિત્યકોશના સંપાદનમાં કામ કર્યું છે એટલે એમણે – ચંદ્રકાન્ત ટોપીવાળા અને પરેશ નાયકની જેમ – પરિષદની કાર્યપદ્ધતિ અને એનાં પરિણામોનું સ્પષ્ટ ચિત્ર આંક્યું છે. ઉત્તમને બદલે ‘બીજી, નીજી, ચોથી હરોળના માણસો’ પાસે કામ લિધા કર્યું અને ‘વહીવટકારોનું લક્ષ્ય સાહિત્ય પરથી ખસીને ક્યાંક બીજે કેન્દ્રિત થઈ ગયું’ – એવું નિરાન એટલે જ એ કરી શક્યા છે. મારી વાત પણ આ જ હતી : વહીવટીની તો જોઈએ જ ને ? પણ જેમ ચંદ્રકાન્ત ટોપીવાળાએ, પોતે કુશળ વહીવટકાર હોવા છતાં – એ કુનેહને આંતરિક ચાલકબળ તરીકે રાખીને – ‘પરિષદમાં વિદ્યાપ્રવૃત્તિનો હાથ ઉપર રાખ્યો.’ એમ થવું જોઈએ. મેં કેવળ તંત્રપરક્તા વધતી જાય, એમ કશું એ પણ આ ‘વહીવટ’ માટે વહીવટ કરવાની કાર્યપદ્ધતિ સામેનો વાંધો છે. ‘વહીવટી દાબનો અનુભવ એમાં કાર્યરત વિદ્ધાનોને પણ થતો રહેલો’ એ મારી વાત, જ્યંતભાઈએ, ‘ઉત્તમ માણસો કડવાશ લઈને ખસી ગયા’ એનાથી સમર્પિંત – ને વધુ સ્પષ્ટ – થાય છે. એટલે, ખરેખર મારો ને એમનો ‘અભિપ્રાયબેદ’ નથી. પરંતુ, એમણે થોડુંક વધારે સ્પષ્ટ કરીને ઊંચકી આપ્યું એ સારું થયું. એમણે ‘કોઈ પણ સંસ્થા કે કુપની’ એવો શબ્દપ્રયોગ કર્યો એ બહુ અગત્યાનું છે. કુપનીનું લક્ષ્ય જેમ સર્વાધિક ઉત્તમ ઉત્પાદન (ઉત્તમ પરિણામ) આપવા તરફ હોય એમ જ સંસ્થાનું લક્ષ્ય પણ ‘ઉત્તમ ફળ’ આપવા તરફ હોય – નક્કર યોજનાઓ દ્વારા.

પરેશ નાયક ચિકિત્સાભર્યાં પૃથક્કરણથી સમસ્યાના હાઈમાં ઉત્તર્યાં છે. એમની બંધારણ-નિષ્ઠતાની વાત વિચારણીય છે – એ રસ્તે જ એમને ‘મૂર્તિ’ઓ અને ‘આગણી’ઓના, ખરેખરા ને કલ્પી લીધેલા બધા જ, અવરોધોમાંથી બહાર આવવાનો ઉકેલ દેખાયો છે એ સારું છે. સમય આવે સાચો તિરોધન-સૂર ન કાઢનાર, જવાબદારી સમજવાને બદલે દરબારી બની જનાર સૌને પરિષદની વિષમતા માટે એમણે તકસીરવાર ઠરાવ્યા છે. રઘુવીર ચૌધરીની ભૂમિકા એમણે કંઈક વધુ વિગતે, દલેદલ ખોલીને બતાવી છે. ‘ચૂંટાયેલા મોટા ભાગના સંસ્થો પરિષદના બંધારણનો કે એજન્ડા ઠારવો અને મિનિટ્સનો અભ્યાસ કરવા જેટલી તસ્તી નથી લેતા’ એ વાત, ને રમૂજમાં કરેલું એતર એડવાનું રૂપક – એ કોઈને આકું લાગે તોપણ મૂળ સમસ્યાને સમજવા માટે બહુ સારું છે – આપણી સૌની ‘કમનસીબી’ બતાડી આપનારું છે. ‘એ કેવી રીતે શક્ય બન્યું ?’ કહીને એમણે જે જે બતાવ્યાં છે એ કાર્યો, એમણે નામ નથી આપ્યાં પણ પરેશ નાયક અને હરિકૃષ્ણ પાઠકે કરેલાં છે. અને બહુ જહેમત ને પૂરા અભ્યાસથી એમણે તૈયાર કરેલો કીર કમિટીનો, કારોબારીમાં મંજૂર થયેલો, અહેવાલ સત્વરે પરબર્થાં પ્રગટ થાય એ જરૂરી છે. મારા લેખમાં, સ્મરણચૂક્યી આ અહેવાલની વાત કરવી રહી ગયેલી. એની અહીં પૂર્તિ થઈ એ સારું થયું.

‘પરિષદની આરપાર’ શીર્ષક આપતી વખતે મારા મનમાં ‘આરપાર’ સામાયિકની કશી જ પ્રગટ-અપ્રગટ છાયા ન હતી એટલું કહું. ‘આરપાર’નો જાણીતો અર્થ – સોસંસું, અંદરથી પસાર થતું – લઈને હું ચાલેલો. તેમ છતાં પરેશ કરેલા હળવા કટાકણો સ્વાદ હું માણું છું – એ આખા પરિચ્છેદમાં રમૂજભર્યા જે દ્વિઅર્થી સંકેતો છે એ પણ માણી શકું છું. ઉકેલી શક્યો એ બધા પણ માણી શક્યો.

પરેશના પત્રની એક બાબત અંગે સ્પષ્ટતા – ક. લા. સ્વાધ્યાયમંહિરની કામગીરીનો હિસાબ કંઈ ચિમનભાઈએ માગવાનો ન હોય – એ તો ‘સાહિત્યનો, ઇતિહાસ’ના જ પરામર્શક હતા. પરિષદના મંત્રી કે પ્રમુખ) નિયામક પાસેથી

સમયાંતરે વિકાસ-અહેવાલ મેળવતી રહે એ સહજ કાર્યવાહી હોય.

ઉકેશ ઓઝાએ પરિષદના છુસ્વીકરણમાં કારણરૂપ બનેલી બાબતોનું વિશ્વેષણ આવ્યું છે. એમાં ઘણા તથાંશો છે. અલબત્ત, એ ટેખાડતા રહ્યા છે એવો સમાજવ્યવહારલક્ષી અભિગ્રહ સાહિત્યસંસ્થાનાં લક્ષ્યાંકો નક્કી કરવામાં હેમેશાં ઉપયોગી ન પણ થાય. છતાં એમનાં વિશ્વેષણોમાં ઘણા મુદ્દા રચાય છે. ‘સફાઈ પેશ કરવા’ પરિષદે પોતાના મુખપત્ર ‘પરબ’ને બદલે ‘નિરીક્ષક’નો સહારો લીધો એ એમની – અને પરેશે પણ સ્પષ્ટપણે બતાવેલી – વાત બહુ મુદ્દાની છે. મને પણ ‘નિરીક્ષક’ની ભૂમિકા બચાવર નહોતી લાગી, બલકે કંઈક આશયગંધી લાગેલી. એમાં છપાવેલાં મંત્રવ્યોનો વળી પાછો ‘ઉપયોગ’ કરવામાં આવ્યો ને ચુંટુછીને – અને એમ પરિષદ-પ્રતિષ્ઠાને – દૂષિત કરવામાં આવી. મૂળ વાત તો એ જ કે ‘ખેવના’, ‘આરપાર’માં આવેલી વિગતોની સામે સ્પષ્ટતા કરવા ‘પરબ’ કેમ આગળ ન આવ્યું? મુખપત્રનો, સર્વથા યોગ્ય એવો, ઉપયોગ ન કરવાનો મોટો અપરાધ પરિષદે કર્યો ગણાશે.

ઉકેશબાઈએ અનુવાદકેન્દ્ર અંગે સ્પષ્ટતાઓ આપી એ તો સારું જ થયું – કેમકે પ્રશ્નો એમની સામે પણ ધરાયેલા જ હતા. વહીવટી વૈચિચ્યે એમના જેવા સ્પષ્ટવક્તાનેય મૂલવ્યા એ, શ્રી ટોપીવાળાએ નોંધ્યું છે એમ ‘સમિતિઓને નિષ્ણિય’ કરી દેતાં વિપરીત પરિબળો કેવાં વકરેલાં છે એ બતાવે છે. તેમ છતાં, ઉકેશ રાજીનામું આપીને ખસી જવાનું કર્યું એમાં કર્તવ્યપ્રમાદ તો છે જ. બેઠકોમાં જરૂરી આગાહો સેવીને, ન સ્વીકારાય તો જાહેરમાં લખીને એ સ્પષ્ટ થઈ શક્યા હોત.

મહેન્દ્ર મેધાણી પણ, ઉકેશની જેમ, આપણા વ્યાપક સામાજિક સ્તર (પ્રજાકીય ચારિત્રય)ને આધારે લેખકસમાજને, પરિષદ જેવી સંસ્થાને પણ, મૂલવે છે. તેમ છતાં એમને આપી સ્થિતિ ‘કમનસીબ’ તો લાગે જ છે. ભાવનાઓના ગાનથી કશું નહીં વળે. એ એમનીય પ્રતીતિ છે કેમકે તે નક્કર કર્મઠતામાં માનનારા છે.

સુભાષ દરવેશે પરિષદની વહીવટી પાંખના આંતરનિરીક્ષણની, અને પણી એ વ્યાપક રીતે વિદ્યાપ્રવૃત્તિ-પરક બને એની વાત ભારપૂર્વક કરી છે. વળી, સેતુરૂપ બનવા માટે ‘પરબ’ ક્ષમતાપૂર્વક ગતિશીલ ભૂમિકા ભજવવી જોઈએ એ તરફ પણ યોગ્ય ધ્યાન દ્વારા દ્વારા છે. એમનું વિશ્વેષણ, આમ, ખાસું દિશાસૂચ્યક છે.

જ્યોશ ભોગાયતાએ સંચાલક સત્તાવાહકોની સ્વહિતલક્ષી પ્રવૃત્તિઓ બધું બેઠેણ ન કરી મૂકે એ માટે ‘બૌદ્ધિક મંચ’ની રચના કરવાનું એક યોગ્ય, તાકીદનું, સૂચનું કર્યું છે – એટલે કે અનિષ્ટ-વિરોધના અને નવી વિચારણાના સાતત્યની જિકર કરી છે. એમના વિશ્વેષણો કહેવાતા વિદોહીઓને તેમજ ધર્મર્યાદ-શરણે જનારે પણ છોડ્યા નથી – ચર્ચાને વ્યાપક કરીને પણ એમણે અવરોધનાં જાળ્યાની શક્ય એટલી જગ્યાઓ બતાવી આપી છે – એ સારું જ કર્યું. એમના અવાજમાં ઉકળા છે એ પણ સુચિષ્ણન રૂપ છે.

બૌદ્ધિક મંચ કોણ કરે? એમણે ‘પ્રત્યક્ષા’ના સંપાદક તરફ જ લાગતી આંગળી ચીંધી છે! બલે, કરીએ. પણ લગભગ દરેક જગ્યાએ આવી મંડળી મળવાના લાભ તો ૧૮૪૭ (હર્ગારામ) અને ૧૮૫૧ (નર્મદ) જેટલા જૂના છે. મંડળી દૂરિત-ઉચ્છેદક તો હોય જ; વિદ્યાયક વિચારશીલતાવાળી પણ હોય.

માવજુ સાવલાએ તાત્ત્વિક ભૂમિકાએ વ્યક્તિ-સંસ્થા વચ્ચેનો જે બેદ ચીંધો છે તે ખરેખર તો આપણી સંસ્થા-પ્રણાલીનું વાસ્તવિક ચિત્ર છે. બાકી સંસ્થા શા માટે જડવાઈ રહે? સંસ્થા જો સજ્જ અને સંનિષ્ઠ વ્યક્તિઓનું સંકલન કરનાર હોય તો મોટાં કામ કરી જ શકે એમને પણ ઈષ્ટ તો એ જ લાગે છે.

બાબુ સુથારે ૧૨ સૂચનોનો એજન્ડા જ મૂડી આપ્યો છે. એ પદ્ધતિ (System)ના માણસ છે ને કાર્યક્ષમ ચુસ્ત પદ્ધતિના મુલકમાં વસે છે. એટલે એમણે કહ્યું એ કોઈને આદર્શ-આદર્શ જેવું લાગવાનું – એ વળી આપણી કમનસીબી છે. ટેકનોલોજીનો - અદ્યતન જ્ઞાન-ઉપકરણો ને પદ્ધતિઓનો – ઉપયોગ કરવાનું એમનું સૂચન પણ ધ્યાનાર્હ છે.

ભરત મહેતાને મૂલ્યધ્રસના આ હિવસોમાં ‘કેવી હોવી જોઈએ પરિષદ?’ – એની વાતો આદર્શ જેવી લાગે છે એમાંથી, જે કથળી ગયું છે એની રેણુના વાંચી શકાય છે. એથી જ, ‘બંગળી વિશ્વેષણ’ની સરબામણીએ આજે તો ઘણી સારી લાગતી આપણી પરિષદ એ તરફ ધર્યી ન પડે એવી ચિંતા એમણે બતાવી છે. છેલ્યે એમણે ‘જુકાવવાની’ વાત કરી છે તો, ઘણી પ્રવૃત્તિઓમાં સક્રિય એવા ભરત મહેતા પણ, જુકારે એવું આપણે ઈચ્છાએ.

કિશોર વ્યાસ પરિષદે કરવાં જોઈએ એવાં કામમાં કેટલાંક વિચારણીય ઉમેરણ કરે છે ને યોગ્ય સંકલન - સૂચનો પણ કરે છે એ, કોઈને કદાચ અશક્ય આદર્શ જેવાં લાગે એવી કુદામાં પરિષદ વેરાઈ ગઈ છે. પરેશ નાયકના લેખને,

ને એનો કશો પ્રતિસાદ ન મળ્યો એ બાબતને પણ કિશોરે યોગ્ય રીતે યાદ કર્યા છે. આવી અપેક્ષાઓ, હજુ પરિષદની એક પ્રતિમા એમના ને આપણા મનમાં ઊભી છે એથ સૂચવે છે. પરંતુ એની પાછળ એક ફડક પણ છે કે આવી અપેક્ષા રાખવાનું પણ ધીમે ધીમે મનમાંથી ધોવાનું જો કે શું ?

મહેશ ધોળકિયાએ ઘૂંઠીઘૂંઠીને પણ અસરકારક રીતે વાચન-અભિમુખતા દ્વારા શક્ય બનનાર ઉકેલો ચીંધ્યા છે. એ માટે પરિષદની સક્રિયતા માટેનું એમનું આ સૂચન, ‘રીતસરની ઝુંબેશા’ દ્વારા, આપણને સૌને ઈષ્ટ એવા સ્વખને આકાર આપવાની હિશાનું છે.

મનોજ રાવળ જરાક વ્યાપક ભૂમિકા લઈને આવ્યા છે – પણ આ નિમિત્તે ય ચર્ચા, સંલગ્ન રહીને, વ્યાપક ભૂમિકાએ પ્રસરે એ પણ જરૂરી જ છે. ‘ગ્રાંટ-ભક્તી જીવો’ વિશે એમારો યોગ્ય પ્રકોપ ઠાલબ્યો છે. એક બાજુ ‘તજ્જ્ઞો’ની નિર્ણાયકતા ને બીજી બાજુ ‘સહિયારી ચિંતા’ની એમની વાત જરાક સામસામે મુકાઈ ગયેલી, વિરોધાભાસી વાગે છે. અલબત્ત, તજ્જ્ઞોની નિર્ણાયકતાની – ન એ માટે એમની સતત સક્રિયતાની – એમની વાત બચાવર છે. પણ આ તજ્જ્ઞો પરિષદમાં કેમ ‘ફરકતા નથી’ એની બીજી બાજુનો, દૂર રહેવાને કારણો (બંને રીતે : અમદાવાદથી એ દૂર રહે છે ને વળી પરિષદમાં એ પોતે પણ, પેલા અન્ય તજ્જ્ઞોની જેમ, ફરકતા નથી – એ રીતે પણ) એમને અંદાજ નથી. એ અંદાજ એમને, અહીં અન્ય કેટલાક (ચર્ચા)પત્રો વાંચવાથી પણ આવશે. પરિષદની સ્થળ-વિકેન્દ્રિતતાની એમની વાત વિચારણીય છે. એ સંકલન ઘણી મહેનત માગનારું છે પણ પરિષદ કરી શકે. વળી, કેન્દ્ર ભવેને એક હોય (એના ફાયદા પણ છે) પણ એમાં જુદાં જુદાં કેન્દ્રોના સાહિત્યરસિકો, એમની સજ્જતાને બળે જ, જોડાયેલા હોય એ વધુ ઈષ્ટ.

બાબુલાલ ગોરણા પત્રમાં, પરિષદ પર ઊભેલા એક સાચા સહદ્યની, કેન્દ્રીભૂત પરિષદ પાસેની એક ન્યૂનતમ અપેક્ષા છે. એમાં ખરી નિસબ્ત પણ રહેલી છે. તુલનાને કારણે પણ એમની ફરિયાદ બલકે અપેક્ષા ઘણી વજૂદવાળી બને છે.

રજનીકુમાર પંડ્યાનો જાત-અનુભવ પરિષદની સંકલના-વ્યવસ્થાની મુશ્કેલીને રમૂજપૂર્વક નિર્ણયે છે. પણ એમારો આ માટે કરેલું ‘સુપ્રિમો’નું સૂચન ઘણા પ્રશ્નો ઊભા કરે. એવો ‘સુપ્રિમો’ (ક્યાંથી લાવે પરિષદ ? સાહિત્યકારોમાંથી કે બહારથી ? કોઈ મેનેજમેન્ટનો નિષ્ણાત ?) પોતે પણ સાહિત્યસંસ્થામાં તો પ્રશ્નો ઊભા કરી શકે – ઊભા કર્યા પણ છે. પણ આપણને કોઈ કાર્યક્રમ પદ્ધતિપૂર્વક – સિસ્ટિમથી – સાહિત્યસંસ્થા ચલાકવાનું ફાવતનું નથી, બધું કામચલાઉ ધોરણે જ લટકતું રાખવાનું વલણ હોય છે – એવો નિર્જર્ખ રજનીકુમારના પત્ર પરથી ચોક્કસ નીકળી આવે છે.

રજનીકાન્ત સોનીના પત્રમાં આપણી એક વ્યાપક નબળી માનસિકતા સૂચવાઈ છે : ‘પરિષદના કેન્દ્રમાંથી બહાર ફેંકાઈ જવાના ભયે લાયે કોણ ?’ કદાચ આ આપણાં એક વ્યાપક પ્રજા-ચારિત્ર્ય પણ છે. ફેંકાઈ જવાનો ભય લાલચ-પ્રેરિત હોય છે ન એ માટે તો ન-બોલનાર જ જવાબદાર છે. વળી, એ સત્તા-કેન્દ્ર માટેની હોળયાં પણ હોય છે. સ્પષ્ટ કહેનારે એવી તમા ન હોય પણ એનીય ઉપેક્ષા થાય, એને ફેંકી દેવાય – એ સાહિત્યસમાજને નુકસાન પહોંચાડનાર તો છે.

ચાલો, આટલા અવાજોનો એક ઘોષ પ્રગટ્યો એથી ઘણાં પરિમાણો ઊપરથાં, ને એથી અનાયાસ એક સર્વેક્ષણ પણ થઈ ગયું : આપણે સંસ્થા સારી થાય એની તલાશમાં છીએ તો વળી સારી સંસ્થાની તલાશમાં પણ ધીએ.

પરંતુ, આ – આપણને જે પાયાના વાંધા લાગ્યા છે, ને શું શું થતું જોઈએ એનો જે ઉપયોગી નકશો આપણે ઉપસાવી આપી શક્યા છીએ – એ કાગળ પરની લીલા બનીને અટકી જવું ન જોઈએ. અવાજનું સાતત્ય રાખીએ, એટલે કે કહેવાનું આવે. ત્યાં આપણે બેધડક કહેતા રહીએ ને લખતા પણ રહીએ – શેહમાં આવી જવાની વંધ્ય નમ્રતા (કે નબળાઈ)નો ભોગ ન બનીએ તો જ એનો અર્થ છે; તો જ રસ્તો સાફ દેખાડનારી પરંપરા ઊભી થાય.

૧૭, માર્ચ ૨૦૦૬

– રમણ સોની

'પદ્માંજલિ' ૮૦ કાવ્યરચનાઓનો સંચય છે. બધી રચનાઓ ગીત - ગેયપદ - સ્વરૂપની છે. વિષય તરીકે આધ્યાત્મિક અનુભૂતિ છે. અધ્યાત્મ એ ભારતીય કવિતા માટે નવી નવાઈ નથી. મધ્યકાળ તો એ દસ્તિખે વિશેષ સમૃદ્ધ છે. ગીતસ્વરૂપને પણ એની સમૃદ્ધ પરંપરાનો હિતિહાસ છે. આ સંદર્ભમાં જોઈએ તો 'પદ્માંજલિ' પરંપરામાં રહીને રચાયેલા મૌલિક કાવ્યોનો સંગ્રહ છે એમ કહી શકાય.

'પદ્માંજલિ'માં પદનું સ્વરૂપ મધ્યકાળીન પદશૈલીથી ખસ્તી જઈ વર્તમાન ગીતશૈલીની ઘણું નજીક, લગોલગ, પહોંચી ગયું છે. પણ અહીં ગીતસ્વરૂપની એકાવિક શક્યતાઓનો લાભ લેવાયો નથી. બલકે, એક જ પ્રકારના, ચોક્કસ ગીતઢાંચાને કવિએ બધી જ રચનાઓમાં સમાન રીતે યોજ્યો છે. આથી અભિવ્યક્તિના બીજા માર્ગો બંધ થઈ ગયા છે. થોડી રચનાઓ પછી સ્વરૂપની એકવિધતા રચનારીતિની એકવિધતામાં પરિણમે છે ને ત્યારે મોકણાશને બદલે સંકદાશનો અનુભવ થાય છે.

આ સંગ્રહનાં બધાં જ પદ-ગીતનો ઉપાડ નિશ્ચિત છે. એ ક્યાંક ક્યાંક તો કબીરનાં પછો સાથે સીધો સંબંધ ધરાવે છે. જુઓ :

- ૧ સાધો, અમે શબદના જોગી (૫. ૮)  
(સાધો, શબ્દસાધના કીજે / સાધો, શબ્દ સબન સે ન્યારા - કબીર)
  - ૧ સાધો, ઈક સદ્ગુરુ ઈક ચેલા (૨)  
(સાધો, સો સદ્ગુરુ મોહિં ભાવે - કબીર)
  - ૧ સાધો, તું નિજની સંગતમાં (૨૦)  
(સાધો, એક આપુ જગ માંહિ - કબીર)
  - ૧ સાધો, મન બૌરા બહુરૂપિયા (૫૩)  
(સંતો, દેખો જગ બૌરાના - કબીર)
- કબીરે 'સાધો' ઉપરાંત અવધૂ સંત, રામ, ભાઈ, મન, જીવ વગેરેને સંબોધિને પણ પદનો આરંભ કર્યો છે

જ્યારે 'પદ્માંજલિ'ની દરેક રચના 'સાધો' શબ્દથી જ આરંભાય છે. આવી નિશ્ચિત ધ્રુવપંક્તિ નિરૂપિત આધ્યાત્મિક ભાવસંવેદનનો સીધો સંકેત કરે છે. તો, ધ્રુવપંક્તિનો છેલ્લો શબ્દ પ્રાસબંધશી કેવી રહેશે તે ચીંધી બતાવે છે. આવા નિર્ધારિત માળખાને વશવર્તતી રચના આગળ જતું અનુભૂતિના સમીકરણમાં અને કાવ્યરચનાના વ્યક્તરણમાં સરી પડે છે. કેટલેક અંશો કવિ સર્જકતાના બણે આવાં ભયસ્થાનો વળોટી જાય છે. સર્જક સ્પર્શથી રમણીય બનેલી એવી થોડી ધ્રુવપંક્તિઓ જોઈએ :

- ૧ સાધો, રો લીલા રઢિયાળી  
ધરું સહજ હું ઈલાયચી તો હરિ યાચે વરિયાળી (૧૧)
- ૧ સાધો રીપે રીપે ટળવળિયાં  
મોરની નમશી ડોકે બાંધાં મલારનાં માદળિયાં (૨૨)
- ૧ સાધો, એ શું મહિરા ચાખે  
દરાખનો જે મરમ ભૂલીને જઈ વળાંયો રુદરાખે (૩૪)
- ૧ સાધો, વ્યાઙુળ વનસ્થલિમાં  
હરિ-અમરિતનાં કરે છાંટણાં હરિણની પગલીમાં (૭૬)

આ પંક્તિઓમાં પ્રાસ, લય, કવિકલ્યના અને ભાષાકર્મની ચતુર્વિધ લીલા-રમણા આસ્વાદ બની છે. એટલું જ નહીં પરંપરાનો નવો તાજગીસભર વિનિયોગ પણ જણાય છે. આ ધ્રુવપંક્તિઓ સામે સમતોલન સાધતી બીજ કેટલીક ધ્રુવપંક્તિઓ (પદકમાંક : ૧૩, ૧૬, ૩૫, ૪૮, ૫૦, ૬૨, ૬૬)માં કવિકર્મનો વિલક્ષણ ઉન્મેષ પ્રગટતો જોવા મળે છે. વળી, ક્યારેક ધી કેળાં (૨૭) દાળમૂઠ ને પેંઠા (૩૦) જેવા ખાદ્યપદાર્થ; ક્યારેક કબજીયાત (૫૧) જેવો રોગ; ક્યારેક કરું અને કરિયાતું (૭૪) જેવાં ઔષધને પણ કવિ ધ્રુવપંક્તિમાં પ્રયોજે છે. આવા ઉલ્લેખો દરેક વખતે કાવ્યોપકારક જણાતા નથી. મોટે ભાગે તો લય અથવા પ્રાસાનુપ્રાસની જરૂરિયાતને વશવર્તીને એ આવે છે ત્યાં કાવ્યરચનાનું વ્યક્તરણ તરત પક્કી શકાય છે. વર્ણાનુપ્રાસ

અને અત્યાનુપ્રાસના ચાલકબળથી રચાતી આવી કેટલીક ધ્રુવપંક્તિઓ (પદકમાંક : ૧૦, ૨૧, ૨૬, ૩૭, ૪૦, ૬૦, ૭૨)માં અને ક્યારેક તો રચના સમગ્ર (પદકમાંક : ૩૨, ૪૫, ૫૭, ૬૬, ૭૦)માં એની પ્રતીતિ થશે.

‘પદપ્રાંજલિ’ની કેટલીયે રચનાઓમાં પ્રાચીન-મધ્યકાલીન ભક્તો અને સંતોના સંદર્ભો યોજાયા છે. ક્યારેક શાલ્ફસાદશયથી તે પકડી શકાય છે તો ક્યાંક સ્વએ નામોલેખ પણ કરવામાં આવ્યા છે.

સૌથી વધુ ઉલ્લેખો કે પંક્તિસંદર્ભો નરસિંહ અને કબીરના મળે છે. ઉપમી રચના તો કબીરની પ્રસિદ્ધ પંક્તિ ‘પ્રેમગલી અતિ સાંકુરી જામે દો ન સમાઈના ઉત્તર રૂપે લખાઈ છે. પ્રત્યુત્તર માટે યોજાયેલો કવિતર્ક રચનાને સાર્થક બનાવે છે.’ (‘સાત સાંકડી ગલીમાં બેઠી પડવા નેહે નવધા / એકમેકને જોઈ થઈ ગયા, બન્ને અડધા અડધા’ – ૭૫). પરંતુ, એ રીતે શબ્દરીના ઉલ્લેખો રચનામાં ભાળી-ઓગળી જતા નથી. શબ્દરી માટે કિરાતિની શબ્દ વર્ણાનુપાસે જેંચાઈ આવ્યો હોય એમ તરત લાગે. (કનકબોર ચાખે કિરાતિની, બળો કથીરની લંકા – ૪૧). ૧૮માં પદમાં એઠાં બોર અને વિદુરની ભાજનો સંદર્ભ પણ લટકતો જણાય છે. જોકે ૧૮મી રચનામાં ભીખની બાણીશૈયાનો સંદર્ભ કાચ્યોપકારક બન્યો છે. આ બધામાં ગંગાસતી અને પાનબાઈના ઉલ્લેખવાળી પંક્તિઓ સૌથી વધુ આસ્વાદ છે :

દાણે દાણે ઝૂલણા છંદે પાનબાઈ ફરફરતાં  
જજા સીંચયાં તો આરીમાંથી ગંગાસતી ઝરમરતાં (૩૬)

આ પ્રકારના ઉલ્લેખો કે સંતવાણીના પંક્તિસંદર્ભોને કવિ પોતાની રચનામાં સમાવી-સંગોપી લે છે તેને આંતરકૃતિત્વની દસ્તિએ તપાસી શકાય. અથવા આવાં સાંધળો (પેચવર્ક)-થી રચાતી ભાત તરીકે પણ જોઈ શકાય. આવા પંક્તિસંદર્ભોને કવિ જેમના તેમ મૂકી દેતા નથી એમાં કવિકર્મથી થયેલાં વિચલનો ક્યારેક આગવો અર્થ પણ રચી આપે છે.

પરંપરાગત સંતવાણીમાં રૂઢિઓ અને આચારવિચારો પર તીક્ષ્ણ કટાક્ષો અને ધાર્મિક અસહિષ્ણુતા પર તીવ્ર પ્રહારો ઉપરાંત સાંપ્રદાયિક સદ્ગભાવની જિકર હોય છે. તેનું અનુસંધાન કેટલીક રચનાઓ (૫, ૭, ૨૮, ૫૭, ૬૧)માં જોવા મળે છે. સાંપ્રત

સંદર્ભને લીધે એ વિશેષ અસરકારક પણ લાગે છે. બે ઉદાહરણો જોઈએ :

નેયને મન મરવાનું તે, કાશીથી નીકળ્યાં મગહર  
ચેહ કહે : હું ભટું; મારી કહે : લેટ જા અંદર (૭)

પિંડ થકી પરછેંયા પડશે, તુરક હો કે છિન્કુ  
મૂળિયાંની ટોચે જઈ જોયું, કેવળ બીજ કે બિંકુ (૫૭)

‘પદપ્રાંજલિ’માં કેટલીક પંક્તિઓ એવી છે જેમાં અધ્યાત્મભાવની સહજ અભિવ્યક્તિને લીધે સંતકવિઓની નિકટ પહોંચતું કવિકર્મ જોવા મળે છે. પંક્તિઓમાં રહેલી આ શક્યતાઓને કવિ રચનાસમગ્ર સુધી વિસ્તારી શક્યા હોત તો કેટલીક ઉત્તમ રચનાઓ મળવાની સંભાવના હતી. અહીં આવી શક્યતાસભર પંક્તિઓનાં થોડાં ઉદાહરણ જોઈએ :

નભ આલિંગન લિયે નિરંતર, તો ય બિહગ બૈરાગી  
ભગવામાં યે ભરત ભરીને સોહે તે અનુરાગી (૩૪)

તરુ હોય તો કરી કલ્યાના, કલ્યતતુ પણ કહીએ  
ઘટિકાયંતે મધ્યાં મરુથળ, ખરખર ખરતા રહીએ (૬૫)  
અગનાળાનું અંગરખું વર્દી, ભરવા બેઠા બાજિયા  
સીયમાં દોર પરોબ્યો ત્યાં તો, સગાજા સંઘણું રખિયા (૬૭)

પદપ્રાંજલિની કેટલીક રચનાઓમાં કવિનું ભાષાકર્મ સ્વતંત્ર આસ્વાદનો વિષય બને છે. સપાતી પર સાદી લાગતી ને અર્થગ્રહણમાં સરળ જજાતી પંક્તિઓમાંનું ભાષાકર્મ અર્થના છેડા પણ ખુલ્લા રાખે છે. આવી તરલ અર્થસંકુલતાવાળી પંક્તિઓ જોઈએ :

‘હું ને ઊહું કહું તો હરિ બેટે હમજાં ને હમજાં (૧)

અહેંભાવનો અતિરેક હું, ઊહું, કહું – માંના ત્રણ  
‘હું’થી સૂચ્યવાયો છે. ‘ઉ’કાર (અહેંકાર)ના નકાર પછી રહેતો ‘હ’ – ‘હરિ’માં અને ‘હમજાં’ની દ્વિક્રિત વડે થતી સુધ્યપ્રાપ્તિમાં પરિણામે છે.

‘ધન્ય હજો, હજ કર્યા વિના જે હોય સહજનો હજુ’ (૪)

હજો, હજ, સહજ, હજુ જેવા ધ્વનિસામ્ય ધરાવતા શબ્દોને આશ્રયે પ્રવર્તતું પારિભાષિક અર્થઘટન ધ્યાન ખેંચો છે. ‘ધન્ય યમુનાતટ, ધન્ય બંસીવટ...’નો નરસિંહ ઉદ્ગાર પણ તેમાં આછો આછો સંભળાય.

‘પદ્ધી જનોઈવડ ઘા કરી ઝીણા પ્રેમતાંતણો સાંધે’ (૩૭)

અહીં પણ રૂઢિપ્રયોગના આશ્રયે જનોઈના તાંત્રણ સાથે પ્રેમતાંતણા, કારી ઘા કરવાની સામે ઝીણું સાંધવાની કિયા જેવાં સમતોલન જળવાયાં છે. ‘કાચે તે તાંતણો હરિજીએ બાંધી’ એ મીરાં-ઉક્તિ પણ ઉંટ ઉંટ સંભળાશે.

આવા સધન ભાષાકર્મની સામે કેટલીક પંક્તિઓ તહન સામાન્ય જ્ઞાનાશે. એમાં વિષયને અનુપકારક એવી ભાષા આસ્વાદમાં ઘયરકા જેવી લાગે છે :

૧ બ્રહ્મ જ બેંબેંકાર કરી તરફડતો બકરીઈદે (૨૫)

૧ જેની માએ સવાશેર ખાદી હો સતની સુંકા

સચરાચરમાં શૂન્ય અને એકરના ચાલી ગુંડા (૪૦)

૧ સતસંગતની કબજીયાતના કરશે અજબ ઉપાયા (૪૧)

૧ ભગમાં લિંગ, લિંગમાં સરિસુપતા સંસારે ધૂપિયા (૪૨)

ભાષાકર્મનું એક બીજું પરિમાણ શબ્દનોને જોડવા-તોડવા-મરોડવાના ને એમ નવા અર્થમાં યોજવાના, કિવિને પૂર્વસાધ્ય તરીકાઓમાં ડોકાય છે. એમાં લીલા પણ છે ને કરામત પણ છે. બન્નેના થોડાઝાજા ફાયદા ગેરફાયદા મળ્યા છે. એવાં ઉદાહરણો અધ્યાત્મેરી રચનાઓમાં મળશે. ‘ભૂર જોગિયાનો સુષાતાં તો જોગવટો લઈ લીધો / અહો સુરાવત સુરા બની ચક્કચૂર પિયાલો પીધો’ (૫૬) જેવાં ઉદાહરણમાં એ સાર્થક જ્ઞાનાશે. જ્યારે ‘ગણિકા બની પીંગળા રાણી, મનના પિંગળ દોષે / તું કોનો ભરથાર ભરથરી કોના કુટિલ ભરોસે’ (૫૭)માં એ નિરથ્ક શબ્દરમત બની રહે છે.

શબ્દરમતની જેમ પ્રાસરમતને લીધી પણ ‘પદ્માંજલિ’ની ઘણી રચનાઓ ઘેઘૂર અને પ્રચુર ભાષાભારથી લદાયેલી લાગે છે. પ્રાસાનુપ્રાસમાં રાચતા આવા કવિકર્મથી અર્થ ક્યાંય આધો હડસેલાઈ જાય છે ને શૈલીસુખમાં છલકાતું શ્રવણરંજન સપાઠી પર તરતું રહે છે. અહીં ખૂબ ખટકતાં, માત્ર અંત્યાનુપ્રાસનાં થોડાંક ઉદાહરણો જોઈએ : ઉદ્દુ - મૂરદુ (૭), સત્તા - વાસવદત્તા (૧૦), પડવા - ભડવા (૧૬), હઠ રે - હક્કેઠઠ રે (૧૭), જુગજૂની - ઉનમુની (૨૧), જોડણીદોષો - ભરોસો (૨૮), મધ્યસ્થી - ગ્રહસ્થી (૩૦), ભગતિ - અગતિ (૪૦), અમરતકૃપી-ચુપી (૪૨), પિંગળદોષે - ભરોસે (૫૩), ક્રૌમુદી - જુદી (૫૮), નેતિ નેતિ - લેતીદેતી (૬૧), બેસે

- આવેશો (૬૫), કર્ત્તા - સૃષ્ટિ વિવર્તા (૬૬), ગજને - ધજને (૬૮) - આ અંત્યાનુપ્રાસોવાળી પંક્તિઓ જોવાથી પ્રાસમોહ રચનાને કઈ હદે વણસપાડે છે તેનો ખ્યાલ આવશે. એટલું જ નહીં, ઘણી રચનાઓમાં ધૂવપંક્તિ સાથે પ્રાસરાસમે જોડાતી પંક્તિઓના બધા અંત્યાનુપ્રાસની યોજના પ્રવાહી નથી. પદ : ૪૮માં આરંભે પટલાઈ સાથે પટલાઈનો પ્રાસ અર્થવાહી બન્યો છે, પરંતુ એ પદી પટલાઈના અનુસંધાનમાં ‘વટ, ભાઈ’, ‘વહીવટ, સાંઈ’ જેવા પ્રાસની સાર્થકતા જણાતી નથી. ગીતરચનામાં પ્રાસ તે પંક્તિને અટકાવવાનું કામ કરે છે. પ્રાસ પાસે પંક્તિ પૂરી થતા, અર્થપ્રકાશમાં સમગ્ર પંક્તિ જળહળી ઊઠે તો પ્રાસ જેવી પ્રયુક્તિ કાયોપકારક બને. પ્રાસ કાર્યસાધક રીતે ન યોજ શકાય ત્યારે નિશ્ચિત લયબંધમાં પંક્તિને બંધવાની અશક્તિ જ છતી થાય. ને પ્રાસાનુપ્રાસો માત્ર કાય્ય-કરામતો બનીને રહી જાય.

‘પદ્માંજલિ’ની રચનાઓના આસ્વાદમાં પુનરાવર્તનો પણ અવરોધરૂપ બને છે. જેનો સીધો તાળો મેળવી શકાય તેવી પંક્તિઓ જુદીજુદી રચનાઓમાં થોડાઘણા શબ્દફેરે વારેવારે આવ્યા કરે છે. જે તે રચનામાં તેના આગવાં પરિમાણ ઉદ્ઘાતાં નથી. એથી ભાવ ધૂંટાઈને ઘેરો બને છે એમ પણ લાગતું નથી. આથી તેની અનિવાર્યતા સિદ્ધ થતી નથી. થોડાંક ઉદાહરણો :

શબ્દ થકી આ વિશ્વ વિલસ્યું, દેશે સુરત ગવાહી (૩)

આજ શબદની કથરોટે ઊભરાઈ અકથની ગંગા (૪)

શબદ એક અંતર ઝકઝેરે ગયાં અમે પણ જાગી (૪૨)

અમે બીજને હુકમ કર્યો તો વૃક્ષ ખીલ્યું તત્કાળે (૩)

બીજ એક રોપું ને તરત જ બેસું વૃક્ષ વિસામે (૩૮)

તેજ્યુતિમાં બોળી હો જાણો આંગળીઓ પાંચે (૮)

લિયે આશકા લીલાપુરુષ ભભકે પાંચે અંગુલિ (૧૧)

આ ઉપરાંત, નિઝ (૮, ૨૦, ૨૭, ૨૯, ૩૦, ૩૬,

૪૫, ૬૬), બ્રહ્મ (૨૮, ૩૩, ૪૮, ૪૮, ૭૯), બ્રહ્માંડ (૧૭,

૪૪, ૬૯), શૂન્ય (૧૦, ૨૦, ૩૬, ૪૦, ૫૪), હંસ (૨૩,

૨૮, ૩૦, ૬૨), મોતી (૨૩, ૨૮, ૩૦, ૩૫, ૪૨, ૬૨),

વગેરે બીજી અનેક પંક્તિઓ અને સૌથી વધુ મુરશિદને

લગતી પંક્તિઓ મળે છે. એ સાથે વાંચી-સરખાવી જોવાથી

## કેટલુંક પુનરાવર્તન પકડી શકાશે.

આ પુનરાવર્તનોમાં જ્યારે રચનારીતિનાં પુનરાવર્તનો ઉમેરાય છે ત્યારે તદેવત વધી જાય છે. અમે, નહિ, એક, તો, હોય તે, એ તો, એ જ, એવા, આ, કોઈ, કે, શું વગેરે શબ્દોનો પંક્તિરચનામાં પુષ્ટ આધાર લેવાયો છે. ઘણી જગતાએ તે માત્ર લયપૂરક બનીને આવે છે. ત્યારે લયનિષ્પત્તિમાં પણ તેની સાર્થકતા જણાતી નથી.  
પદ : ૨૫ (એ તો, તો, શું, એવા, કને, એ જ); પદ : ૪૩ (તરત જ, એક, જે, એવો, એવી, એવા, હો જે); પદ : ૪૪ (તો, તો આ, જ, પછી, તે, જો) જોવાથી આ સ્પષ્ટ થશે.

આ રચનાઓ લયનિર્હણની બાબતે પૂરો સંતોષ આપતી નથી. એક જ ગીતઢાંચો સ્વીકારવાથી લય-વૈવિધ્યની શક્યતાઓ રહી નથી એટલે બધી રચનાઓ એકસરખા નિશ્ચિત લયબંધમાં વહે છે. આ નિશ્ચિત લયની પ્રવાહિતા જગતી રાખવામાં કવિ પૂરેપૂરા સફળ થતા નથી. શબ્દમોહની જેમ લયમોહ પણ રચનાપક્ષે હાનિકારક બન્યો છે. આ પદીમાં ઘણી એવી પંક્તિઓ મળે છે કે દેખીતી રીતે લયબંગ થતો ન લાગે છતાં લય જગતવા માટે, પંક્તિમાં જુદા જુદા સ્થાને સ્વરભાર આપવો પડે છે. આ લયશૈથિય વિશે કવિ સજાગ તો છે. એના સંકેતો રચનાઓમાં મળે છે. એક (પદ : ૩, ૬, ૨૬); રૂહો (પદ : ૫૩) અને રૂહેતો (પદ : ૫૫) એમ હવન્ત ચિહ્નથી ઉચ્ચારણો સૂચવાયા છે. જ્યાં સૂચવાયા નથી ત્યાં પણ પઠનગતિને દૃત કે વિવંબિત કરવી પડે એવી અનેક પંક્તિઓ મળે છે. માત્ર થોડાં ઉદાહરણો જોઈએ. લયસ્થલનનાં સ્થાન ઘાટા અક્ષરે લખ્યાં છે :

- બેય ઓગળી ગયા ચાંદનીની આંચે અલબેલા (૨)
  - અમે બહારવટિયા, - અમને અંદરથી કરવા જબે (૬)
  - સોળ સજી શાશગાર ધૂમે કાપુષુણી પરણોતર (૧૬)
  - એની સંગે પરમસ્નેહથી વાડકીના વ્યવહારા  
જાગને જોઉ તો જગત્ દીસે નહીં રે દોબારા (૫૨)
  - ત્રિભુવન આખું લીધું ટાંચમાં ભલભલાને ભૂ પાઈ (૭૩)
  - મુરશિદ બનેની ઉપરવટ જઈ ધાર્યું કરી લાવે (૭૪)
- ‘પદપ્રાંજલિ’નું અંતિમ પદ ‘સાધો, પૂર્ણ સકલ

તીર્થાટન’ સંગ્રહનું સમાપન બની રહે છે. આ પદમાં યોજાયેલા ષટ્પદ, પદપદ, વિપદ, પદવિન્યાસ, નિજપદ, ધ્રુવપદ, પદપ્રાંજલિ એમ અનેક શબ્દ વડે આ સમગ્ર પદલીલા. વિલસતી જણાય છે. આ પદની ‘ચતુર્વર્ક તે ચકિત થઈને મહિજન રચતી મૌને’ એ પંક્તિમાં કોઈ સૂક્ષ્મ રીતે સંતાયેલો અહંભાવ વાંચી શકે. અંતિમ પંક્તિ : ‘બંજન નહીં બંજના સાંદુ પદપ્રાંજલિ ભિક્ષાટન’માં કવિએ પદરચનાનું પ્રયોજન સ્પષ્ટ કર્યું છે. પરંતુ બંજના પ્રાપ્તિની આશાએ ભાવકે આરંભેલું ભિક્ષાટન અંતે લયપાચ્યુર્ય અને ભાષાભારની બંજનપ્રાપ્તિમાં પૂરું થાય છે. બંજન અને બંજનાનો ‘આ’ ભેદ ભોજનાનંદ અને કાવ્યાનંદ વચ્ચે હોય એટલો છે. એથી વિશેષ તો કાવ્યાનંદ અને બ્રહ્માનંદ વચ્ચે હોય ટેટલો છે.

અધ્યાત્મિક કવિતાને માત્ર કવિતાના ધોરણે જોવી એમાં કોઈને સરલીકરણનો દોષ વહોરવા જેવું લાગે. પરંતુ અધ્યાત્મ ભલે ગમે તેટલો, ગહન અનુભૂતિનો વિષય હોય; છતાં એ અનુભૂતિને અભિવ્યક્ત કરવાનું એક માત્ર માધ્યમ ભાષા છે. ઓછામાં ઓછું કવિ માટે તો એ સાચું છે. હિવ્યાનુભૂતિને કાવ્યાનુભૂતિમાં પલટાવવાનો પડકાર કવિએ ઉઠાવવાનો છે. બાવનબહારું છે એને બાવનમાં જીલવાનું છે. અનહદને ભાષાની સરહદમાં જેંચી લાવવાનું છે. એમાં જ કવિની ખરી કસોટી છે. અનુભવના સ્તરે જે સિદ્ધ થયું તેને હવે કવિતાના સ્તરે સિદ્ધ કરવાનું છે ત્યારે ભાષા અને કવિતાનાં ઉપકરણોની ભૂમિકાએ કવિ પ્રતીતિકારકતા જન્માવી શકે તો જ અનુભૂતિનું સત્ય કાવ્યનું સત્ય બને. એટલે કવિતાના ધોરણે આખો મામલો પ્રથમ પહેલો ચકાસવો પડે. અહીં એ ઉપકમથી ‘પદપ્રાંજલિ’ની રચનાઓ તપાસવાનો પ્રયત્ન કર્યો છે.

અર્વાચીન કવિતાનો ઈતિહાસ જેતાં જણાશે કે અધ્યાત્મનું નિરૂપણ કવિઓ માટે હંમેશાં પડકારણ બન્યું છે. અધ્યાત્મ જેવા સંકુલ, તરલ ગહન અનુભૂતિસત્યને શબ્દસ્થ કરી કાવ્ય સિદ્ધ કરવું કર્પણું છે. એમાં એકસરખી ઊંચાઈઓ આંબવી ને ટકાવી રાખવી એ કોઈ પણ કવિ માટે અધરી વાત છે. એની પ્રતીતિ આપણને કવિએ કવિએ થતી રહે છે. અહીં પણ થાય છે. વિલક્ષણ રીતે થાય છે.

ઘણાં વર્ષો પહેલાં ‘કુમાર’ની બુધસભામાં હરિકૃષ્ણ પાઠકનું એક ગીત બચુભાઈ રાવતે ઉમંગભેર વાંચેલું ‘ડાળ બટકણી, લટકયા રે –’. ‘રે–’ પછી એક સાંપ્રદાયિક ધર્મધૂરંધરનો નિર્દેશ હતો. હરિકૃષ્ણમાં એક નાગરી માર્મિકતા છે તે ક્યારેક આવી તીક્ષ્ણ આકમકતાથી ને મોટે ભાગે ઢાવડી સૂચકતાથી એમની કવિતામાં વ્યક્ત થતી રહી છે. ‘અડવાપચીસી’માં એનો નિખાર હતો. માણસમાત્રમાં રહેલું, પણ બીજાની દસ્તિએ જ પકડાતું, વૈચિત્ર્ય એમાં વક વાણીમાં પ્રતિબિંબિત થયેલું. છંદ-લય એકદમ સાઝ, પદ્ધાવલી સુધાર, એથી આભિવ્યક્તિ પ્રવાહી હતી. કવિતાને આગળ રાખીને જ એમણે નર્મ-મર્મથી ઉદ્દીષ્ટને – જે કંઈ કહેલું હતું એ બધું – ચીંદ્યું હતું. અડવો આપણાં યાદગાર વક-ચરિત્રોમાં એક ઉમેરણરૂપ બનેલો છે.

આ ‘રાઈનાં ફૂલ’માંય અડવો છે ખરો, પણ ઘણાંમાંનો એક છે. એટલે કે કવિને કશુંક કહેવા-જોગું લાગે એવાં વધુ ક્ષેત્રો વિસ્તર્યા-વકર્યા છે. અહીં એ બધાંને એમણે લાભ આપ્યો છે ! ‘અડવાપચીસી’થી આ કાલ્યોનું એક જુદાપણું એમણે નિવેદનમાં નોંધ્યું છે કે, ‘અહીં માણસની અંદર ઝાંખવા સાથે તેના બાબ્ય પ્રવર્તન અને જાહેર પ્રશ્નો અંગેના વલણ-વર્તન અંગેના મારો પ્રતિભાવો વ્યક્ત થયા છે. એટલે કે જાહેર જીવનમાં થતી ઊથલ-પાથલ અંગે અને તે વિશે ચાલતા ઊખાપોહ અંગે મને જો જુદું કે સામા છેડાનું કહેવાનું પ્રાપ્ત થતું લાગ્યું છે તો તે બધું બેન્નિક કલ્યું છે અને હું માનું છું કે આમ કરીને મેં મારો નાગરિક ધર્મ બજાવ્યો છે.’ (પૃ. ૬) એમણે એ બધું, ત્યારે લેખો-પત્રોરૂપે પણ લખ્યું ને આ કટાક્ષકાલ્યો રૂપે પણ લખ્યું. કાલ્યો રૂપે લખ્યું ત્યારે એમાં તિર્યક્ષ ચિત્રાત્મકતા ઉમેરાઈ ને ભાષાના લાક્ષણિક બહેલાવનો સ્વાદ પ્રગટ્યો એ વિશેષ લાભ.

આ સંગ્રહનાં હળવા-નીખાં કાલ્યોનો આરંભ ‘રત્નાવળી’ – ગુચ્છથી થાય છે. અહીં નવ નહીં પણ એક એકથી અધિકાં દસ રત્નો છે-કવિ એને ‘દશાવતારો’ની

‘અવતાર દશા’ કહે છે એ સૂચક છે. ગુજરાતના દસ મુખ્ય મંત્રોનોના લાક્ષણિક ચિત્રો એમણે, સંતારી સંતારીને પ્રગટ કરેલી રેખાઓથી દોર્યાં છે, એટલે મૂળ સંદર્ભોના પાકા પરિયવાળા વાચકોને વધારાનો કોયડા-ઉકેલ આનંદ પણ મળે ન બાકીના વાચકો અર્ધપારદર્શકતામાંથી કેટલુંક પામી શકે. જોકે હરિકૃષ્ણે કંઈક વધારે સાવધાની પણ રાખી જણાશે. પરંતુ, આ કાલ્યોનો જે ખરો આનંદ છે તે તો બહુધા નિર્દ્દેશ વકચિત્રાંકનમાં અનુભવાતી માર્મિકતાનો છે. એવા થોડાક લસરકા જોઈએ :

એક હાથમાં શ્રીફળ જાલ્યું, બીજે હાથે પડો;  
જોનારાંસે જોયું : હરખો હતો લેણમાં ખડો. (પૃ. ૩)  
ભણ્યો હોત તો ભલું હતું પણ લણવામાં મંડાણો;  
કોઈ કહે : ગાલોજ શઠ છે, કોઈ કહે : છે શાશો.  
(પૃ. ૭)

અને નીચેની કરીમાં આવેખાયેલું ચિત્ર તો એ રાજકારણ ઉપરાંત આ સાહિત્ય-જગતમાં પણ જોવા મળે એવું છે એથી આપણણું મનોરંજન બેવડાય છે –

હજૂરિયા હલકારા દેતા : ખમા, પણાને બાપા !  
વસવાયાં વહીવટ કૂટે ને ગોર કરે ગોલાપા ! (પૃ. ૧૦)

છંદનો પ્રવાહ અસ્થિરિત હોવાથી પદ્ધરૂપ પણ આસ્વાદે રહે છે. માત્ર એક જીવાએ છંદલયની અર્થલય સાથે સંગતિ સધાર્ય નથી એ ખચકો નડતરરૂપ લાગે છે. પાંચમા કાલ્ય (પૃ. ૫)માં બે સ્થાને ‘ગંગાવતરણ’ શબ્દ આવે છે એ ચતુર્થજલના સંવિઅવર્તનમાં છેદાઈને ગંગા/-વતરણ એમ વાંચવાની ફરજ પાડે છે. આવો સમાસ આ છંદને સદે એમ નથી. પણ બસ, આ એક અપવાદ જ.

‘અડવાસપત્રક’ ઘણી રીતે રસપ્રદ છે. અડવાનું આ પુનઃપ્રાગટ્ય ‘ચૂંટણી ટાણે’ થયું એ નાટ્યાત્મક પણ છે ને કટાક્ષકમ પણ. પહેલું કાલ્ય જાહેર ચૂંટણીને લક્ષ્ય કરે છે

તો તરત બીજું કાવ્ય સાહિત્ય પરિષદની મધ્યસ્થની ચુંટણીને લક્ષ્ય કરે છે – કવિએ રાજકારણ અને સાહિત્યને છેટે પડવા દીધાં નથી. કવિનું ત્રીજું લક્ષ્ય છે – અખબારી જગત (પૃ. ૧૮). અન્ય કાવ્યોમાં અડવાનો જાહેર તેમ વ્યક્તિગત ચહેરો પણ દેખાય છે – ક્યાંક ઉપહાસપાત્ર, ક્યાંક કરુણાપાત્ર પણ. એમ માનવ-ચરિત્રના સાથે રંગ અહીં છે.

અહીં, ઘણી જગ્યાએ, કટાકણા પટવાનું ઢાવનું હાસ્ય આગળ રહે છે એ હળવાશ પણ ગમે એવી છે :

કહો આપ, હું સાંભળું, મને સાંભળો આપ,

વાણીમાં નહીં કાપ – લોકશાહી એમાં વસી. (પૃ. ૧૪)

ધાર કાઢવામાં પ્રાસની મદદ પણ સરસ મળી છે. સાહિત્યવાળા ઉમેદવારો પણ કંઈ ઉત્તરે એવા નથી હોતા – એ અડવાએ બતાવી દીધું છે. દેખાડવાની પણ (રમૂજી નીવડતી) છટાઓ હોય છે ! ‘કોઈ પ્રતિજ્ઞાબદ્ધ છે, ને તીખા કો તોખાર, / વાણી તણી વખાર કોકે વુંટાવી દીધી.’ (પૃ. ૧૫). અને એટલે જ અડવાને લાગે છે કે આ તો ‘ખુલ્લેખુલ્લાં પાટિયાં ને ધાનાં ધાનાં છાણ’ છે. કવિનો કટાક ક્યાંક, છૂપો રહેવાને બદલે અકળામણ થઈને પ્રગટ થઈ ઊઠ્યો છે :

સરસ્વતી તો બાપડી ઢીલી, વ્હીલી, રંક;

કાઢે કોનો વાંક ? પેટે જ્યાં પાણા પડચા !

સાહિત્યને વિષય કરતી રચનાઓમાં રમૂજ, ટિખળ, ઠણ્ઠો, કટાક એ બધાં ક્રૈશલ અજમાવાયાં છે ને એ આપણાને મુક્ત, ખુલ્લા હાસ્યના આનંદ સુધી પણ લઈ જાય છે. ‘ત્રણ ઉખાણાં’માં ત્રણ સારસ્વતોનાં ટિખળ-ચિત્રરામણ છે પણ ઉખાણાં જટ ઉકેલી શકાય એવાં છે – કવિએ ઉકેલ-સંકેતો(કલૂજા)થી ઘણી મદદ કરી છે ! – છીક ‘કર્ક રાશિનો મરદ’ (પૃ. ૫૫) જેવાં સ્પષ્ટ ઈંગિતો આયાં છે. અલબત્ત, આ ચિત્રો ઓળખાયા પછી વધુ આસ્વાદ બને છે. (એ જાણીને જ એમણે ગુંચો સરળ રાખી હશે ?)

નગર વસે છે’માં થોડો કટાક છે, જાજી તો મજાક છે – નબળી સર્જકતા મોટી મહત્વાંકાંકા સાથે મેળ પાડવા બેસે ત્યારે હંમેશાં પ્રગટે એવી મજાક છે. ઉપાડ જ રસ પમાડનારો છે –

પાંચ-સાત-પંદર કવિઓ ભેળા શે બેસે,

પછી શબ્દને ડાધા પાડે, પાદા લૂંછે, નગર વસે છે. (૩૪)

‘નગર વસે છે’ નામના આવા સંપાદનને થોડાક સ્વાશ્રયથી, પ્રકાશન-યોગ થયો. એ કેવો છે ? :

અહો પ્રકાશક અદ્યે રસ્તે આવી મળીયા !

કહો, કોઈએ દીંહું છે કે પાડો દૂઝે ? – નગર વસે છે

(૩૪)

મનહર મોઢી, રમેશ પારેખ આદિ કવિઓ વિષેનાં કેટલાંક કાવ્યો સરસ છે, સુરેખ છે. પણ એમાં સુ-રેખાઓ જ છે, વક રેખાઓ નથી એટલે ‘રાઈનાં ફૂલ’માં એ અળગાં પડી ગયેલાં જાણાય છે.

રાઈની તિખાશનો અનુભવ આપનારી સૌથી વધુ રસપ્રદ રચનાઓ તો ‘ગઝલ’ને તાકનારી ત્રણ રચનાઓ છે. પહેલી, ‘તો એની તુમાખી’ ૧૯૮૭માં ‘શબ્દસૂચિ’માં પ્રગટ થઈ ત્યારે તરત લિલાયેલી – વખણાયેલી. બેસુમાર ગઝલો માત્ર જોડનારા (ઓસેમ્બલ કરનારા)ની ગતિ-રીતિ અને મનસ્થિતિના બધા લક્ષ્ણ વિશેષો, આ શોર-સપ્તકમાં હાજર છે. ‘મિજાજાના એક નકારવાચક પર્યાય ‘તુમાખી’ની, રદીંફ તરીકે પસંદગીમાં જ વંગ ઊંચકાઈ આવ્યો છે ને એણે હળવાશભર્યા ઉપહાસને જગા કરી આપી છે. કાવ્ય અલબત્ત આસ્વાદલેખના બરસું છે એટલે અહીં તો મત્તા ને મક્તાના શોરના નિર્દેશો જ પર્યાપ્ત લેખાશે :

ગઝલ ગાઈ નાખી તો એની તુમાખી

ન ખિસ્સામાં રાખી તો એની તુમાખી

કવનની બધી બારીઓ દીધ વાખી

ખૂલી એક રાખી તો એની તુમાખી (૪૭)

ગઝલ વિશેનો પ્રતિભાવ ગઝલમાં આપવાનું એક મજાકભર્યું કારણ એમણે નિવેદનમાં નોંધું છે : ‘ગઝલ સિવાયનું કશું વાંચતા જ ન હોય તેમના સુધી [આ સિવાય] પહોંચનું કેવી રીતે ?’ પણ હરિકૃષ્ણ, હજુ એક જોખમ છે : પોતાની જ ગઝલ સિવાયનું કશું વાંચતા ન હોય તેમના સુધી.... ?

કવિની નારાજગી ગઝલપરસ્તી સામે છે, ગઝલ સ્વરૂપ સામે નથી એ બીજા કાવ્ય ‘ગઝલની ધા’માં સરસ આલેખાયું છે. ‘બહાર મને કાઢો’ (રદીંફ)નું આ કવિતા-

આકંદ આ બે કડીઓથી પણ સાક્ષાતું થશે -

આ ઘાણ ઉપર ઘાણ ઉપર ઘાણ ઉત્તરે છે.

કાચા અને કુવારાથી બ્હાર મને કાઢો.

બે વાત મારે ઊંચી કહેવી છે નજીકતથી

આ હોલ ને નગારાથી બ્હાર મને કાઢો.

વાણસી ગયેતા મુશાયરા પરનો આકોશ વેદનાને ધેરી કરવા  
ઉપર ઊપસી આવ્યો છે :

આ તાવીઓ ટ્પાકા, આ નાચ અને નખરાં

આ નાટકી નાગારાથી બ્હાર મને કાઢો (૪૮)

તીજી કૃતિ સારી છે, પણ પહેલી બેની તુલનાએ  
કીલી પરી જાય છે.

રાઈના જીણામાં જીણા ફૂલની તિખાશ પણ કેટલી  
ચોટવાળી હોય એનું એક દણાન્તે પૂરતું થશે :

કાગડા છો ને બધી કાળા રહ્યા.

એકતાનું મૂલ્ય કેં ઓછું નથી.

કવિ જેને નાગરિકર્થમં કહે છે એનો (યુણય)પ્રકોપ  
નિકૃષ્ટ પત્રકારત્વ ('દુનિયાને શીખ દઈએ'), કહેવાતા  
બિનસાંપ્રદાયિકતા-વાદીઓની દાખિકતા ('રંગ મોલમાં  
રીડ', 'ઉપાલભના દોહરા') અને પ્રતિબદ્ધ જનવાદીઓની  
અતિરેકી જડતા ('કલાવાદીઓને ખુલ્લી ધમકી') - વગેરે  
સામે પ્રગટેલો છે. ત્યાં, ક્યાંક ક્યાંક, એમનું હૈયું કે હાથ  
'હળવાં' રહી શક્યાં નથી. એ કદાચ સ્વાભાવિક પણ છે.  
'દુનિયાને શીખ-' એ ગંગલ 'ચોથી જાગીરના  
લેભાગુઓને' અર્પણ કરીને એમજો પોતાનો આશય સ્પષ્ટ

કર્યો છે. એ લોકોનાં વખાણ (!) એમના મુખે મૂકીને એમજો  
બંગ સિદ્ધ કર્યો છે એટલે આ રચનાઓ કાવ્યરચનાઓ  
છે : 'નવનીત નહીં' પામો/આ વાંઝિયાં વલોણાં-માં  
અખબારી નિસ્સારતા ને નિર્શેકતા, તો 'ખટવો, નહીં' તો  
કરશું / ખુલ્લ થઈ વગોણાં-માં હીન આસેપવૃત્તિ - બ્લેક  
મેઇલિંગ અસરકારક અભિવ્યક્તિ પામ્યાં છે.

'રંગમોલમાં...' -માં રંજક હાસ્યકવિતાના લય-ઢાળ  
અને પ્રાસ-નીતિનો સહારો લઈને એમજો 'બૌદ્ધિકલાલો'ની  
ખબર લીધી છે. તો, ઉપાલભના ૨૦-૨૧ દોહરામાં એમનો  
હિંદુ-અભિગ્રહ વિગતે, કર્દીક મુખર મોટા અવાજમાં  
પ્રગટ્યો છે : 'બૌદ્ધિકોએ આચર્યા અનરથ - અત્યાચાર...  
તુરક-બિરાડરમાં ભળી, 'સેક્યુલર'ની નાત !' 'નિરીક્ષક'ને  
પાને, કાવ્યને પણ લેખ જેટલું જ 'સુ-ગમ' રાખવા માટે  
એમને પોતાની નર્મ-મર્મ શક્તિઓ ઓછી પડતી લાગી  
થશે ? અલબત્ત, એમનો આકોશ સાચો છે - અંદરથી  
આવેલો 'વળતો' પ્રખાર છે.

રમૂજ-કટાકની કવિતામાં પ્રાસંગિકતા ને  
તલકાલીનતાના સંદર્ભો રહેવાના. એના વિના કેટલાંક  
ઠિંગિતો અલક્ષ્ય બની રહે. એમજો નિવેદનમાં, ને ઘણાં  
કાવ્યોની નીચે એવા સંદર્ભો નોંધ્યા છે એ સારું છે.

પણ આખરે તો આ રચનાઓ કાવ્યરૂપે જ મનમાં  
વસવાની - ને એવી હશે એટલી જ વસવાની. હરિકૃષ્ણની  
પણ પહેલી નિસબત તો કવિતા જ છે ને કવિતા કરવાની,  
પદ્યપ્રયુક્તિઓ અને ઉપકરણો સમેતની સર્જક-સૂઝ  
એમનામાં છે ને એથી આ 'રાઈનાં ફૂલ' જોવાં-આસ્વાદમાં  
ગમે એવાં છે.

### અતિરેક - જિતેન્દ્ર પટેલ

પાર્શ્વ, અમદાવાદ, ૨૦૦૫; કા. ૧૮૨, રૂ. ૧૦૪

### વિવિધ માનવભાવોનું આલેખન

### જયંત ઉમરેઠિયા

જિતેન્દ્ર પટેલની વાર્તાઓ વિષયવસ્તુ, પાત્રો અને ટેક્નિકની  
દસ્તિએ નોખો સૂર પ્રગટ કરે છે. તળપ્રદેશની - બોલીમાં  
આવેખાયેલી - તેમજ નગરજીવનની બંને પ્રકારની  
વાર્તાઓમાં પાત્રોનાં મનોસંચલનો રસપ્રદ છે.

પહેલી વાર્તા 'બંધ' છાશવારે પળાતા બંધ અને  
વિરોધના સૂરથી શરૂ થાય છે. પરંતુ એની આડશામાં ઘરમાં  
ચાલતા ખટરાગ વગેરે સૂચક બની રહે છે. બજારમાં  
આવતીકાલે બંધ હોવાની વાતે શાકભાજ લેવાનું પુત્રવધૂને

કહેલું પરંતુ પુત્રવધૂની સ્પષ્ટ ના સાંભળી વાર્તાનું મુજબ પાત્ર જ્યંતીલાલ પોતે જ શાકભાજી લેવા જાય છે. પત્નીને ના પાડતા ગયા કે પુત્ર નવીન આવે તો ખબર ન પડવા દેતા કે પોતે શાકભાજી લેવા ગયા છે. પાછા ફરે ત્યારે પહેલા જ ઘરમાં આવતા નવીનને ખબર પડે છે કે બાપુ બહાર ગયા છે અને પતિ-પત્ની ઝઘડી પડે છે. બનેના ઝઘડામાં પુત્ર રવિને માચામાં વગાડી બેસે છે. દાદા-દાદી રવિને સમજાવે છે કે કોઈ પૂછે તો કહેજે “લપસી જવાથી વાગ્યું છે” પણ રઢ પકડીને રવિ એક જ વાક્ય બોલે છે કે “કુંઈ નહિ, પાપાએ વગાડ્યું છે. મેં તો એમની સામે કીછી કરી દીધા છે.” સવારે ઊંઠાની સાથે જ જ્યંતીલાલ ‘લોકોએ બંધ પાય્યો છે કે નહીં?’ એ જોવા જાય અને કહેતા જાય કે “એ બહાર જતો ન રહે એનું ખાસ ધ્યાન રાખજો.” બહાર દુકાનો, લારી બધું રાબેતામુજબ ખુલ્લાં છે પણ પાછા ફરતાં જુદે છે કે પોતાનું જ ઘર બંધ છે અને આંખોમાં જગ્યાણીયાં આવી જાય છે. સંગ્રહની આ પ્રથમ વાર્તા ઘણુંબધું કહી જાય છે. બહારના તોણન કરતાં ઘરની અંદરનો ખટરાગ વધારે તીવ્ર છે. એની પ્રતીતિ વાર્તામાં સહજ રીતે થાય છે. ‘મંદી’ વાર્તામાં મોડે સુધી ઓફિસના કાર્યમાં પરોવાઈ રહેતો અજય અને પોતાના ઘરની બાજુનું મકાન ખાલીખમ હોવાને કારણે એકલતાથી પીડાતી પત્નીની વથા આવેખન પામી છે. મંદીને કારણે કોઈ આસપાસનાં ઘરોમાં રહેવા ન આવે ન ભાડૂઆત આવે એ ખાલી કરીને જતાં રહે છે. પત્નીની બીજે રહેવા જવાની ઠંચા છે પણ પોતે રહે છે એ ફ્રેટ મંદીના કારણે નથી. વેચાતો. ઘણા સમય પછી બાજુના મકાનમાં કોઈ રહેવા આવવાનું છે એની ખુશાલીમાં પત્ની આતુરતાથી એ લોકોની રાહ જુદે પણ સમય મુજબ પાડોશી રહેવા ન આવ્યાં ને આવ્યાં ત્યારે હવા-ઉજાસ અપૂરતાં હોવાનું બહાનું કાઢી, મંદીમાં જોઈએ તેવાં મકાન મળે છે ત્યારે આવા અંધારિયા ફ્લેટમાં શા માટે રહેવું? કહીને આધાત આપી જાય છે.

વાર્તામાં નાયિકાની એકલતા પાછળ બાળક ન હોવાની સ્થિતિ પણ ડોકિયું કરી જાય છે. જેમ કે “બહેન મળતાવડાં છે, ટ્રિવન્સ છે એમને. એકને તો તમારે જ મોટો કરવાનો છે એવું કહેતાં હતાં” આવા સંવાદો એકાદ વખત આવે છે પણ એથીય વધારે એકલતા કોઈ આસપાસ રહેતું

ન હોવાની છે. આવી સ્થિતિનાં વર્ણનોમાં કયારેક વધારે પડતા ભાવુક સંવાદો પણ વાર્તામાં પ્રવેશી ગયા છે. વર્તમાન સમયમાં એવી વિગતોનો તાળો બેસતો નથી.

‘ગાંધી’માં ‘આની મોટી બહેન કે આ?’ આવી શરૂઆત જ શીર્ષકને ચરિતાર્થ કરે છે. વાર્તાની નાયિકા ગતિની ઓછી ઊંચાઈ લગ્ન કરવામાં બાધારુપ બને છે. એ જન્મી ત્યારે એક અનુભવી બાઈ બોલી ઉઠેલી : ‘ગાંધી !’ - એવા સંવાદો પરથી અને છોકરાઓ જોવા આવે ત્યારે ઊંચી એડીનાં ચખ્યાલ પહેરી, ટંદ્રાર ચાલવાનું આદિમાં નાયિકાની ઓછી ઊંચાઈ અને પરિણામે લોકોની વિચિત્ર મશકરીઓનો ભોગ બનતી નાયિકાની વથા આલેખન પામી છે. કોઈ જોવા આવે ત્યારે બે વર્ષ વધારીને ઉમર કહે તો ય નાની લાગતી નાયિકાને છોકરો જોવા આવે ત્યારે ઢગલાંધ સૂચનાઓ આપી દેવાય પણ ‘એક જગ્યાએ વાત’ થયા મુજબ ‘નીચો છોકરો’ જોવા આવવાનો છે એવી વાતથી કુદુંબમાં સર્વત્ર આનંદ આનંદ થઈ જાય છે. આવનાર પાત્ર ઊંચાઈમાં નીચું હોવાથી ગતિને પોતાની મરજી પ્રમાણે ઊંઠવા-બેસવાનું કહેવામાં આવે છે. ઉમર પણ છે એટલી જ કહેવાની પણ સમસ્યા ત્યાં થાય છે કે છોકરો નાયિકા કરતાં ય વધારે ઓછી ઉમરનો છે. આ વખતે ઉમરમાં એ મોટી છે એવી સ્થિતિ વધુ એક વખત નાયિકાને નિરાશ કરે છે.

‘દીપી. નંબર’ વાર્તા લેખકની અલગ ઓળખ ઊભી કરતી વાર્તા છે. અહીં હાસ્ય મુજબ છે. ફીન એ પતિ-પત્નીની ઉપાધિનું કારણ બને છે. સામાન્યપણે સર્વત્ર જોવા મળતી સમસ્યાને લેખકે અહીં વાચ્યા આપી છે.

‘પડદા પરનું દશ્ય’ વાર્તામાં નાયિકા લગ્નજીવનના શરૂશરુના ગાળામાં બાલ્કનીને મનમોહક જગ્યા માને છે. પોતાને ખૂબ ગમતી આ જગ્યાએ બેસી નાનાં-નોટાં કામો કરી સમય પસાર કરતી નાયિકા માટે બાલ્કની જ સમસ્યાનું કારણ બને છે. બાલ્કનીમાં બેસી રસ્તા પરનાં દશ્યો જોતી નાયિકા માટે અક્સમાત, લોકોનાં ટોળાં, મારપીટ, ગોળીબાર આદિ કાયમનું બની જાય છે અને એ જ સમાચાર ઓફિસેથી આવતા પતિને રેજેરોજ આપે છે. આ દશ્યો જોતાં જોતાં જ અજાણપણે પતિની ચિંતા કરી તેમે પણ ઓફિસ આ રસ્તેથી જાવ છો, ધ્યાન રાખજો,

બીજો રસ્તો હોય તો ત્યાંથી જો – એવી મનોવ્યાધિનો શિકાર બની બેઠેલી નાયિકાની દયનીય સ્થિતિનું આલેખન કરવામાં વાર્તાકાર સફળ રહ્યા છે.

‘રાતપાળી’માં શહેરમાં કાકાને ત્યાં નાની ઓરડીમાં રહી મિલમાં મજૂરીકામ કરતા નાયકનો વતનનો તલસાટ તીવ્યપણે રજૂ થયો છે. કાયમ રાતપાળી કરતા કાકા અને બહુ દોરા-ધારા કરવા છીતાં સંતાનસુખ ન હોવાનું હુંઘ વેઠતાં કાકી ‘પાણા એટલા દેવ’ કરીને દિવસો ગુજરે છે. એક રાત્રે મિત્રો સાથે ફિલ્મ પાછો ફરે છે ત્યારે ઘરનાં બારણાં પાસે આવતાં ‘અંદર ધીમો ગણગણાટ’ સાંભળતો નાયક કાકાને આજ ખાતું બંધ હોવાથી ધરે છે એમ માની રેલવે સ્ટેશનના બાંકડા પર બાકીની રાત કાઢે છે પણ સવારે વાતવાતમાં ‘સવારે તારા કાકાને એકલા જોઈને મારો તો જીવ તાળવે વધો ગયેલો’ એવી કાકીની ઉંઠિત નાયકને હચમચાવી મૂકે છે. મિલની નોકરીથી કંયાળેલો નાયક વતનમાં પાછો ફરે છે. કાકીને સારા દિવસો જાય છે એની જાણ કરતો કાકાનો પત્ર અને સમય જતાં કાકીએ દીકરો જણ્યો એવી ખબરે બાપુ નાયકને ફરી કાકાને ત્યાં ‘છોકરો રમાડતો આવને !’ એ બહાને જવાનું કહે છે. અહીં ‘રાતપાળી’ એ વાર્તાનું અને નાયકના મનનું કેન્દ્રભિંદુ બની રહે છે. ‘છોરો કોના જેવો લાગતો હશે ?’ એવી અવફવમાં ફસાયેલા નાયકનો પ્રશ્ન ભાવકચિત્તને પણ કોરી જાય એવો છે.

‘રેલ’ વાર્તામાં પિયર આવેલી લાખુને વરની જગ્યાએ સસરા તેડવા આવે ને કમને સાથે જવા તૈયાર થતી લાખુનો રોષ સસરાની નિસાસાભરી વાતો સાંભળતાં મન બદલાઈ જાય છે. રાતના ઉજાગરા કરીને કારખાને પસાયતાનું કામ કરતો પત્ર, પત્નીને લાવવા માટે રેલભાડું ભેગું કરે, બીમાર પડે એવી વાતો અવાચક બની સાંભળતી લાખુ વાર્તાનો સ્વીકાર તો કરે છે પણ અંતે આવતું વાક્ય એના મનના ઉગ્ર રોષનો પડઘો પાડે છે : ‘આતા મારી મૂકો ગાડું. આ રેલ શું આપણને આંબી જાતીંતી ?

‘વાવડો’માં ઘરની નબળી સ્થિતિ અને આશાઓ પર પાણી ફેરવી નાખતી સ્થિતિ જેવો પુત્રને લગતો આધાત અંતે તીવ્ય પ્રતિક્રિયા રૂપે મુકાયો છે.

ગ્રામ-પરિવેશનું જીવંત આલેખન અને જીવનની સંકુલ સ્થિતિઓનું આલેખન કરતી વાર્તાઓના દ્યાંત તરીકે ‘ઉજાગરા’ વાર્તાને મૂકી શકાય. તો ‘ઘર’ નામની વાર્તામાં નાયિકા આરતીની આસપાસ ગુંથાય છે. પોતાના ઘરને કાયમ સ્વચ્છ, બિલકુલ વ્યવસ્થિત રાખવા ટેવાયેલી આરતી પોતાના પતિ પાસે પણ એવી જ અપેક્ષા રાજે છે પણ પતિનો પ્રતિપ્રશ્ન છે કે એના કરતાં તું તારી જીદ છોડી દે તો ? – કદાચ પતિ કરતાંય ઘરને ચોકસાઈની દસ્તિએ વધારે મહત્ત્વ આપતી આરતીની ધૂન એક ગ્રંથિ બનીને જડતાનું પ્રતીક બની રહે છે. અકરમાતમાં પતિના મૃત્યુથી ભાંગી પડેલ આરતી, ઘરને અસ્તવ્યસ્ત રાજે છે એવી સ્થિતિમાં પતિથી વિશેષ કંઈ નથી-નો ભાવ તીવ્યપણે વ્યક્ત થયો છે.

‘પસંદગી’ વાર્તામાં હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા પુત્રનું સંવેદન અને ડિવોર્ચી માતાપિતા વચ્ચે જોલાં ખાતા પુત્રની વેદના આલેખન પામી છે. સમય જતાં મમ્મીનું અવસાન થાય ને પણ્યા બીજાં લગ્ન કરી લે છે એની જાણ થતાં પુત્રનું મન પણ્યાને ન મળવા માટે મજબૂર કરે છે. પણ્યાએ આપેલ કીમતી ઘડિયાળ કચરાપેટીમાં ફેક્ટો પુત્ર હાથ પરથી ભાર ઊતરી જતાં જાડે હળવાશનો અનુભવ કરે છે. ઘડિયાળનું કાંડા પરથી ઊતરી જવું જાડે ભારજલ્લા સંબંધના અંતનું સૂચન કરે છે.

આ ઉપરાંત ‘ટોસ’, ‘ચેપ’, ‘પરસ્પર’ વગેરે વાર્તાઓમાં પાત્રોના મનોસંચલનો ખૂબીપૂર્વક આલેખાયાં છે. ‘ઠયળ’ વાર્તા માત્ર મેસના મહારાજ અને વિદ્યાર્થીઓ વચ્ચેના અનુભવનો રસપ્રદ કિસ્સો બની રહે છે. કેટલીક વાર્તાઓ પાત્ર, પ્રસંગ અને સંવાદોના માધ્યમને કારણે પણ માણવી ગમે તેવી છે. મધ્યમવર્ગનાં પાત્રો, ગ્રામીણ-શહેરી જીવનો પરિવેશ, પરિસ્થિતિ, એકલતા, એકાદ સંવેદનને વિકસાવી વાર્તામાં ઢાળનું, સરળ શૈલી અને ભાષાદસ્તિએ આ વાર્તાઓ લેખકને અન્યથી જુદા પાડે છે. ક્યાંક વાક્યની ગોઈવણી, મુદ્રણદોષ નજરે ચરે છે પણ એવાં સ્થાનો બહુ ઓછાં છે.

‘અતિરેક’ વાર્તાસંગ્રહની વાર્તાઓ વિવિધ રૂપ્યિના ભાવકો અને વાર્તાઅભ્યાસીઓને વાંચવી ગમશે.

## પરોઢિયે કલરવ – ગુજરાતી શાહ

આર. આર. શેઠ, મુંબઈ અમદાવાદ, ૨૦૦૫; કા. ૧૮૦, રૂ. ૧૦૦

ગાયસથ મનો રિમ્કાવ્યો

રાધેશયામ શર્મા

પંડિતયુગાનુરક્ત પીઠ વિવેચક વિષ્ણુપસાદ ર. ત્રિવેદી ક્યારેક એમના અવલોકનમાં ઊંઘીલોલેથી શરૂ કરવાની પદ્ધતિને દ્રાવિડી પ્રાજ્ઞાયામ કહેતા. ‘પરોઢિયે કલરવ’ને ચોથા પુંદ્રથી આવી પદ્ધતિ પ્રયોજી વાંશીએ તો ગ્રંથસાર સમી કન્નેન્ટનો એકદરે અંદાજ આવી જાય : પક્ષીઓ પ્રાર્થના નથી કરતાં, પક્ષીઓ કીર્તન નથી કરતાં. એમનો કલરવ એ જ એમનું કીર્તન. કલરવની નજીક પહોંચી શકે એવો માનવીય સ્વર કયો હોઈ શકે ? નરસિંહ મહેતાએ રચેલાં પ્રભાતિયાં ગાતી વખતે થતું પ્રભુકીર્તન કલરવના કુળનું જણાય છે...

પણ રૂકો, થોભો – આ તો ગ્રંથારંભે શીર્ષસ્થ નિબંધની જ ગાય-પંક્તિઓ છે. શું આ ગાય છે કે ગાયકંકુલીંટી પદ્ય કન્યકા છે ? કર્તાએ રજૂ કરેલા નિબંધોને મનો-ઉર્મિકેન્દ્રી (Psycho-lyrical) નિબંધો રૂપે ઓળખાવ્યા છે અને એવા બધા લેખો અને એનાં શીર્ષકો પણ ગાયસ્થ મનો-ઉર્મિકાવ્યોના ઉચ્ચાવચ સારાનરસા નમૂના છે :

‘ગુલાબ, રુઅબ, શબાબ’ (પૃ. ૧૦), ‘એક વાદળને આવ્યું સપણું’ (પૃ. ૧૦૧), ‘અહીં બુલબુલનું અભિવાદન છે’ (પૃ. ૧૧૧), ‘પ્રેમપત્રની ઝીણી ઝીણી કાપલીઓ’ (પૃ. ૧૩૦) ‘ટહુકે ટહુકે શબ્દો’ (પૃ. ૫૬), ‘સર્જકના એકાંતની પરીક્ષા’ (પૃ. ૧૪૮), ‘વરસાદમાં સ્નાન કર્યા પછી પવન ચોખોચાણક’ (પૃ. ૧૬૩) અને લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ નિબંધ ‘કવિવર રવીન્દ્રનાથની જીવનસુગંધ’ (પૃ. ૬૦).

પશ્ચિમ અને પૂર્વના વિચારલોકમાં ફેર છે. અહીં ‘Psycho’ શબ્દને ચૈતસિક અધ્યાત્મસંયુક્ત અધ્યાસ હોય જ્યારે ત્યાં ‘સાયકો’નું સાહચર્ય આલ્ફેડ હિચકોકની ટેરર-મેકાબર ફ્લિંમ સભ્યતા સાથે ઉદ્ભાસે.

વૈશિક સંપ્રત્યયો સાથે રહી, ભારતીય દર્શન પરંપરાની વિભિન્ન ધારાઓને પોતાના ચૈતસિક અભિગમોમાં ગુંથી લેવાનું કૌશલ્ય આ લેખોમાં અધિક

વર્ત્તિશે : ‘તપોવન, એકેદેમી અને યુનિવર્સિટી’ (પૃ. ૧૦૫), ‘વિચાર કંઈમુક્ત હોય ત્યારે’ (પૃ. ૧૫૦), ‘વીસમી સદીને છેલ્લી સલામ’ (પૃ. ૩૫), ‘આત્મકથા લખવામાં જોખમ છે’ (પૃ. ૧૨૦), ‘મરણની પળ લગી માણસ ‘પતન-પૂર્વું’ નથી’ (પૃ. ૧૬૭) ઈત્યાહિ.

સડકતપ્ત કડક મિત્ર વિવેચક ચંદ્રકાન્ત ટોપીવાળા અંતરંગ મિત્રો આગળ ગુજરાતભાઈ જેવા વિચારકોને ‘પોપ’ ચિંતકો રૂપે ચિત્રરતા હોય છે ! આ લખનાર ઉન્તાંભુ (મહિયાના શબ્દોમાં ‘ઊંચભમરિયા’) આ-લોચકો સાથે આંશિક સહમતિ જ દર્શાવે. ઓપ હોય કે પોપ, ‘પરોઢિયે કલરવ’ સુણી આ નિબંધકાર જાગતિક કોલાહલો તરફ શાહમૃગવૃત્તિનું જરૂરી સેવન કરતા નથી; દૈનિકોની કટારોમાં, સામયિકોના વિભાગોમાં સામાન્ય વિશાળ પાઠકવર્ગની સાથે કંધો મેળવી વ્યક્તિ – ઘટના – વિચાર પ્રત્યેનું વલશ તત્કાલ ધ્યાન પર બરાબર લાવવા માટે વિરોધ; વિષમ જેવી શૈલીઓ યોજી ઉદાર પત્રકારધર્મ અદા કરે છે. દા. ત. ‘ગુજરાતનો (અ)નાથ અને પાટણની લઘુતા’ (પૃ. ૮૮), ‘વીસ વર્ષનો ડોસો, અંસી વર્ષનો યુવાન’ (પૃ. ૧૨૫), ‘મુંબઈમાં બેચેન થવા માટે પ્રયત્ન કર્યો ન પડે’ (પૃ. ૧૫૪), ‘સન ૧૯૧૮માં અમદાવાદ કેવું હતું ?’ (પૃ. ૨૭), ‘પાણીપોચો અને પેટછ્યો માશસ’ (પૃ. ૮૮), ‘ઉધાર પુસ્તક મફત મળે તોય નકામું’ (પૃ. ૧૩૪), ‘કાનની કેળવણી વિના કેળવણી અધૂરી’ (પૃ. ૩૧).

ધરિત્રીને ધાત્રીવત્ત ધારણ કરતો (સત્ત્ર-) ધર્મ, માત્ર સાંપ્રદાયિક ના હોય. એવા પરિબ્યાપક શુદ્ધ ધર્મની વાતને અંડોળીને કયો વિચારક જંથી શકે. અને આ ગુજરાતની તો એમનાં એકાવિક લેખનોમાં ગાયકાવ્યોના ગુજરો ઝીલી ઝણકાવી શક્યા છે. દા.ત. : ‘પ્રજક્ષિશોર મોહિ વિસરત નાહીં’ (પૃ. ૧૪), ‘ભક્તનું હૃદય ભગવાનનું દીવાનખાનું’ (પૃ. ૧૧૫), ‘ધર્મપ્રોદ કે પ્રેમધર્મ’ (પૃ. ૧૭૮), ‘હરેક ઈમાન કો એક ચોર દરવાજા હોતા હૈ’ (પૃ. ૧૭૫), લેખકને માથેરાન જવાનું થયું તો ત્યાં પણ ‘સત્તંગ’ માંડ્યાં, કોની

સાથે ? ‘પક્ષીઓ અને વૃક્ષો સાથે સત્તસંગ !’ (પૃ. ૧૪૨).  
લિતિ નિબંધકાર પક્ષીઓ સાથે સત્તસંગ માણી,  
ટહુકામાંથી ખરતા શબ્દો જીવી ધ્યાનાકર્ષક, ટડી શકે એવા  
'ટહુકામંત્રો' - તાણાંહિસાઅહિસાને જાકારો દેવાના  
યુગધર્મપૂર્વક - પણ વેરે છે :

પ્રેમની ઝંખનાના મૂળમાં  
માનવીની અપૂર્જાતા રહેલી છે  
અપૂર્જાતા પવિત્ર છે. (પૃ. ૫૬)  
અપૂર્જાતા અભિશાપ નથી, પરંતુ  
પરમેશ્વરની અધૂરી કાવ્યપંક્તિ છે. (પૃ. ૫૭)  
સુરદાસ સાવ સાચું કહી ગયા.  
સબસે ઉચ્ચી પ્રેમસગાઈ ! (પૃ. ૫૮)

ટહુકે શબ્દો જીત્યા પછી આવતા લેખ યાગોરની  
'જીવનસુંગંધ' નિબંધમાં કવિવરના પ્રેમ-અનુભવની ગણન  
નિષ્ઠળતા ('નાણ્ણનિડ ?' 'ચારુલતા ?') લેખકે 'પ્રાણવાન  
શબ્દો' લેખે સયુક્તિક પ્રસ્તુત કરી છે :

નિષ્ઠળ નીવડેવા પ્રેમ થકી  
જીવન વધુ સમૃદ્ધ બન્યું છે (પૃ. ૮૩)

નરસિંહ મહેતાના ડોકાતા સંદર્ભો સાથે ઉમાશંકર  
- રાગની લહર પણ કેટલાક ફેમમાં જબકી જાય છે : 'મટ્રો  
ટ્રેનમાંથી બધાર નીકળ્યા પછી ચારે દિશામાં ફેલાયેલાં  
પીળાં બોગડામાં ચાલતી વખતે દૂરથી આવતો મંગલધ્વનિ  
કાને પડે છે' (પૃ. ૫) સુજ્ઞોને અહીં મંગલધ્વનિ સાથે  
ઉમાશંકરનું 'વિશ્વશાંતિ' સાંભરે. પૃ. ૩૪ ઉપર આદિલ  
મનસૂરીને નિમંત્રા છે : 'મૌનમાં જો મળી શકતું હોય,  
કોઈ શું કામ ગજલમાં આવે ?' 'હાઈકુરશિમ'  
જીજાભાઈને અવતારી આયા છે : 'પતંગિયું ત્યાં / થયું  
અલોપ, / શૂન્ય ગયું રંગાઈ' (પૃ. ૧૧૪). આટલું જ અહીં  
છે એમ નહીં, વિરિક્લ નિબંધોમાં નિજનું જ ગુણ-ગાન,  
શાહનું ઓરદાર્ય કરે એવું નથી. વિખ્યાત ફેન્ચ ખગોળવિદ્  
એલેક્ઝાન્ડર ઓનોફ્ને - આપણા ભક્તકત્વ નરસિંહ  
શિરોમણિ સાથે સામે મૂકી - ઉત્તમપણે રમતા મેલ્યા છે.  
કથનની અંતિમ પંક્તિ સૂત્રબદ્ધ વાખ્યાનો અહેસાસ  
આપે :

ખગોળનો અભ્યાસ એટલે ભૂસાઈ ચૂકેલા  
ઇતિહાસનો અભ્યાસ !

'વીસમી સદીને છેલ્લી સલામ' જેવા ટચુકડા લેખમાં  
મનુજ ઇતિહાસની ફોઈડકચિત ત્રણ કાંતિઓના  
ઉલ્લેખ સાથે લેખકે ઓશો રજનીશની છયાથી સ્પષ્ટ  
નિરીક્ષણ મૂક્યું છે : 'શમશામાં પૂરાં થતાં અધૂરાં અરમાનો  
પર ચેતન મનનો કાબૂ નથી હોતો. ભલભલા મહાત્માને  
ક્યારેક શમણામાં એવી સ્ત્રી પજવી જાય, જેને માત્ર એક  
વાર જોઈ હોય.' (પૃ. ૩૬)

મનાલી, માઉન્ટ આબુ, મુંબઈના સહપ્રવાસોમાં  
તત્કાલીન 'આચાર્ય'-એ જાહેર કરેલું કે કેટલાક  
રડ્યાખડા જૈન સાધુ ખાનગીમાં પોર્નો. ફિલ્મો જોવાની  
ઈચ્છા વ્યક્ત કરતા ! ભારતની પ્રજા 'મહાત્મા'-જીના  
બ્રહ્મચર્ય પરીક્ષાના તથ્ય-પ્રયોગોથી સુવિદ્ધિત છે. આ સંદર્ભે  
ઈસુ પર વારી ગયેલી મેરી મેડેલિનાનું ભાવગીત 'જિસસ  
ધ સુપરસ્ટાર' ફિલ્મનો ઉલ્લેખ તથ્યસૂચક છે. સંલગ્ન  
કથન લેખકનું જાગતિક સાથે વૈયક્તિક ઉત્તરદાયિત્વ સિદ્ધ  
કરે છે : "ભગવાનનું પાષાણીકરણ થઈ જાય ત્યારે ઈસુ  
પણ લાચાર ! કદાચ મેરી મેડેલિનાની પાછળ પથ્થરમારો  
કરનારા ટોળામાં આપણે પણ સામેલ હતા" (પૃ. ૪)

સંચયના બે જ લેખોને, મહિમા-શીલ ગણાવવા પડે  
તો કવિવરની 'જીવનસુંગંધ'વાળો અને બીજો ગુજરાતી  
સાહિત્ય પરિષદના ૪૧મા અધિવેશનમાં 'નિબંધ' વિષયના  
વિભાગીય અધ્યક્ષ સ્થાનેથી આપેલું ૨૮-૧૨-૨૦૦૧નું  
વક્તવ્ય, જેમાં કર્તાએ 'નિર્મિતિના લયની શોધાનું બીજું  
જરાયું હતું. અહીં રિલ્કે - બાશો - ગીતા - તુલસી -  
અભ્રાહમ કાઉલી - વિનોબા - સ્વામી આનંદ - કિશનસિંહ  
ચાવડા - પ્રિસ્ટલી અને ખાસ તો એકિસ મેનેલનાં ઉત્તમ  
પ્રદાનોની સમાવૃત્તિ કરી કર્તાએ સુરેશ જોખીની લિતિ  
નિબંધકેત્રે પ્રાપ્ત સિદ્ધિનોમાં શિરીષ પંચાલ - જયંત  
પારેખની સાથે સહમતિ પ્રકટ કરી એમાં એક બહુશ્રુત  
વિદ્વાની શ્રદ્ધા-અંજલિ સમું તર્પણ પણ હતું :

'સુરેશ જોખીના નિબંધોમાં પ્રગટ થતું શબ્દશિલ્પ  
કેવળ મનોહારી બનીને થીજી જનારું ન હતું, પરંતુ  
મનનશીલતાને હળવેકથી જગાડનારું હતું. એમાં  
લાલિત્યનો જે લય પ્રગટ થતો તેમાં ક્યાંય ઉપદેશનો

અણસાર ન હતો.' (પૃ. ૫૦)

પ્રસ્તુત નિબંધો વિશે પણ 'મનોહારી', 'મનનશીલ' જેવાં વિશેષજ્ઞો (તેઓ જ્યારે જનાદિજમની ઝાપટમાં પ્રાસલીલા, શબ્દરમત, ચાટૂકિઓ, સુરેશ દ્વારાના કવેતાઈ શૈલીસુખોથી મુક્ત હોય ત્યારે) બેશક પ્રયોજ શકાય, પણ લાલિત નિબંધ પૂર્તી પાળ પરેજ હોવી ઘટે કે ત્યાંએ 'ઉપદેશનો અણસાર' ન હોય.

ગુણવંત શાહે એમના મૂર્ધન્ય નિબંધમાં સમભાવપૂર્વક બોધસૂચન કર્યું છે : 'પરોદ્ધિયે કલરલ જીલવાનું કામ, માત્ર કાન પર છોડવા જેવું નથી. આપણા સમગ્ર અસ્તિત્વને એકદું કરીને કલરવને રોમરોમથી પામવાનો છે'... સમગ્ર અસ્તિત્વને એકત્રિત કરી બ્રહ્મ-ગુજનને રોમરોમમાં પામનારા 'ઉપદેશસારમ્'ના સથા મહર્ષિ રમણ આ કાણો સાંભરી આવ્યા મને તો !

### નિર્ણય ઐતિહાસિક લેખસમુચ્ચય : ૧,૨ – મધુસૂદન ઢાંકી સંશોધનનું એક સીમાચિહ્ન

કસ્તૂરભાઈ લાલભાઈ સ્મારકનિધિ અમદાવાદ, ૨૦૦૦;

ડાલકાઉન : ઉર્ફ (ખંડ-૧), ઉર્ફ (ખંડ-૨), રૂ. ૫૦૦ (બનેના)

હેમંત દવે

સામૃત સમયે ગુજરાતમાં ઈતિહાસ-સ્થાપત્ય-શિલ્પ-મધ્યકાલીન સાહિત્ય ઠ. વિદ્યાશાખાઓના સંશોધનમાં જે દારુણ સ્થિતિ પ્રવર્તી રહી છે એનો પ્રત્યે આ વિષયોમાં પ્રકાશિત થતાં સંશોધનપત્રો, સંશોધન સામયિકોમાં સાંપદી રહે છે. મૂળ સ્લોત સુધી જવાની આગસ, ભાષાકીય અણઆવડત (આતૃભાષા સમેત), સંદર્ભ (ગ્રંથ) આપવાની શાસ્ત્રીય પદ્ધતિનું અજ્ઞાન, સંશોધન માટે અનિવાર્ય એવા વિશ્વેષણાત્મક અભિગમનો લગભગ સંપૂર્ણ અભાવ અને ચર્વિતર્ચર્વણા – આ આપણા 'સંશોધન' લેખનનાં કેટલાંક 'વ્યાર્વત્ક' લક્ષણો છે.<sup>૧</sup> આવાં દૂષણોથી યુક્ત લાયાણો, સંશોધનપત્રને નામે જ અલબત્ત, પરિસંવાદોમાં અને અવિવેશનોમાં રજૂ થાય છે, અને પોંખાય પણ છે.<sup>૨</sup> આવા વાતાવરણમાં ભારતીય દેવાલય-સ્થાપત્યના જીવંત જ્ઞાનકોશ સમા મધુસૂદન અમીલાલ ઢાંકીના આ બે ગ્રંથ ઉત્તમ ઐતિહાસિક સંશોધન શી રીતે થઈ શકે, કરી શકાય તે માટે માર્ગદર્શકની ગરજ સારે તેવા છે.

નામ પરથી જ સ્પષ્ટ છે કે આ લેખોનું વિષયવસ્તુ નિર્ણન્ય કહેતાં કૈનધમના ઈતિહાસ સાથે સંબંધિત છે. અને મુદ્રિત થયેલા મોટા ભાગના લેખો<sup>૩</sup> પહેલાં અન્યત્ર સંશોધન-સામયિકોમાં પ્રકાશિત થઈ ચૂક્યા છે. પરંતુ સામાન્ય રીતે સંશોધન-સામયિકોમાં પ્રક્રિય થયેલા લેખોનો ઉપયોગ કરવો હંમેશાં સરળ હોતો નથી. આપણે સંશોધન

માટે આવાં સામયિકો પાસે જવાની ટેવ કેળવી જ નથી. (કોઈપણ વિદ્યાશાખાનો પીએચ.ડી.નો શોધનિબંધ જોવાથી કે સંશોધનપત્ર જોવાથી આ વાતની પતીજ પડશે.) એટલે આવા મૂલ્યવાન લેખોમાં ઉદ્ઘાટિત થયેલું સત્ય તે તે ગ્રંથમાં જ ફ્લૂશાયેલું પડી રહે છે, અને તેના કારણે જૂની અને ખોટી માન્યતાઓ ચાલતી આવતી રહે છે, અને પરિણામે, 'ઈતિહાસને નામે કેટલાંયે અગાઉથી ચાલ્યાં આવતાં, ને ચીલાચાલુ, જૂઠાં લાખાણો થતાં જ રહ્યાં છે ને એનાં પુનરાવર્તનો અને પુનઃ પુનઃ ઉપયોગ પણ થતાં જ રહ્યાં છે.' (પ્રથમ ખંડ, લેખકનું વક્તવ્ય, પૃ. ૧૧). અગાઉ પ્રક્રિય થયેલા લેખોમાં પણ, જો પ્રકાશન પછી કાંઈ નવાં તથ્યો ઉપલબ્ધ થયાં હોય તો તેમને લેખકે આમેજ કરી લીધાં છે.

આ લેખસમુચ્ચયના પ્રથમ ખંડમાં ઉર્ફ લેખ છે અને તેનું મુખ્ય વસ્તુ જૈન અથવા નિર્ણન્ય સાહિત્યના ઈતિહાસ અને વિવિધ કૃતિઓની આધારભૂત વાચનાઓનું છે. દ્વિતીય ખંડ મુખ્યત્વે સ્થાપત્ય તેમજ અભિલેખસંબંધી પ્રશ્નો તથા તેમના સંભવિત ઉકેલોને લગતો છે. અહીં લેખસંગ્રહની જ્ઞાનગીની દાખિયે સમીક્ષા કરવા માટેની જરૂરી સજજતા – એટલે કે, નિર્ણન્ય સાહિત્યનું ઊંડું જ્ઞાન, ગુર્વવિલિઓની જીણી માહિતી, સ્થાપત્ય અને શિલ્પસંબંધી આવશ્યક તજજ્વતા કે તત્સંબંધી અભિવેશોની તલસ્પર્શી

જાણકારી – મારી પાસે નથી એ બાબતે હું સભાન છું, અને (એથી) એ મારો ઉદેશ પણ નથી.<sup>૫</sup> મારો હેતુ અને તેમની સંશોધનપદ્ધતિના નિર્દર્શનનો છે.

લેખક સર્વપ્રथમ પોતાના વિષયને લગતા ચૌ પુરાવા એકઠા કરે છે, તેમનો આગ્રહ સામાન્ય રીતે પોતાના વિષયમાં પૂર્વ થઈ ગયેલા કામને જોઈ જવાનો છે.<sup>૬</sup> પોતાનાં પ્રમાણોની અવિકૃતતા તેમજ વિશ્વસનીયતા તપાસ્યા પછી એની વિગતોની શક્ય તમામ દસ્તિએ જીવી પરીક્ષા કરે છે. વિભિન્ન પુરાવાઓને આધારે પ્રાપ્ત થયેલી છૂટીછવાઈ હીકટોને તેઓ મેળવે છે, ને તેના આધારે પોતાના નિર્જર્ખ પર પહોંચે છે. તેમના નિર્જયો તેમના પુરાવાઓને આધારે છે, અને પુરાવાઓને આધારે પ્રાપ્ત થતા નિર્જર્ખને તેઓ, કદાપિ ધર્મ-સંપ્રદાય કે સમાજને ઈતર કારણોસર અસ્તીકાર્ય વાગે તો પણ, પ્રકાશમાં વાવવાનું ચૂકૃતા નથી. (તેમના અસંખ્ય લેખો આ બાબતની સાહેદી પૂરશે.) તેમનું દરેક મહત્ત્વપૂર્ણ વિધાન આધારભૂત અને શ્રદ્ધેય સોતને આધારે છે, અને આ સોત તેઓ અચૂકપણે નોંધે છે – પુસ્તક કદાચ હાથવગું ન હોય તોપણ એનો નિર્દેશ પણ કરે છે. તેમના સંશોધનની ગતિ આમ પુરાવા-પ્રમાણથી નિર્જર્ખ તરફની છે.<sup>૭</sup> ઘણાં વિદ્વત્તાપૂર્ણ લખાડોમાં લેખકો પુરાવાઓના પરીક્ષણ-મૂલ્યાંકન પૂર્વે જ પોતાને – ઘણી વાર સમાજ કે સંપ્રદાય કે પક્ષે કેવળ શ્રદ્ધા કે માન્યતાને આધારે સ્વીકારી લીધેલો – અભિમત નિર્જય બાંધી લેતા જોવા મળે છે, ને પછી પોતાના તારણને પુષ્ટ કરે તેવાં સાક્ષોની યાદી રજૂ કરે છે પુરાવા જો પોતાના નિર્જયની વિરુદ્ધમાં જતા જણાય તો તેનું વિકૃત અર્થધટન કરવામાં આવે અથવા તો એની સરિયામ ઉપેક્ષા જ કરવામાં આવે.<sup>૮</sup> આવાં લખાડોનો ઉદેશ સત્યશોધન કરતાંથી ઈતર પ્રકારનો હોય છે સ્પષ્ટ છે.<sup>૯</sup>

પરંતુ જ્યાં મધુસૂદન ઢાંકી પોતાના પૂર્વસૂરિઓ કરતાં જુદા પડે છે, ને પરિણામે તેમનાં મન્તવ્યોની સમીક્ષા-ચિકિત્સા કરવા પ્રેરાય છે ત્યાં પણ તેઓ ઉત્તમ નિર્ગ્રન્થ પરમ્યરાને અનુરૂપ પૂર્વપક્ષને અયનત સ્પષ્ટ રીતે અવિકૃતપણે રજૂ કરે છે, ને પછી એનાં તર્ક-દલીલ-પ્રમાણ, ઈ.ની મર્યાદા એકાધિક પ્રમાણોથી ચીધી બતાવે છે.

‘ઐતિહાસિક પારિપ્રેક્ષયમાં’ “નમસ્કારમંગલ” , લેખમાં લેખકે બતાવ્યું છે કે સામ્રાત સમયનો નવકારમંત્ર, એના વર્તમાન સ્વરૂપમાં, ઈસુની છહી સદીથી વધારે પ્રાચીન નથી. શિલાલેખો તેમજ વિવિધ કૃતિપાઈના પુરાવાને આધારે તેમજો આ મન્ત્રનો ઐતિહાસિક વિકાસ પણ દર્શાવ્યો છે કે કેવી રીતે ઈ. પૂ. ૨૪-૧૧૩ સદીનો એકાંક્ષરી મંત્ર ‘નમો અરહતાનં’ કે ‘નમો અરહતાનં’માં કમશા: બીજાં ચરણો ઉમેરતાં ગયાં, ને છેવટે હાલનો નવ ચરણવાળો નવકારમંત્ર અસ્તિત્વમાં આવ્યો.<sup>૧૦</sup>

સ્વામી સમન્તભદ્ર જૈનદર્શનના ક્ષેત્રમાં વિરલ પ્રતિબા મનાયા છે. સામાન્ય રીતે ભારતના ઈતિહાસમાં બન્નું છે તેમ સ્વામી સમન્તભદ્રનો સમય નિશ્ચિત નથી. ટેટલાક જૈનમતાવલંબી વિદ્વાનોએ પોતાના સંપ્રદાયને પ્રાચીનતર ડેરવાવાની લાલચમાં તેમનો સમય શક્ય એટલો વધારે જૂનો – છેક ઈ. પૂ. ૧૧૩ સદીથી ઈ. સ.ની શરૂઆતની સદી – સિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો છે. ‘સ્વામી સમન્તભદ્રનો સમય’ એ લેખમાં લેખક આ આખા પ્રશ્નની પુનર્વિચારણ કરે છે. લેખક એમના પૂર્વસૂરિ વિદ્વાનોના નિર્જર્ખની સંપૂર્ણ સમીક્ષા, એમજો રજૂ કરેલાં પ્રમાણો અને દલીલોની પ્રથમ સુવાંગ રજૂઆત કરીને તથા તેમને અન્ય પ્રમાણોના સંદર્ભમાં મૂલવી જોઈને કરે છે, અને પછી પોતાના તરફે પુરાવાના નવીન અર્થધટન દ્વારા તેમજ અન્ય વિદ્વાન્યાઓમાંથી આણેલાં પ્રમાણોની મદદથી આ વિદ્વાનોએ, આંકિ આપેલા સમયને ગેરવાજબી ડેરવી બતાવે છે. અન્ય વિદ્વાનોના મન્તનું ઝંડન કર્યા પછી લેખક સમન્તભદ્રની કૃતિઓની આંતરિક તેમજ બાબ્ય પરીક્ષાને આધારે – દા.ત., દાર્શનિક પરિભાષાની પાકટતા, મૂર્ત્વવિધાનના ઉલ્લેખો, અને સાવિશેષ તો તેમની કૃતિઓમાં જોવા મળતી સંસ્કૃત કાવ્યની સ્થિતિ<sup>૧૦</sup> - ને આધારે – તેમનો સમય ઈ. સ. ૫૫૦-૬૨૫ સિદ્ધ કરી બતાવે છે. આ લેખ લેખકની બહુશુત્તતા, પારદર્શી તર્કગવેષણ, સંપ્રદાયથી પર રહીને જોવાની વસ્તુલક્ષિતાને કારણે તેમની વિરોધ મુદ્રા ઉપસાગવાનારો લેખ બની રહ્યો છે.

જૈન પરંપરામાં પાદલિપ્ત નામક નાશ આચાર્ય થઈ

ગયા છે, અને તેમાંના એક આચાર્યે નિર્વાણકલિકાની રચના કરી છે; પરંતુ કયા આચાર્યે તે સ્પષ્ટ નથી. ‘પાદલિપ્તસૂરિ વિરચિત ‘નિર્વાણકલિકા’નો સમય અને આનુષ્ઠાનિક સમસ્યાઓ’ એ લેખમાં લેખક સાવચેતીપૂર્વક ઉપલબ્ધ પ્રમાણોની સૂક્ષ્મ પરીક્ષા દ્વારા ફૂતિનો સમય, અને એ રીતે મુનિસ્વયંનો સમય, દસમી સદીના ઉત્તરાર્ધમાં મૂકી આપ્યો છે, અને એ રીતે તેમને ઈ.સ.ના બીજા-નીજા શતકમાં થયેલા તરંગવર્ણ કહા અને જ્યોતિષ કરંડકા કર્તા પાલિતસૂરિ-૧, અને ઈ.સ.ની સાતમી સદીમાં થયેલા ક્રિમિયાગર-સિદ્ધ નાગાર્જુનના મિત્ર-કિવા-ગુરુ પાલિતસૂરિ કરતાં બિન્ન બતાવી આવ્યા છે.

સિદ્ધરાજ જ્યાસિંહ અને કુમારપણના સભાકવિ શ્રીપાલ પરંપરાથી પોરવાડ જૈન મનાતા આવ્યા છે, અને લગભગ બધા જ અર્વાચીન અભ્યાસીઓએ કોઈપણ શંકા કર્યા વિના આ પરંપરાને સાચી માની છે. શાંતિકુમાર પંડ્યાએ તેમના એક લેખમાં આ પરંપરાની અને તે માટેનાં પ્રમાણોની ફેરતપાસ કરીને કવિ શ્રીપાલ જૈન નહીં પરંતુ છિન્દુ (=બ્રાહ્મણધર્મ) હતા એવો નિર્જર્થ તારબ્યો છે. શાંતિકુમાર પંડ્યાના આ મતને લેખકે ‘શ્રીપાલ-પરિવારનો કુલધર્મ’ એ લેખમાં પુનઃ તપાસ્યો છે. શ્રીપાલ કવિ છિન્દુધર્મા હતા એ તારણ માટે રજૂ કરાયેલી દલીલો તેમજ એ માટેનાં પ્રમાણોને લેખકે પૂર્વપક્ષ તરીકે મૂકી પોતાના તરફે એકાધિક પ્રમાણો દ્વારા તેમજ તર્ક દ્વારા શાંતિકુમાર પંડ્યાના તારણ માટે એ તર્ક અને દલીલો અપૂરતાં અને અનુપ્યુક્ત છે એમ સિદ્ધ કરી બતાવ્યું છે. ને છતાં, છેલ્લે, ‘શ્રીપાલ [...] જૈન નથી ને વેદમાર્ગી છે [...] એમ કહેવા માટે તો તદ્દન સીધાં ને નક્કર પ્રમાણોની આવશ્યકતા રહે છે; અને એવાં પ્રમાણો મળે તો શ્રીપાલપરિવારના કુલધર્મ વિશે એટલો સુધારો કરી લેવામાં કોઈ જ બાધા ન હોઈ શકે.’ એમ પણ સ્વીકારે છે. આ લેખ સંદર્ભે હ. ગ. શાસ્ત્રીની તેમના ‘પૂર્વવલોકન’માં નોંધ છે – ‘આ અભિગમ ધર્મવિનિર્ણય માટે સીધાં અને નક્કર પ્રમાણોની આવશ્યકતાનો] તેઓનો [= શ્રીપાલ કવિનો] કુલધર્મ જૈન હતો એ મતને પણ લાગુ પડે, કેમકે એ પણ પ્રમાણ વિના માની લીધેલી માન્યતા છે.’ (ગ્રંથ ૧, પૃ- (૧૬)) અલબત્ત,

શ્રીપાલ કવિ જૈન હતા તેવી સબળ પરંપરા અને મધુસૂદન ઢાંકીએ રજૂ કરેલાં સાંયોગિક પ્રમાણોના પરિપ્રેક્ષયમાં આ ટીકાનો સંદર્ભ સમજવો મુશ્કેલ છે.

‘કવિ રામચંદ્ર અને કવિ સાગરચંદ્ર’ એ લેખમાં રામચંદ્ર નામધારી બે બિન્ન કવિ વચ્ચે કેવલ નામસામ્યને કારણે અભેદ સમજવાને કારણે ઊભી થયેલી ગરબડોને નિવારવાનો ઉદ્યમ છે. એક રામચંદ્ર, તે હેમચંદ્રાચાર્યાંના શિષ્ય છે, જેમણે વિવિધ નાટકો, પ્રબંધો, ઈ.ની રચના કરી છે. બીજા રામચંદ્ર, તે જાબાવિપુર (અલોર)ના અંધકવિ રામચંદ્ર – તેમણે વિવિધ ભક્તિરસસભર સ્તોત્રો રચ્યાં છે. આ નામસામ્યને કારણે પ્રભાવકચરિત, પ્રબંધચિત્તામણિ, ઈ. ગ્રંથોમાં હેમચંદ્રાચાર્યાંના શિષ્ય રામચંદ્રને અંધ કિવા એકાક્ષ બનાવી ઢેવામાં આવ્યા, એટલું જ નહીં, ફૂતિઓના કર્તૃત્વ વિશે ઘણી અનિશ્ચિતતા ઊભી થઈ હતી. લેખકે અહીં ફૂતિઓના આંતરપરીક્ષણ દ્વારા તેમજ ગુર્વાવિલોની મદદથી બંને કવિઓનું અને તેમની ફૂતિઓનું પાર્દ્ય બતાવી આવ્યું છે અને એ જ પ્રકારે સાગરચંદ્ર નામના બે મુનિઓનો બિન્નબિન્ન સમયકાળ પણ આંકી આપી તેમના એકત્વની સંદિગ્ધતા દૂર કરી આપી છે.

પ્રભાસપાટણનાં પ્રાચીન જિનમંદિરો લેખ, અપૂર્વ અને વિશ્વંખલ પુરાવાઓને આધારે ભૂતકાળની પરિસ્થિતિ-વાસ્તવને બુદ્ધિગમ્ય અને તાર્કિક રીતે પુનર્ગઠિત કરવાનો ઉત્તમ પ્રયત્ન છે. પ્રભાસ પ્રભ્યાત શૈવતીર્થ હોવા ઉપરાંત એક મહત્વાનું જૈનતીર્થ પણ હતું. જૈન ગ્રંથોમાં પ્રભાસ જૈનતીર્થ હોવા અંગેના તેમજ ત્યાં વિવિધ જિનમંદિરના અસ્તિત્વના, ભાવે સંક્ષિપ્ત, પરોક્ષ કે અસ્પષ્ટ, એકાધિક ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. વિન્ન અમિલેખીય તેમજ સાહિત્યિક પ્રમાણોને આધારે લેખકો કહે છે,<sup>૫</sup> ‘‘જીનમંદિરો હતાં.’’ (ગ્રંથ ૨, પૃ.૨૦૪) વર્તમાનકાળે આ મંદિરો વિદ્યમાન ન હોવા છતાં તેમનું અસ્તિત્વ લેખકો તેમના ઢેવાલય સ્થાપત્યના અપ્રતિમ શાનને આધારે સિદ્ધ કરી બતાવે છે. લેખકોએ

<sup>૫</sup> આ લેખના સહલેખક હરિશકર પ્રભાશંકર શાસ્ત્રી છે.

બતાવ્યું છે તેમ, આ મંદિરો મુસ્લિમ આકમણો દરમિયાન તોડી પાડવામાં આવ્યાં હતાં અને તેમના અવશેષો-હિસ્સાનો ઉપયોગ આ જ ક્ષેત્રની વિવિધ મસ્ટિજદોના નિર્માણમાં કરવામાં આવ્યો હતો. લેખકો તેમના આ મસ્ટિજદોના કાળજીપૂર્વકના પરીક્ષણને આધારે જણાવે છે કે કુમારવિહારના અવશેષો જુમા-મસ્ટિજદમાં, આદિનાથ જિનાલયના અવશેષો માઈપુરી મસ્ટિજદમાં, નેમિનાથ જિનાલયના અવશેષો ચોગાન મસ્ટિજદમાં જોઈ શકાય છે. આ સિવાય પાનવાડી મસ્ટિજદમાં પણ મંદિરના વિવિધ હિસ્સાઓનો ઉપયોગ કરી લેવામાં આવ્યો છે. આ લેખ તેની અત્યાસરીતિને કારણે આ પ્રકારના ભાવિ અત્યાસો માટે દીર્ઘ કાળ સુધી એક માનદંડરૂપ બની રહેશે એમાં શંકા નથી.

૨. ના. મહેતા અને કનુભાઈ શેઠે તેમના એક લેખમાં તારંગા સ્થિત અજિતનાથ મહાપ્રાસાદ કુમારપાળે નહીં પરંતુ કોઈ અભયદેવે રચાવ્યો હતો તેવો નવીન મત રજૂ કર્યો હતો. આ મંત્ર્યની રોલાં બાર્તની શૈલીની યાદ આપાવે તેવી સવંગ સમીક્ષા ‘તારંગાના અર્હત અજિતનાથના મહાપ્રાસાદનો કારાપક કોણા ?’ લેખમાં કરવામાં આવી છે. લેખકે બતાવ્યું છે કે મહેતા અને શેઠની દલીલો તેમના તત્કાલીન સાહિત્યના ઉપરછલા પરિચયમાંથી, કૃતિના મૂળ અર્થને પામવાના અસામર્થમાંથી બેઢંગ અનુમાન-અટકળો, અને દોષપૂર્ણ તર્કણમાંથી જન્મી છે. લેખક ૨. ના. મહેતા અને કનુભાઈ શેઠના લેખના મુખ્ય વાક્યાંશોને ઉદ્ધૃત કરી તેમની નિરાધાર દલીલોને તેમજ પુરાવાઓના સમજણ વિના કરાયેલા અર્થઘટનને ઉધાડાં પાડી બતાવે છે. આ લેખ તેમની વંગશૈલીને કારણે બધા લેખોમાં જુદો તરી આવે છે.

### P

સામાન્ય રીતે, આ પ્રકારનાં સંશોધન-લખાણોમાં ભાષા સપાટ અને ક્યારેક કમનસીબે નીરસ પણ હોય છે, પણ મધુસૂદન હાંકીની લેખનશૈલી એવા પ્રકારની નથી, ને ઘણી વાર તો અલંકૃત પણ બની જાય છે. ચાહિએક-સર્જનાત્મક સંસ્કર્ણ ધરાવતાં વાક્યો બંને ગ્રંથોમાં ડેર્ટેર વિભરાયેલાં પડ્યાં છે, દા.ત., ‘મસ્ટિજદો મધ્યવર્તી વિતાન તો સંઘનતા

અને સૌંદર્યના ભવ્ય અવતાર સમો છે. એની અલંકાર-રચના નભોમંડળમાં ચમકતા નક્ષત્રમંડળ સમી સુશ્લિષ્ટ, ગહુન, અને કલ્પના થંભાવી દે તેવી અદ્ભુત છે. ગુજરાતમાં અસ્તિત્વ ધરાવતા વિતાનોમાં મૌલિકમંડન મહાતેજસ્વી રત્ન સમો છે.’ (‘પ્રભાસપાટણનાં પ્રાચીન જિનમંદિરો’, ગ્રંથ ૨, પૃ.૨૧૫). કે પછી વંગસભર આ વાક્યો : ‘શોધકમુખ્ય મહેતા અને સહયોગી વિદ્વાન્ન લેખકના આ અનોઝી તર્કજ્ઞા પર આધારિત વૈદ્યુતપૂર્ણ લેખ પાછળ શું [તત્ત્વમ] ઉદેશ હશે તે વિશે વિચારતાં એમ લાગે છે કે માધ્યમિક શાળા છોડી અને વિશ્વવિદ્યાલયના ઊભરે ઊભેલા વિદ્યાર્થીઓને સમ્યગ્-શોધ અને શોધાભાસ વચ્ચે વ્યાવર્તક રેખા ક્યાં દોરવી તે દર્શાવવાનો હોય.’ (‘તારંગાના અર્હત્ અજિતનાથના મહાપ્રાસાદનો કારાપક કોણા ?’ ગ્રંથ ૨, પૃ.૧૭૭).

અલબત્ત, આ પુસ્તકમાં ક્લિષ્ટ વાક્યરચના નથી એમ પણ નથી. દા.ત., ‘સ્તુતિ-ધોડાનાં ઠાંઠાં પર બેસાડેલ બેવડા કાઠાંમાં એક તરફ નય-ન્યાય, પ્રમાણ-પ્રમેય, અને બીજી તરફ સ્તુત્ય-અસ્તુત્ય, આપ્ત-અનાપ્ત, તેમજ સ્વસમય-પરસમયની ભારેખમ કોઈઓ લટકાવી, પીઠ પર વચ્ચોવચ્ચ્ય સ્વાદ્ધાનો, સપ્તભૂમિમય સપ્તરંગીનો, ગગનગામી માનસસંભ ચબાવી, મુખ વડે અનેકાંતની યશોગાથા ગાતાંગાતાં, પ્રતિસ્પર્ધી સંપ્રદાયો સામે જ્યયાત્રાએ નીકળેલા વાદીમુખ્ય સમંતબ્દની કવિતા નિર્ણન્યો સિવાય બીજા કોઈને ભાગ્યે જ ઉપયોગી થઈ શકે.’ (‘સ્વામી સમંતબ્દનો સમય’, ગ્રંથ ૧, પૃ.૨૮)

### P

આ ગ્રંથોના આયોજનમાં મને જે સૌથી મૂંજવનારી બાબત લાગી છે તે ચિત્રપટના કમાંકની છે. બીજા ગ્રંથમાં કુલ ૮૮ ચિત્રપટ આપવામાં આવ્યાં છે, ને આ ચિત્રો જે-તે લેખમાં નિર્દેશવામાં આવ્યાં છે. આ ચિત્રોને લેખનો તેમજ એ લેખના ચિત્રનો કમાંક આપવામાં આવ્યો છે, દા.ત., લેખ ૧૮, ચિત્ર ૨૫, ૧. જ્યારે પુસ્તકમાં લેખને કમાંક અપાયા જ નથી, એથી વાચકને લેખકમાંક લીધા પછી ચિત્રપટોમાં એ શોધવો પડે ! દરેક લેખમાં આ પ્રકારની શોધ વાચકનો ધ્યાનરંગ કરનારી બની રહે છે. ચિત્રોને

જો સંગ્રહ કમાંક અપાયો હોત તો તે ઘણું સરળ અને વાચક-ઉપયોગી બની રહેત.

કોઈ કોઈ ટેકાડો સંપાદનમાં પણ નાની-નાની વિગતો સુસંગત કરી લેવાનું વિસરાઈ ગયું છે, દા.ત., ‘કુમારપાળ અને કુમારવિહારો’માં ઈતિહાંધ ૭૨ આ પ્રમાણે છે : પ્રભાસપાટણના “કુમારવિહાર”ના અવશોષો ત્યાંની એક વખતની જુમા-મસ્ઝિદમાં છુપાયેલા છે. (જુઓ અમારો સ્વાધ્યાય, પુ.૩, વિ.સ. ૨૦૨ રમાં છપાયેલો ‘પ્રભાસપાટણનાં પ્રાચીન જૈનમંદિરો [તત્ત્વમ]’ નામક લેખ.) ‘પ્રભાસપાટણનાં પ્રાચીન જૈનમંદિરો’ આ લેખ આ જ ગ્રંથમાં પુનઃમુદ્રિત થયો છે (પુ.૨૦૧-૨૨૫), ને એટલો નાનકડો સુધારો કરી લેવાનો રહી ગયો છે.

p

આવા સમૃદ્ધ, મૂલ્યવાન અને કાલજીયી લેખો એક જ સ્થળે ઉપલબ્ધ કરાવી આપવા બદલ સમગ્ર ગુજરાત શ્રેષ્ઠી કસ્તૂરભાઈ લાલભાઈ સ્મારકનિધિનું ઋષી બન્યું છે.

#### નોંધો :

૧. અને એનો નિર્દેશ મધુસૂદન ઢાંકીએ પોતાના ગ્રંથમાં ‘લેખકનું વક્તવ્ય’માં કર્યો છે જ. એમના શબ્દોમાં, ‘વિશ્વવિદ્યાલયો, શોધસંસ્થાઓ આહિમાં જે લોકોની છેલ્લા દાયકાઓનાં અધ્યાપન તેમજ શોધકાર્ય માટે ભરતી કરવમાં આવી છે તેમાંના કેટલાયે એવા છે કે જ્ઞાનની એ કોત્રમાં કોઈ ક્ષમતા નથી, ગમયતા નથી, અને એથી એમની શોધકરૂપે પાત્રતા પણ નથી. શોધકાર્ય કેમ કરવું એ વાતની તજ્જાતા તો એક બાજુ રહી પણ કેટલાક તો અંગ્રેજમાં જ નઈ, પોતાની માતુભાષામાં પણ ઢંગપૂર્વક અને દોષ વગરનું કેમ લખાય તેની આવડતેય ધરાવતા નથી ! [...] હોક્ટ પર બેસાડી દીધેલા યા ચડી બેઠેલા મોટા ભાગના કહેવાતા ‘વિદ્વાનો’ અણાંડ – એટેં કે તાતીમ લીધા વગરના – છે. (ગ્રંથ ૧, પૃ.૨૦))  
અલબત્ત, ઈતિહાસ અને એની સન્નિકટ વિદ્યાશાખાઓમાં જ આવી કરુણ પરિસ્થિતિ છે એવું નથી. સમાજશાસ્ત્રમાં પણ, દાખલા તરીકે, એવી જ સ્થિતિ છે (સર્ર૦ એ. એમ. શાહ). અન્ય વિદ્યાશાખાઓમાં વાસ્તવિકતા જુદી હશે એમ માનવાને કોઈ કારણ ભાગ્યે જ હોય.
૨. આ એક સામાન્ય વિત્ત છે. અપવાદ, અલબત્ત, હોય જ.
૩. જોકે, બંને ગ્રંથમાં દરેક લેખ પહેલાં ક્યાં પ્રકાશિત થયો હતો એની વિગતો આપી છે. છતાં, બંને ગ્રંથમાં ‘નિર્જન્થ-ઉત્તમાં પૂર્વે પ્રસિદ્ધ થયેલા લેખ’ છે તે જરેખાર નિર્જન્થ-ઉત્તમાં નથી. અને

૪. આ લેખો પ્રથમ વાર જ અહીં સમુચ્ચયમાં પ્રગત થાય છે. હિન્દુલલભ ભાયાઙીએ તેમના પુરોવચનમાં વાજબી રીતે જ નોંધ્યું છે કે, ‘સંશોધનકાર્યની જે ઉચ્ચ કોટિ આ સમૃદ્ધ લેખસમુચ્ચયમાં અપાતી જોઈ શકીએ છીએ, તેને અનુરૂપ કક્ષા જાળવીને અવિકારી વિદ્વાનો એની જરૂરીકારી કરશે એવી આશા-અપેક્ષા આપણે રાખીએ.’ (ભારત્સૂચન મારું). આ કામ અવિકારી વિદ્વાન કરે તે જ ઉપયુક્ત ગણાય.
૫. દા.ત., ‘તારંગાના અર્થાતું અજિતનાથના મહાપ્રાસાદનો કારાપક કોણ ?’ લેખમાં અજિતનાથ મહાપ્રાસાદના કારાપક તરીકે કુમારપાળને સ્વીકારતા ચાર વિદ્વાનોની જે નોંધ ૨. ના. મહેતા અને કનુભાઈ શેઠ લીધી છે તે સંદર્ભે લેખક પોતાની નોંધ ૨-માં બીજા આઈ વિદ્વાનોના સંદર્ભે ઉમેરી આપે છે ! તેમની ચોકસાઈ અને સંપૂર્ણતા માટેનો આગ્રહ આપણને સ્વાભાવિક રીતે જ ઉત્તમ જરૂર વિદ્વત્તરંપરાની યાદ આપાવે. અહીં બદ્ધાંન રેસેલ એક્વિનાસની ડિલસૂફી વિશે જે માર્મિક નોંધ કરી છે તે – અહીં સરખામણી માટે ઘણી જરૂરીક હોઈ – આપવી ઉચિત ધારું છું. ‘There is little of the true philosophic spirit in Aquinas. He does not, like the Platonic Socrates, set out to follow wherever the argument may lead. He is not engaged in an enquiry, the result of which it is impossible to Know in advance. Before he begins to philosophise, he already knows the truth; it is declared in the catholic faith. If he can find apparently rational arguments for some parts of the faith so much the better, if he cannot, he needs only to fall back on revelation. The finding of argument for a conclusion given in advance is not philosophy, but special pleading.’ (રેસેલ, ૧૯૪૬/૧૯૮૬ : ૪૫-૫૪) મધુસૂદન ઢાંકી આ પ્રકારના સંશોધક નથી : એ રેસેલ કહે છે તેવા કાર્ટેન્ટિઅન પ્રકારના સંશોધક છે.
૬. કહેવાતા ‘ખાર્દ્રવાદી’ ઈતિહાસકારો તેમજ કહેવાતા ‘રાષ્ટ્રવાદી’ ઈતિહાસકારોનાં લખાણો આ માટેનાં સૌથી હાથવગાં ઉદાહરણ છે.
૭. પ્રાચીન ભારતમાં દાર્શનિક ગ્રંથોમાં નિર્જન્થ દર્શનના ગ્રંથો હુમેશાં અન્ય મત – આસ્તિક દર્શનો કે બૌદ્ધ – ના સિદ્ધાન્તો, હિન્દુ અવિકૃત નિરૂપક કરે છે, ને પછી એની વીકા કરવામાં પ્રવૃત્ત થાય છે. વિપક્ષ, બૌદ્ધો કે મીમાંસકો કે નૈયાયિકો કે વેદાંતીઓ પોતાના સિદ્ધાન્તની સ્થાપના માટે, ને પરમતના ખંડન માટે, અન્ય સંપ્રદાયના મતને ખોટી રીતે રજૂ કરવામાં કોઈ નાનપ નથી માનતા – આ સંદર્ભમાં.
૮. અડ્યાર લાઈબ્રરી બુલેટિન – બ્રહ્મવિદ્યા – ના મહાવીર જ્યંતિ વિશેષાંકમાં ગુસ્યાફ રોટનો આ જ વિષયને લગતો લેખ છે.

અલબત્ત, બનેનાં પોતાના મન્તવને પુષ્ટ કરવા માટેનાં  
પ્રમાણો ઘડો અંશો બિન્ન છે. સર્ર૦ રોટ, ૧૯૭૪.

૧૦. સ્વામી સમંતબદે પોતાની વૃત્તિઓમાં વિવિધ ચિત્રબંધોનો  
પ્રયોગ કર્યો છે, ને આ પ્રકારની પ્રયુક્તિ ભારવિના  
કિત્રાત્પાર્શ્વનિયમ (સર્જ-૧૫) પૂર્વે જોવા મળતી નથી. સર્ર૦ હે,  
૫૨૧૮૦ : [It scil. Citrabandha] is seen for the  
first time in Bharavi. અને એમ સ્વામી સમન્તબદ  
ભારવિશી બહુ દૂર હોય તેમ જીજાતું નથી.

- ૫-અ આ જ કારણે હરિવલભ ભાયાણી નોંધે છે : ‘એમના કોઈક  
નિષ્ઠાઓ જેને અસ્વીકાર્ય લાગે, તેને માટે પણ એમજો  
પુરાવાઓનું જે અર્થધાટન કે મૂલ્યાંકન કર્યું હોય છે તેની ઘણી  
ગીજાવટથી ચર્ચાવિચારણા અનિવાર્ય બનશે.’

(પુરોવચન, પૃ. ૧૧)

### સંદર્ભસૂચિ :

દે. એસ. કે. ૧૯૪૫. કાબ્ય (લિટરચર). એસ. એન. દાસગુપ્ત અને  
એસ. કે. હે લિસ્ટરી અને ક્વોસિકલ સંસ્કૃત લિટરચર. કલકત્તા :  
યુનિવર્સિટી અને કલકત્તા. પ્રેસ.

રસલ, બદ્રીન્ડ ૧૯૪૫/૧૯૮૬. લિસ્ટરી અને વેસ્ટર્ન ફિલોસોફી, ઈ.

લંડન : રાઉટલિઝ

રોટ, ગુસ્ટાફ ૧૯૭૪. નોટ્સ ઓન ધ પંચ-નમોક્કાર-પરમ-મંગલ. ઠન  
ફૈન લિટરચર. બ્રહ્મવિદ્યા, અડચાર લાઈબ્રરી બુલેટિન (મહાવીર  
જ્યંત્ર વોલ્યુમ) ૩૮ : ૧-૧૮

શાહ, એ. એમ. ૧૯૮૪. સમ રિફલેક્શન્ઝ ઓન સોશિઓલોજિકલ  
રિસર્ચ એન્ડ રીસિંગ. ઠન ઈન્ડિયા. સોશિઓલોજિકલ બુલેટિન  
૪૩(૧) : ૧-૮.

### સ્વ. ચંદ્રકાન્ત બક્ષી

ખ્યાત લેખક ચંદ્રકાન્ત બક્ષી (જ. ૨૦, ઓંગસ્ટ ૧૯૭૨)નું શનિવારે, ૨૫મી માર્ચ થયેલું અવસાન  
ગુજરાતી ભાષાના એક વિલક્ષણ ગદ્યકારની વિદ્યાર્થી છે. મુખ્યત્વે નવલકથાકાર બક્ષીજીનું વ્યાપક અર્પણ  
તો એ ઉપરાંત વાર્તા, નાટક, આત્મકથા, પ્રવાસ, ઈતિહાસ-સંસ્કૃતિ વિષયક અને વિચારલક્ષી ગદ્ય, પત્રકારી  
નિબંધ, અનુવાદ એમ વિવિધ ક્ષેત્રે શતાવિંદ્ર પુસ્તકો દ્વારા રહ્યું. અસ્તિત્વવાદી વિચારધારા, મહાનગરનાં  
વિવિધવિલક્ષણ જીવનરૂપો, સ્ત્રીપુરુષસંબંધોનાં સ્થૂળ-સૂક્ષ્મ પરિમાણો – એ બધું એમની નવલકથા-વાર્તાઓમાં  
પ્રચુર ઘટનારેણ અને અરૂઢ-ઉત્કટ ભાષાભિવ્યક્તિથી રસપ્રદ બનતું રહેલું – વિસ્મય સાથે વિવાદનેય જગત્વનું  
રહેલું. એમાં બક્ષીની આધુનિકતાવક્ષી તેમજ લોકપ્રિયતાવક્ષી, પ્રબળ, અને મુખર કરેલી, આગવી મુદ્રા હતી.  
ઉત્તેજક બની રહેતા વિચારવેગથી અને એની અસરકારક અભિવ્યક્તિથી એમનું પત્રકારી લેખન અત્યંત  
લાક્ષણીક અને પ્રભાવક બની રહેલું. આ પત્રકારી ગદ્ય પણ એમનું ખૂબ જ મહત્વનું પ્રદાન છે.

બક્ષીબાબુને સ્નેહાર્દ શ્રદ્ધાંજલિ....

શ્રદ્ધાંજલિ

## ॥ વરેણ્ય ॥

ગંડકાન્ત ગોપીવાળા

### વિરલ ગજેન્ડમૌર્ચ તકો

ગજેન્ડ મૌક્ઝિતકો – ગજેન્ડરાય બુચ સંપા. રમણલાલ યાલ્લિક, ૧૯૨૮

બ. ક. ઠાકોરે ‘આપણી કવિતાસમૃદ્ધિ’માં ગજેન્ડ બુચનું ‘ગિરનારની યાત્રા’ કાચ્ય પસંદ કરીને એના કવિ અંગે સ્પષ્ટ કહ્યું કે ‘આ પ્રતિભાવૃક્ષ અકાળે ભસ્મ થવાથી ગુજરાતી કવિતા ઉપર મોટી હોનારત ગુજરી છે’ અને સુન્દરમે ‘અર્વાચીન કવિતા’માં સ્પષ્ટ કર્યું કે ગજેન્ડ બુચની રચનામાં રસળતી અરૂઢ સરલ છતાં અર્થવાહક પદાવલિ હોવાને કારણે એમાં અર્વાચીન કવિતાના નીજા સ્તરભક્તનું એક પ્રારંભબિન્દુ જોવાય છે. વળી, હિમતલાલ અંજારિયાએ ‘કાચ્યસૌરભ’માં ગજેન્ડ બુચનાં ત્રણોક કાચ્યો પસંદ કર્યા છે. આ ઉદાહરણો એટલું તો બતાવે છે કે ગજેન્ડ બુચની કવિતાને વજન નથી આપાયું એવું નથી. પણ છેલ્લા ઘણા દાયકાઓથી આ કવિ વિસારે પડાયેલો છે. સુરેશ દલાલનું સંપાદન ‘બૃહત ગુજરાતી કાચ્યસમૃદ્ધ’ (૨૦૦૪) જ્યારે ૬૦૦ વર્ષની ગુજરાતી કવિતાની જલકાંખી આપતું હોય ત્યારે ઘણા ક્ષુલ્લક કવિઓ સંપ્રતના હોવાથી એમાં પ્રવેશી જાય અને યુગસંકેતક આવો એક મહત્વનો કવિ એમાંથી છટકી જાય એ આ વાતનો દેખીતો પુરાવો આપે છે.

કલાપી, ગિરીન જીવની, ચાવજી પટેલ, મહિલાલ દેસાઈ વગેરેની જેમ અકાળે પૂરતી પરિપક્વતા દર્શાવતા, તરુણ મૃત્યુને બેટેલા ગજેન્ડ બુચનો કાચ્યઉંઘાડ વિકાસશીલ અને એમનો પોતીકો છે. ભાઉ દાજુ પ્રાઈજ અને વેદાન્ત પ્રાઈજ મેળવવાની ક્ષમતાવાળો એમનો સંસ્કૃતનો સમૃદ્ધ અભ્યાસ, એટલો જ અંગ્રેજી સાહિત્યનો સંનિષ્ઠ પરિચય તેમજ સૌરાષ્ટ્રના સોરઠા, કવિતો, લોકગીતોમાં એમનો અસાધારણ રસ – આ બધું તો ખરું જ ખરું, ઉપરાંત મોડ મોડ થયેલા ગુજરાતી સાહિત્યના સંપર્ક એમની તર્કશક્તિ, વિવાદશક્તિ અને ભાષાશક્તિને ઠીક ઠીક પોષણ આપેલું. એમનું વેખન તો રૂપ વર્ષની ઉમરે એ અવસાન પાયા (૧૯૨૭) એ જોતાં માત્ર પાંચ જ વર્ષ ચાલેલું. પરંતુ શરૂમાં કલાપીનો પ્રબળ પ્રભાવ જીલીને તરત જ કાન્ત-નહાનાલાલને પણ અતિકમવા એ

તત્પર હતા. એમની વિકસતી આલોચક દસ્તિ પછીથી કલાપીને મૂલવે છે. કહે છે : ‘એનાં કાચ્યોને સમર્થ editingની જરૂર છે.’ આગળ વધીને એમ પણ કહે છે કે ‘આપણા સાહિત્યમાં સૈણનો આદ્યિત્વત્તક નરસિંહ કે દયારામ નહીં પણ કમનસીબ કલાપી છે.’ તો, કાન્તને બરાબર પરખે છે. કહે છે : ‘એ કવિ સાથે કળાકાર હતા. સાહિત્યમાં સ્થાપત્યભાવના(architectonics) એ સમજતા.’ આથી જ પછી કલાપીથી ફિટાઈને એમણે એકલા વેગ કે આવેગને બદલે વેગ અને આવેગની સાથે ‘વિચાર’ને પણ પુરસ્કાર્યો છે. એમણે તારસ્વરે કહ્યું કે ‘વિચારશક્તિ વગર તો ટહુકતી કોયલો પાકે.’ ‘વિચાર’ દ્વારા કવિના સરગ્રાહી તંત્રની નહીં પણ સર્વગ્રાહી તંત્રની એમણે જિકર કરી છે. એમણે કવિચેતનાને સામાન્ય મનુષ્ય કરતાં વધારે જોઈ શકતી કલ્પી છે તેમ એને સામાન્ય મનુષ્યોમાં પણ પેસી શકતી કલ્પી છે.

ગજેન્ડ બુચના આ વ્યક્તિત્વને સમેટતું મરણોત્તર એકમાત્ર સંપાદન ‘ગજેન્ડમૌક્ઝિતકો’ છે. રમણલાલ કનૈયાલાલ યાલ્લિકે ૧૯૨૮માં પ્રકાશિત આ સંપાદનમાં ગજેન્ડના જીવન-કવન પરની નોંધ સાથે ગજેન્ડ બુચનાં વેખનોને કાચ્યવિભાગ, ગાધ્યવિભાગ, કાલ્યનિક સંવાદો અને વાસ્તવિક વાતચીત. તેમજ અંગ્રેજી વિભાગ – એમ ચાર વિભાગમાં સમાવ્યાં છે; અને પરિશિષ્ટમાં ગજેન્ડ બુચના સમકાળીનોના પ્રતિભાવો લીધા છે. વિષ્ણુપસાદ ત્રિવેદી અને ડેલરરાય માંકડ, ગજેન્ડ બુચની નિકટ હોવાની એમાંથી પ્રતીતિ થાય છે. એટલું જ નહીં, પણ સુરતની કોલેજમાં અત્યંત ટૂંકી કારકિર્દી છતાં એક અધ્યાપક તરીકેની એમની ‘હદ્દયલક્ષ્મી’ અને લોકપ્રિયતા પણ અછતી નથી રહેતી. બહારથી પ્રકૃતિલિત રહેતા ગજેન્ડ બુચમાં જગતના અંધારને જોવાની એક નિપુણ દસ્તિ છે, અને એ દસ્તિને કારણે જ તેઓ તારવી શકે છે કે ‘મારામાં Simplicity of nature નથી. ક્યાંથી હોય ? જ્યાં વિશ જ highly complex છે.’ વિશની આ સંકુલતા એમને

પ્રત્યાયન તરફ દોરે છે જરૂર, પણ પ્રત્યાયન સાથે જે અપ્રત્યાયિત છે એનો બોજ પણ એમણે વહ્યો છે. કદાચ એમને મન એ જ આ જગતની મોટામાં મોટી કરુણતા છે.

એમના લેખનનું સૌથી વિશેષ અંગ ‘કાવ્યવિભાગ’માં પ્રગટ થયું છે એની અહીં તપાસ કરવાનો અને એમાંથી મહત્વની થોડીક રચનાઓને જ જુદી ર્ચાય માટે લેવાનો ખ્યાલ છે.

‘ગજેન્દ્રમૌક્ષિક્તક’ના કાવ્યવિભાગનું પહેલું કાવ્ય ‘પચ્ચીસ વર્ષ’ આમ તો એમના જીવનના છેલ્લા વર્ષમાં એટલે કે ૧૮૨૭માં લખાયું છે. કાન્તનો પ્રભાવ વધવા છતાં અને કલાપી પરતેની આલોચક દસ્તિ ઉભી થવા છતાં કલાપીનો પડછાયો ઓઢીને પણ કલાપીથી કઈ રીતે પોતે જુદા થવા યત્ન કરે છે એનો સંઘર્ષ એમાંથી જ જોઈ શકાશે. કલાપીનું જાણીતું કાવ્ય ‘જીવનખાનિ – ચોવીસ વર્ષ’ને અનુસરીને અહીં ‘પચ્ચીસ વર્ષ’ રજૂ થયું છે અને કલાપીની જેમ વસંતિલકાને જ એમાં અભત્યાર કર્યો છે. કલાપીની ‘બાત્યા ગઈ જ, ગત યૌવન છે થયું ન / મૃત્યુ તથા ય પડ્યા શ્રવણે સુણાય’ જેવી પંક્તિઓનો સીધો પડ્યો ગજેન્દ્ર બુચની ‘બાત્યા ગઈ, ગઈ સહુ દિલની ગુલાબી’ જેવી પંક્તિમાં સંભળાય છે. આ પછી અમરત્વ અને મૃત્યુની તાણનું બજ રફ્ટિક જેવી પોતીકી પંક્તિઓમાં બંધાવા પામ્યું છે : ‘આવી પડ્યા અધવરે અહીં મૃત્યુલોકે / કાં ઊંઘવું અમરને અમથું અમારે ?’ ગજેન્દ્ર બુચ મૃત્યુનો પૂર્વસંકેત પોતાને મળી ચુક્કો હોય એમ ઘડી રચનાઓમાં મૃત્યુ-સંવેદનને ધૂંઠે છે.

‘હંસગાન’ અને ‘દેવહૂમા’ – બંને કાવ્યોના કેન્દ્રમાં મૃત્યુબળ રહ્યું છે. આ બંને કાવ્યોના વિષયો અન્યદેશીય (exotic) છે. પશ્ચિમની પરંપરામાં મૃત્યુ પહેલાંના કોઈ કાર્ય, કોઈ રચના કે કોઈ સિદ્ધિને ‘હંસગાન’ (swan song) તરીકે ઓળખવામાં આવે છે; એ વિષયને કવિએ ભારતીય ભૂમિમાં સ્થાપ્યો છે. માનસરથી મરુભૂમિની હંસની યાત્રા અને પશ્ચાદગતિમાં હંસની સ્મૃતિલીલા આલેખતી આ રચના કાન્તના ખંડકાવ્યનું અનુસરણ કરે છે. મહત્વની વાત એ છે કે ‘હંસગાન’ હોય ‘દેવહૂમા’ હોય કે ‘ગિરનારની યાત્રા’ હોય – એમાં રચનાઓ માત્ર કાન્તના વૃત્તવૈવિધ્યને અનુસરતી નથી પણ કાન્તની છંદતરાહોની જેમ છંદતરાહોમાં આગળ વધી છે. કાન્તના છંદવૈવિધ્યને પછીથી જે છંદતરાહો રૂપે જોવાની દસ્તિ ઉઘડી એનું

અભાનપણે કે સભાનપણે થયેલું આકલન ગજેન્દ્ર બુચની રચનાઓમાં જોવાય છે. ‘હંસગાન’માં અનુષ્ટુપ કાન્તનાં ખંડકાવ્યોની જેમ સંધાન રૂપે આવ્યા કરે છે. પ્રારંભમાં મંદાકાન્તા અને અનુષ્ટુપનો એક એકમ રચાય છે, પછી શિખરિણીનાં ત્રણ આવર્તનો અનુષ્ટુપ સાથે સંધાઈને એક એકમ રચે છે અને આ એકમ બેવડાય છે. એટલે કે ત્રીજો એકમ બીજા એકમને અનુસરે છે. ચોથા એકમમાં પ્રારંભના મંદાકાન્તાને ફરી હાથમાં લઈ એનાં ત્રણ આવર્તનો દ્વારા અનુષ્ટુપને સાંકળી લીધો છે. અંતે વધુ એક અનુષ્ટુપથી ઉપસંહાર રચાય છે. આને આ પ્રમાણે દર્શાવી શકશે : મંદા + અનુ / શિખ + શિખ + શિખ + અનુ / શિખ + શિખ + અનુ / મંદા + મંદા + અનુ / અનુ. જોવાને કે જે સ્થાપત્ય ભાવનાની વાત ગજેન્દ્ર, આપણે પૂર્વે જોયું તેમ કાન્ત સાથે જોડી છે એની સમજ પોતાની રચનામાં ઉતારી છે. ‘હંસગાન’ બે પંક્તિઓના મિજાજની આસપાસ બંધાયું છે :

હશે કો મૃત્યુમાંયે શું વિશ્વસંગીત સ્નેહને ?

નહીં તો જીવ રેસાતા ગાન તે કેમ નીભરે ?

હંસપંખીની કિયાઓને રજૂ કરતી પંક્તિઓની પ્રત્યક્ષાતા જુઓ :

પડ્યો એ પંખાળો મરુભૂમિમહી માનસરથી,  
સુંવાળી કાયાને પ્રિયવિરહની જાળ દહ્યતી;  
દળે દીલી શ્રીવા શ્રમશાખિલ બે પાંખ પસરે  
વળે આંખે ઝાંખી, પણ પ્રજાયનાં ચિત્ર ન સરે.

કાન્તની શરૂની ‘મૃત્યુતૃષ્ણા’ જેવી રચનામાં આવતી પંક્તિ ‘દિસે છે કૂરતા કેવી કર્તાની કરણી મહીંનો પડ્યો અહીં ‘છતાં ઓ કૂરતા દેવી ! નવી આ શું જણાય છે ?’માં અવશ્ય સંભળાય છે. પણ પાશ્ચાત્ય વિષયને અપાતો ભારતીય સંસ્કૃત પરિવેશ રચનાને સાચ બનાવે છે.

‘દેવહૂમા’ તો કાન્તની ધારીએ ઉત્તરેલું કેટલુંક ખાસસું સ્થાપત્ય રચતું ખંડકાવ્ય છે. અહીં શ્રીકપરંપરામાં વયચક પૂરું કરી પોતાની રાખમાંથી પુનઃ જન્મ લેતા દેવહૂમા(phoenix) પંખીની મૃત્યુકથાને અને એના પુનર્જન્મની કથાને અનુષ્ટુપ તેમજ મિશ્રોપાજાતિના નિયમિત દ્વંદ્વબળ પર વળી છે. રજૂઆતની રીતે ભાષાના વળોટ પણ અહીં ખાસસા પક્ક છે. રહસ્યપૂર્ણ મૃત્યુકથા જુઓ :

કરાલ આવા રણમાં પડો શા  
દેખાય છે એ ચડતા ધુમાડા ?  
ને આભથી એ ઉતરી પડે કો  
શું સત્ય આ કે કંઈ વર્થ ઓળો ?

હવે પુનર્જન્મની રૂપાંતરકથા જુઓ :

કો વૃદ્ધ પંખી પડતું મૂકે ત્યાં  
ને ભરમ થાતું ભડકે ઘડીમાં,  
એ રાખને આ કાશમાં વિભેરી  
ઉડે અનેરું બની લાલ પંખી !

પુનર્જન્મ પદ્ધિનું પંખીનું રૂપ, એની ગતિ, એનું ચાંચલ્ય  
જુઓ :

ઘડવું શું સાવ સોનાનું, આગમાં ઊજળું થતું !  
પસારી પાંખ સોનેરી પંખી આભે ઊડી જતું.

‘ગિરનારની યાત્રા’ જેવી રચનામાં ગજેન્દ્ર બુચની  
પોતીકી સિદ્ધિ છે. ફણ ભરી ભરીને આરોહણ કરતા  
કાવ્યનાયકની ગતિને ગજેન્દ્ર દુતવિલંબિત અને  
મિશ્રોપજાતિની બેવડ તરલ ગતિ પર સફળ રીતે આરોપિત  
કરી છે. ૪૮ કરી સુધી વિકસેલું આ કાવ્ય એના  
સ્થાપયમાં એકદમ નિયમિત છે. ચાર શ્લોક  
દુતવિલંબિતના અને ચાર શ્લોક મિશ્રોપજાતિના - એમ  
વારાફરતી ચારચાર શ્લોકનો એટલે કે કુલ આઈ શ્લોકનો  
એક, એવા કુલ છ એકમોમાં રચના બંધાય છે; અને  
પ્રારંભના દુતવિલંબિતનો પડધો હોય એમ અંતે  
દુતવિલંબિતના વધારાના એક ઉપસંહાર-શ્લોક આગળ  
અટકે છે. દુતવિલંબિતના શ્લોકોમાં વચ્ચે વચ્ચે એકવિધતા  
યણવા ગજેન્દ્ર છદની નિયમિત પંક્તિને સ્થાને એક લઘુના  
લોપયુક્ત પંક્તિને ગોઠવી છે. દુતવિલંબિતની નિયમિત  
પંક્તિ ૩૩૩ - ૩૩ - ૩૩ - ૩ - એમ બાર  
અક્ષરની છે એને ગજેન્દ્ર આઈમાં લઘુને પડતો મૂકીને  
૩૩૩ - ૩૩ - ૩ - ૩ - જેવી અગિયાર અક્ષરની  
પંક્તિમાં રૂપાંતરિત કરી છે. બ. ક. ઠાકોર ‘આપણી  
કવિતાસમૃદ્ધિ’ની ટિપ્પણીમાં એને ‘ગજછંદ’ તરીકે  
ઓળખાવે છે, જેની રા. વિ. પાઠક ‘બૃહદ્ર્વિપિગળ’માં વિશેષ  
નોંધ લીધી છે. આ કાવ્યનો પ્રભાવક ઉધાડ જુઓ :

કિતિજમાં કંઈ મેઘ સમો રમે  
નજર માંડી જહીં દિનરાત મે  
અહીં ઊભો પડછંદ પહાડ એ-  
નમન હો ગરવા ગિરનારને

કલ્યાનમાં રમતા વાયવી ગિરનારનો નક્કર  
વાસ્તવિકતામાં થતો સાક્ષાત્કાર ‘અહીં ઊભો પડછંદ  
પહાડ એ’ પંક્તિમાં કુશણતાથી કરાવાયો છે. ન્હાનાલાલનું  
‘ગિરનારને ચરણે’ ગિરનારની તોણીથી આગળ નથી જતું.  
જ્યારે ‘ગિરનારની યાત્રા’ ટૂંકો પર ટૂંકો સર કરે છે.  
ગિરનારની ઊંચાઈને જીલતી પંક્તિઓનું રહસ્ય જુઓ :

ઘડી ઘડી ધન ધૂમમસ ધેરતાં  
ઘડીકમાં ગૈરિશુંગ ગળી જતાં  
ઉઘડતાં ઘનઘોર ઊંડાશ જ્યાં  
કયમ ઉભાય અગાધ આભમાં ?

ગિરનારનું આરોહણ અને વંજિત થતું રહેતું  
જીવનનું આરોહણ પંક્તિઓને અભિધા પર ન રાખતાં  
ધનિસ્તરે ઊંચકે છે. રોબર્ટ ફોસ્ટની પંક્તિઓની યાદ  
આપતી આ પંક્તિઓની સાંદરીનું રૂપ જુઓ :

ભૂલ્યો ન મારે અહીં થોભવાનું  
મારે હજ દૂર બહુ જવાનું

કવિની મૂંઝવણ ગિરનારના આરોહણમાં અનંતને  
અંજલિમાં સમાવવાની મૂંઝવણ છે : ‘અનંત શે અંજલિમાં  
સમાય ?’ આ કવિ અંજલિમાં અનંતને જાલવાનો ભાસ  
રચી શકે છે એની પ્રતીતિ તો રાણકદેવીને સ્પર્શતી  
પંક્તિઓ જરૂર કરાવી શકે છે :

હૂંકે ઉડાડે ગિરનાર એવી  
સૌરાષ્ટ્રની રાણક એક દેવી.

અહીં હૂંકે ગિરનારને ઉડાડતી રાણક દ્વારા સતીની  
શક્તિનો પરચો પંક્તિમાં પહોંચી શક્યો છે. ઉપસંહાર  
પહેલાંનો એકમ મા-ની ટૂંકના માહાત્મ્ય પર કર્યો છે. એમાં  
મંત્ર પેઠે પુનરાવૃત્ત થતાં ‘મા’નાં આવર્તનોથી આર્દતા  
પ્રગતી શકી છે :

મા, દર્શને હું તુજ દ્વારા આવ્યો  
મા, ભાન ભૂલ્યો ભવમાં ભમાવ્યો

મા, બંધ ક્યારે છૂટશે મને કહે  
મા, પાંખ ક્યારે છૂટશે મને કહે  
આ પછી પ્રભાવક ઉઘાડ જેટલો જ રચનાનો પ્રભાવક  
ઉપસ્થિતાર છે :

ઉત્તરવા બહુ સહેલ સદા હશે  
ઉત્તરવા અહીંથી પગ ના ખસે;  
ગગન ચુંબિત આ ગિરનાર ક્યાં ?  
ખરી પડું ફરીને ક્યમ ભોમમાં ?

‘ઉત્તરવું સહેલું’ છીતાં ‘ઉત્તરવું અધ્યાતું’નો  
વિરોધાભાસ તેમજ ગગનચુંબિત ગિરનાર અને ભોમમાં  
ખરી પડવાનો વિરોધ – બંને અહીં આબાદ ઝડપાયા છે.  
ગગનચુંબિત એટલે ગગનને ચુંબતો નહીં પણ ગગન જેને  
ચુંબે છે તેવો ગિરનાર – એવી બ. ક. દાકોરની નુક્તોચીની  
વળી પંક્તિઓનું ઓર સૌંદર્ય ઊભું કરે છે.

‘કવિને’ રચનાની સવૈવાની ચાલ લયનું પકવ સૌંદર્ય  
ઊભું કરે છે. એમાં સુન્દરમૂં કહે છે તેમ કવિ અંગેના  
આસમાની રંગો જરૂર છે, પરંતુ મનીષી કવિથી જરાય  
ઓછું ગજેન્ડને ખપતું નથી. પ્રારંભ જુઓ :

તારા શુદ્ધ સનાતન પથ હો, તારા યુગ યુગ લે આદેશ !

અહીં ‘પથ’ સાચેની ‘શુદ્ધ’ અને ‘સનાતન’ સંશાઓ  
કવિતાનાં હેશનાં ઊંચાં લક્ષ્યને પ્રગટ કરે છે. બોદ્લેરના  
અપમાનિત, લબડતી પાંખવાળા લંગડાતા આલેટ્રોસની  
સામે ગજેન્ડના કવિનો આ ખુમાર નવો સંદર્ભ આપે છે :

મૂક મનુજમાં ગુંજતી તારી  
વાળી અમૂલખ એક  
અપંગ જીવન આથડતાં ત્યાં  
પંખાળો તું એક

દયારામની સામગ્રીને નવા સંદર્ભે પ્રયોજતું  
અર્થવર્તું જુઓ :

‘શુદ્ધ સુવર્ણ વિના સિંહશના  
દૂધ નહીં જિરવાય’  
આ રચનામાં ન્હાનાલાલનું માધુર્ય ગજેન્ડ બુચની  
પ્રતિભામાં કલવાઈને પ્રગટ થયું છે એમાં શંકા નથી.  
ગજેન્ડ બુચ બોટાદકરની ‘રાસતરંગિશી’થી  
પ્રભાવિત હતા. પરંતુ એમનાં ગીતો સુન્દરમૂં કહે છે તેમ

‘સાવ ફિક્કાં’ છે અને ‘વિચારભારથી અલસિત’ છે પરંતુ  
સુન્દરમૂંની નજરમાંથી ગજેન્ડની, ફૂમરીમાં ઉત્તમ રીતે ફળી  
શકે તેવી ‘જાગી’ ગીતરચનાનું રૂપ છટકી ગયું હોય એવું  
લાગે. છે :

રાજને ભરોસે હું તો  
રેન સારી જગી  
નયનાં નીર ખૂટ્યાં  
હેડાનાં હીર છૂટ્યાં  
પલ પલ હોય ! આજ યુગ સમ લાગી

‘રેન’ અને ‘સારી’ જેવા રાજભાંટના શબ્દોના  
સંસ્કરણીય ધ્રુવપંક્તિ ઊપરે છે અને પછી આખું ગીત  
સંખ્યા ભાવપૂર્વ રીતે ટકી શક્યું છે. અંત જુઓ –

સ્નેહને સંભારવા ના,  
સપનાના મોહ શાના ?  
અંજવાંને ઝંખનારી હું જ હતભાગી.

આ ગીતરચના ઉત્તમ ગાયકી સાંપડે એની રાહ જુએ છે.

નરસ્થેહરાવના ખંડ હરિગીતનો ઊપયોગ થયો છે  
એવા ઉલ્લેખ સાથે ગજેન્ડ બુચની ‘સૂર્ય-ચન્દ્ર-પૃથ્વી’ રચના  
કોરાજો મુકાયેલી છે, એ જરા હથમાં લેવા જેવી છે. એમાં  
નરસ્થેહરાવ દીવેટિયાનો માત્ર ખંડહરિગીત નથી વપરાયો  
પણ ખંડહરિગીત સાથે સુગમતાથી ભળી જતા,  
ગાલગાલગાલગા – એમ પૃથ્વીના અંતિમ ખંડ સહિતના  
પૃથ્વી છંદનો પણ ઊપયોગ થયો છે. આનો નિર્દેશ ભાગ્યે  
જ થયો છે. સ્થાપત્યની રીતે પણ આ રચના ધ્યાન ખેંચો  
છે. આમ તો કવિની ઉક્તિનો પહેલો ખંડ અને પછી એને  
અનુસરતા ‘સૂર્યઉક્તિ, – ચન્દ્રઉક્તિ અને પૃથ્વીઉક્તિના  
ત્રણ ખંડો અને અંતે ફીરી કવિઉક્તિથી થતો ઊપસંહાર એક  
ઓક્કસ સંઘાન રચે છે. સૂર્ય, ચન્દ્ર અને પૃથ્વીની વૈયક્તિક  
ઉક્તિઓ જુદા જુદા કોણથી જુદો જુદો સ્વાદ આપે છે.  
પ્રથમપુરુષમાં થયેલી આ ઉક્તિઓ પાત્રના આભ્યંતરમાં  
ચીધો પ્રવેશ આપે છે.

આ કવિની સતત માન્યતા રહી છે કે સ્નેહને કારણે  
જ શૂન્યમાં સંગીત છે. પણ સન્હેનું એમનું દર્શન અધૂરા  
કે અપ્રતિફ્લિત સ્નેહ (unrequited love)નું દર્શન છે.  
આ સ્નેહનો ઈતિહાસ કવિ પુરુષ અને પ્રકૃતિના પ્રેમનાં  
અશ્વુઓ જેવા સૂર્ય, ચન્દ્ર અને પૃથ્વીમાં જુએ છે; અને જે

કુદી કવિ જુઓ છે એમાં એમની પ્રતીતિ છે કે જે પિડમાં છે તે જ બહાંડમાં છે. એટલે જ અપ્રતિફલિત સ્નેહની કથા કાળજૂની છે અને ઘટઘટમાં છે. આમ તો રચનામાં એક કાલ્યનિક કથાનક નિરૂપાયું છે. બીજી રીતે કહીએ તો કવિ, સૂર્ય, ચન્દ અને પૃથ્વીની ચેતનાઓ દ્વારા એક કથનગોંફ રચાયો છે. ચન્દ, પૃથ્વીને ઝંખે છે, પૃથ્વી સૂર્યને ઝંખે છે અને સૂર્ય પોતાના પ્રચંડ તાપને કારણે પૃથ્વીથી મિલન અશક્ય હોવા છતાં પૃથ્વીને ઝંખે છે. કવિની ઉક્તિ ખંડ હરિગીતમાં છે, પણ સૂર્યની ઉક્તિ પૃથ્વી છંદમાં શરૂ થાય છે. ચન્દની ઉક્તિ ફરીને ખંડહરિગીતમાં છે. તો પૃથ્વીની ઉક્તિ પૃથ્વી છંદમાં છે. સૂર્ય અને પૃથ્વી બંનેને અપાયેલો ખંડ પૃથ્વી છંદ અને ચન્દને અપાયેલો જુદો ખંડ હરિગીત - અનુક્રમે સૂર્ય, પૃથ્વી વચ્ચેનો સંવાદ અને ચન્દ-પૃથ્વી વચ્ચેનો વિસંવાદ નિહિતપણે પ્રગટ કરે છે ઉપસંહારમાં, પૃથ્વીની ખંડ પૃથ્વીમાં થયેલી ઉક્તિ પછી પ્રથમ ખંડની કવિની ઉક્તિની એક કહીને પુનરાવૃત્ત કરી છે. આ સ્નેહકથા ઘટઘટની છે, ક્યાંક ને ક્યાંક સ્નેહમાં કશુંક અપ્રત્યાશિત રહી જાય છે એને આ પુનરાવૃત્ત કરી દઈ કરી આપે છે. આખી રચના વિરાટનો નિર્દેશ નથી કરતી પણ વિરાટના સંપર્કમાં મૂકી આપે છે. સંનંગ સપ્રાસ ત્રણ ત્રણ પંક્તિઓની ઘૂંઠાયેલી પક્ક ભાષાભંગો કવિની અભિવ્યક્તિ-સંપત્તિનો સહજ અણસાર આપે છે. ઉદાહરણ રૂપે કવિ, સૂર્ય, ચન્દ અને પૃથ્વીની ઉક્તિઓ જોઈએ :

**કવિઉક્તિ :** આ આભના ઊડાણમાં

કો તેજના તણખા સમા  
યુગ યુગ થયાં સત્ત્વો અકલ કેં કેં ઊયાં  
ને આથમ્યાં.

**સૂર્યઉક્તિ :** ફરે અફળ ફૂદડી

સમીપ પૃથ્વી પડી  
અહો ઘટ ઘટે પ્રભો, અમર ઝંખના  
કં ધરી ?

**ચન્દઉક્તિ :** મેં ડાલવ્યાં ચૈતન્ય જ્યાં

તેં સ્વભ સેવ્યાં અન્યનાં  
શું સ્નેહ સરજાયા હરો સાચે સળગવા  
શૂન્યમાં ?

**પૃથ્વીઉક્તિ :** શરી સળગતો શમે

મનેય બળવું ગમે

કહે રવિ તને ય એ અકળ જાળ શાને  
દમે ?

છેલ્લે સુન્દરમે વિકસનાર ગાંધીયુગની કવિતાનાં પૂર્વઅંધાશ જેમાં જોયાં છે તે ‘સમશાને’ રચના લઈએ. દીકરી ઉપાના મૃત્યુ પરની આ રચનાને પ્રલંબિત સોનેટ કહેવાનું મન થાય છે. ચાર પંક્તિની એક કહી વધારે હોવા છતાં, એટલે કે ૧૮ પંક્તિની આ રચના હોવા છતાં એનું કાર્બુ સોનેટ જેવી અસર ઊભી કરે છે. નિરાંડબર સરલ વાણીમાં વાતચીતની નજીક સરતો શિખરિણીનો લય જુઓ :

લીધીાતી જે હાથે જરીક રડતાં બાપડી ! તને  
ધરી છાતી સાથે જહીં સૂર્ય જતાં એક શયન  
તહીથી તે હાથે, ઊંચકી તુજને પંથ પળતો  
પિતા તારો જોને - જગત ભર બધ્યોર બળતો.

‘જરીક રડતાં’ અને ‘છાતી સાથે’ દ્વારા દીકરી પરતેનું ઉત્કટ વાત્સલ્ય સૂચિત છે. પણ પછી એ જ શયન અને એ જ હાથનો બદલાતો સંદર્ભ નવો કરુણ અર્થફીલક રેચ છે. ‘પિતા તારો જોને’ - માં દીકરી જીવતી હોય અને એને સંબોધતો હોય એવા પિતાનું બહારનું ચિત્ર અને એની સાથે મુકાયેલા પિતાના અંતરચિત્રને ધ્વનિત કરતો ટુકડો ‘જગત ભર બધ્યોર બળતો’ - બંને સાંદળીથી અસરકારક બન્યા છે. બાલમુકુન્દ દવેના પછીથી રચનારો ‘જુનું ઘર ખાલી કરતાંનો પૂર્વવતાર નીચેની કહીમાં જુઓ :

હતી માની મૌંદી, ફરી મૂકી દઈ માત ઉર હું  
રૂ બીજા, હું તો ખળખળ જતાં નીર નીરખું  
વળું ખાલી હાથે ઘર ભાડી પૂછે દ્વાર મહીં એ  
પ્રતાપી તાપીને તર મુજ બટુ શું નહીં રૂવે ?

બીજી વાર માત દ્વારા ધરતીનું સૂચન (કે તાપીનું સૂચન) બીજા રડે અને પોતે ‘ખળખળ જતાં નીર નીરખે’માં અશુદ્ધોનું સૂચન તેમજ માની સહજ ચિત્તાનો સારી નાખતો પ્રશ્ન - આ સર્વ કવિની જીણી મીનાકારી છે.

આવાં ગણેન્દ્ર-મૌક્તિકો પ્રમાણમાં વિરલ છે. <sup>T</sup>

r

T આ ગ્રંથ ગુજરાત સાહિત્ય અકાદમીએ ૨૦૦૪માં પુનર્મુક્તિ કર્યો છે. - સંપા.

રસિક શાહ m ચંદ્રકાન્ત ટોપીવાળા m લાભશંકર ઠાકર m રાવેશ્યામ શર્મા m સુમન શાહ  
m જ્યંત ગાડીત m પરેશ નાયક m ડંકેશ ઓજા m મહેન્દ્ર મેઘાડી m સુભાષ દવે

### પત્રચર્ચા

m જ્યેશ ભોગાયતા m માવજી સાવલા m બાબુ સુથાર m ભરત મહેતા m કિશોર વ્યાસ  
m મહેશ ધોળકિયા m મનોજ રચલ m બાબુલાલ ગોર m રજનીકુમાર પંડ્યા m રજનીકાન્ત સોની

પ્રિય રમણભાઈ,

‘પ્રત્યક્ષ’નો પદમો સંણંગ અંક સાંજે ૭-૦૦ વાગે  
મળ્યો. તમારો ‘પ્રત્યક્ષીય’ વાંચીને તરત લખવા બેસી ગયો.  
આ મારો પ્રાથમિક પ્રતિભાવ –

પહેલાં તો અભિનંદન. (સુમન, ‘આરપાર’ના તંત્રી -  
સંપાદક, ‘ગુજરાત સમાચાર’ના તંત્રી – આ સૌને  
અભિનંદન.) ધીરુબેને ઘણી વાર ‘પરિષદ’ના વહીવટી દાખ  
વિશે ફરિયાદ કરી હતી, એમનો વસવસો જાહેર કર્યો હતો.  
એમની શક્તિ-મર્યાદામાં રહીને એમની રુચિને અનુકૂળ રહીને  
‘પરિષદ’ના જ આશ્રેયે પણ પરિષદ’થી સ્વતંત્ર રહીને થોડા  
કાર્યક્રમો એમજો યોજ્યા. પણ she is not a literary  
activist. એટલે ‘નર્ધૂ ભાવનાઓનું ગદ્દગદ ગાન’ કહીને  
એમના વિચારોનો છેદ ઉડાડવા જેવો નથી. જ.

લંડનથી આવેલા વિપુલ કલ્યાણીએ પોતાના વિષયની  
ભલે બહાર જઈને પણ પરિષદનાં કેટલાંક વહીવટી પાસાંની  
આકરી ટીકા કરી. તરે પ્રમુખોની હાજરીમાં. એનો નવા પ્રમુખ  
બજુલ ત્રિપાઠીએ જે રીતે બચાવ કર્યો એથી પરિસ્થિતિમાં  
ધરમૂળનો સુધારો થશે એવી કોઈ આશા જન્મતી નથી.  
Diasporaના સાહિત્ય વિશેના લેખો ‘પરબ’માં નહિ છાયા  
એવું બને નિર્ભાતિ વક્તાઓએ બીજા દિવસે પિન્ડી દલાલ  
અને નંદિની ત્રિવેદી (મુંબઈ સમાચારવાળાં)ની હાજરીમાં કહેલું  
એનો હું સાક્ષી છું.

આ પરિસ્થિતિ શોચનીય છે. જે લેખકોને, વિચારકોને,  
વિરેચકોને આ પરિસ્થિતિ ખૂંચતી હોય એ પરિષદના  
વહીવટદારોને એક વખત લેખિત વિનંતી કરે. પરિષદની  
વહીવટી પાંખ એનો પ્રતિભાવ ઉદાસીનતાથી આપે તો  
ઓછામાં ઓછું ‘પરબ’માં એમનું લખાડા ન મોકલવું એવો  
અસહકારનો માર્ગ અપનાવે.

ઘણા બધા ચુંટાયેલા સભ્યોની બનેલી મધ્યસ્થ સમિતિ  
શેની મધ્યસ્થી કરે છે એવો મજાકિયો સત્વાલ મેં એક સભ્યને  
કરેલો. એઝો કથ્યું, ‘જ્ઞાનસત્રમાં અને પરિષદમાં કોને વ્યાખ્યાન  
માટે કે પેપર રજૂ કરવા માટે બોલાવવા એની ચર્ચા અમે કરીએ

ધી.એ. એ જ્ઞાનાય બીજું કરી નહિ.’ આવી ચુંટણી માટે ઊભા  
ન રહેલું એ પણ અસહકારનો માર્ગ હોઈ શકે.

સબળ પ્રતિકાર કે વૈકલ્પિક સંગીન પ્રોગ્રામ આપવા  
જેટલા સાહિત્યકારો સંગઠિત નથી એટલે આવું ચાલ્યા જ  
કરવાનું. જેમ સરકાર માટે કહેવાય છે એમ સાહિત્ય-સંસ્થાઓ  
વિશે પણ કહી શકાય : we get the Parishad that we  
deserve. પરિષદની પ્રતિમા ઊજળી બને એ માટે  
સાહિત્યકારોએ એમની પ્રતિમાને થોડી ઊજળી કરવી પડે –  
તમે ચીંધીલા કાર્યક્રમમાંથી થોડા ઉપારી લઈને.

મુલાં; ૨૪-૧-૦૬

રસિક શાહનાં સ્મરણ

r

પ્રિય રમણભાઈ,

‘પ્રત્યક્ષ’ (ઓક્ટો., ડિસે., ૨૦૦૫)માં તમે ગુજરાતી  
સાહિત્ય પરિષદનાં સો વર્ષ પૂરાં થયે ‘પરિષદની આરપાર’  
એવું નિરખત અને સૂર્યપૂર્વકનું પ્રાસ્તાવિક આખ્યું અને એમાં  
તટસ્થપણે એનાં આજ સુધીનાં કાર્યોનું અને કરવા જેવાં  
કાર્યોનું વિવરણ આખ્યું, તે સમયસરનું છે. આ સંસ્થા સાથે  
હું લગભગ બાર વર્ષ સહિય જોડાયેલો રહ્યો છું. તમે આથી  
મારી પ્રતિક્રિયા જાણવા હશે એ સ્વાભાવિક છે. તમે આ  
સંસ્થાની મંદ પેલી વિદ્યાપ્રવૃત્તિ પર, એના કથળેલા વહીવટી  
ઢાંચા પર અને બીજાઓની ક્ષમતાને માર્ગ ન આપનારી  
એકદેની પરિપાત્રી પર યોગ્ય રીતે આંગળી મૂકી છે. તમારાં  
નિરીક્ષણોને પુષ્ટિ આપત્તા કેટલાક મુદ્દાઓને અહીં રજૂ કર્યા  
છે :

- ‘સાહિત્યનો ઈતિહાસ’ અંગે એક વ્યાપક સલાહકાર  
સમિતિની રચના કરાયેલી. એની બેત્રાણ સભાઓ  
થયેલી. સૂર્યનો પણ મળેલાં. પણ પરિષદ હંમેશાં કરે  
છે તેમ સમિતિને નિર્જિય કરી દીધેલી. કોઈપણ  
સમિતિની રચના કાર્યદિશા અને કાર્યવેગ માટે હોય  
છે. કાર્યને ઠેલવા કે મર્યાદાને ધાવરવા માટે નહીં.

‘ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ’ ગ્રંથ - ૫ નવ વર્ષે  
બહાર પાડ્યો છે તે પૂરા સ્વરૂપમાં નથી. મૂળની

૧. યોજનાને બાજુએ રાખી ઈતિહાસની સંકળના વગરના કેટલાક ઊભડક આસ્વાદલેખોનો પણ સંચય થયો છે. લખાણની પૂરી સંગતતા પણ જગતાયેલી નથી. મારું નામ સલાહકાર સમિતિ પર હોવાથી આ વાત મારે માટે દુઃખ છે.
૨. સ્વાધ્યાયપીઠો અને અભ્યાસકેન્દ્રો પ્રવૃત્તિ ગણવાનાં સાધનો તરીકે શરૂ કરવાનો કોઈ અર્થ નથી. પરિષદનું અનુવાદકેન્દ્ર સૌથી વધુ કાર્યક્રમ હોવું ઘટે એને સ્થાને કોઈ નિવૃત્ત અવિકારીના હાથમાં એ ઉત્સાહહીન અને નહીંવત્ત બની ગયું છે. સ્વાધ્યાયપીઠમાં બજ્ઝે અભ્યાસીઓએ મધ્યકાળ પર બજ્ઝે વર્ષ લગ્ની નાશકીય વ્યવસ્થા હેઠળ કાર્ય કર્યું છે પણ આજદિન સુધી જાહેરાં એનો કોઈ હિસાબ રજૂ થયો નથી. મધ્યકાળમાં જ્યારે સંશોધન લગભગ અટકી ગયું છે ત્યારે આવો હિસાબ મોટી ગરજ સારે તેમ છે.
૩. પરિષદમાં અમેરિકાનિવાસી શ્રી મણિલાલ જોશીની આર્થિક સહાયથી એક શ્રુતિદશ્ય બંડ સંચાલિત હતો. એમાં રેકોર્ડિંગની પ્રાથમિક સુવિધા હતી. પરિષદમાં આજે એનો કોઈ ભાળ મળતી નથી. પરિષદ જેવી સંસ્થા પાસે આ પ્રકારની વ્યવસ્થા એનું અનિવાર્ય અંગ દેખાવું જોઈએ.
૪. ‘જ્ઞાનસત્ર’નું માળખું બદલવાની તાકીદની જરૂર છે. જ્ઞાનસત્રને અધિવેશનની જેમ મંડપ વચ્ચે મેળાવડો માનવાની ભૂલ થઈ છે. સાહિત્યક્ષેત્રની પ્રવૃત્તિને નજીકથી તપાસવાનો અને નવી દિશાઓનાં સ્ફૂર્યનો પકડવાનો એક મહત્વનો મંચ જ્ઞાનસત્રે ઊભો કરવાનો છે. તમે યોગ્ય રીતે ‘લોકાભિમુખ’ પછી તરત જ ‘સાહિત્યરસિકાભિમુખ’ શર્બત મૂક્યો છે, તે માર્ખિક છે. લોકાભિમુખનો અર્થ સાહિત્યને લોકાભિમુખ કરવાનો નહીં પણ લોકોને સાહિત્યભિમુખ કરવાનો માર્ગ છે એમાં લોક અભિમુખ બને તે ઈચ્છા જોગ છે. સાહિત્ય દ્વારા લોકોનું સંવનન કરવાનું નથી પણ લોકોને સાહિત્યના સંવનન તરફ વાળવાના છે. ગુજરાતી પ્રજાની તાસીર વાણિજ્ય બુદ્ધિની છે એને પરિષદની નક્કર સાહિત્યરસિકાભિમુખ સાહિત્યરસિક-સાહિત્ય-બુદ્ધિવાળી બનાવી શકાય. સાહિત્યક્ષેત્રે સંખ્યાબળ નહીં પણ ગુણવત્તા એની પારશીશી છે.
૫. સમયબદ્ધ દસ્તિપૂર્વકના કાર્યક્રમો, કાર્યક્રમોનું ચુસ્ત

સમાયોજન, પક્ષપાત અને પૂર્વગ્રહથી મુક્ત પ્રતિભાવકી માનવસંસાધનનો યોગ્ય વિનિયોગ, વગેરે – કોઈ પણ સંસ્થાના વિકાસ માટે અને એની સફળતા માટે મહત્વનાં છે. એમાં પ્રચ્છન્ન ‘શાખ ભાષાચાર’ – goodwill corruption (આ પરેશ નાયકે સૂચવેલો શર્બત છે) સંસ્થાને અંદરથી કોરી નાખે છે. ઉદાહરણ તરીકે પરિષદ જેવી સંસ્થા પુસ્તકભંડાર માટે કોઈ ટ્રસ્ટને, એ ટ્રસ્ટ હોવાને કારણે આશ્રમ રોડ પર આવેલા પોતાના મકાનમાં તદ્દન નજીવા ભાડે જગ્યા ફાળવે (ક્યાર્ય સુધી આ ટ્રસ્ટે ફર્નિચર પણ સંસ્થાનનું વાપર્યું છે) – અને, એ બરાબર પણ પરિષદનાં પ્રકાશનો વેચવા માટે પરિષદ પાછી ટ્રસ્ટને વેપારી ધોરણે કમિશન આપે એ કોઈપણ રીતે બુદ્ધિમાં તીતરે એવું નથી.

વળી, પરિષદના કર્તાહીં હોવાને નાતે [તમે કહો છો એમ] અનેક સમિતિઓ અને મંડળોમાં પ્રવેશી પોતાની અંગત માન્યતાઓને આધારે હિતલાભ લેવો અને આપણો એ દૂષિત પ્રવૃત્તિ છે અને છેવટે પરિષદને આથી હાનિ પહોંચી જ છે.

એકદારે તમે નિર્દેશી છે તેવી કલ્યાણશીલ યોજનાઓ થવી જોઈએ. પ્રવૃત્તિ હાથમાં લઈ એનો જેમતેમ વીટો વાળી ટેવાની અને પોતાનો હાથ ઊંચો રાખવાની પ્રવૃત્તિ ચાલે છે એથી ઉપર ઊંદું જરૂરી બન્યું છે. આવું નહીં થાય ત્યાં સુધી સાહિત્યસંસ્થાનો ભલીવાર નથી. આવાં ધોવાણો વહેલીતકે અટકવાં જોઈએ.

એક વ્યાપક હિતના અનુસંધાનમાં તમે મને સંડોચ્યો એ માટે હું આભારી છું.

અમદાવાદ, ૭-૨-૨૦૦૬

– ચન્દ્રકાન્ત ટેપીવાળા

r

પ્રિય શ્રી રમણભાઈ,

‘પ્રત્યક્ષ’ના અંક પદમાં તમે ‘પ્રત્યક્ષીય’માં ગુ.સા. પરિષદ વિશે જે નિસબ્તથી, વિગતે લખ્યું છે તે વાંચીને મને આનંદ થયો. તમે અનેક સૂચનો કર્યા છે અને આ ‘આપણી’ સંસ્થા છે અને તે યથાશક્ય નિર્મળ બનીને સુપેરે કર્તવ્યપરાયણ થાય તેવી સચ્ચાઈભરી સમજાથી અને લાગણીથી લખ્યું છે. તમારા આ સંપાદકીય નીચે હું સહી કરી દઉં, રમણભાઈ. અન્યથા હમણાંથી જે કંઈ લખાયું છું, પરિષદ વિશે, તેમાં પરિષદ સાથે સીધા

સંકળાયેલાઓએ તો અંદરના કલેશને બહાર ચોકમાં લાવીને 'જોણું' કર્યા જેવું જ છે, હાસ્યજનક, વિઝુપ અને તેથી કરુણ.

હું મારી નિસબતથી ઘડી વાર લખી ચૂક્યો છે. અલબત્ત, તે મારી શૈલીથી. પ્રશંસા તો હું તમારા ચીવટભરી નિસબતથી અને વિગતભર્યા સૂચનોથી લખાયેલાં સંપાદકીયની જ કરું. એવો ભાવ અનુભું છું કે પરિષદના આજના તંત્રવાહકો તમારા જેવા થોડા મિત્રોને નિમત્તે. સહુ સાથે બેસીને આ માતૃસંસ્થા વિશે સમ્ભાષા (દાયલોગ) કરે. એમાં શું શું કરી શકાય આ આપકી માતૃસંસ્થામાં, તે વિશેનો એક સહિત્યારો આલોઝ તૈયાર કરી શકાય. એમ થતાં યથાશક્ય સંસ્થાને કર્તવ્યપરાયણ કરવામાં સહભાગી બની શકાય. આ માટે બહાર હોવા છતાં સારી નિસબત ધરાવતા મિત્રોને પરિષ્ઠે ઠીજન આપવું જોઈએ.

'એવના'માં મારાં [પરિષદ વિશેનાં] બે લાંબાં લખાણોને એડિટ કરીને શ્રી સુમનભાઈએ છાયાં છે. મેં ઘડી વાર યદ્વાતદ્વા શૈલીમાં ગુ. સા. પ. વિશે લખ્યું છે. હવે થાક અને ક-ટા-ળો પણ આવે છે. તમે મજામાં હશો. 'પ્રત્યક્ષ' સુપેરે ૧૪મા વર્ષમાં પણ આમ પ્રત્યક્ષ થતું રહે છે તેનો આનંદ. અમદાવાદ, ૧૬-૨-૦૬

- લાભશંકર ઠાકર

r

સંપાદકક્ષી,

'પ્રત્યક્ષ'ના પ્રદમા અંકના સંપાદકીય લેખ માટે જોરદાર અભિનંદન તમને આપ્યા સિવાય રહી શકતો નથી - એ એક વાદગાર જાગૃતિપ્રેરક લેખ છે.

'પછી ?' લખીને અત્યંત જરૂરી પ્રશ્નો તમે પ્રસ્તુત કર્યા છે. 'એવના'ના તંત્રી સુમન શાહે ધુમાડો ચીંધ્યો. પછી અન્ય કોઈ સામયિક આવા વહિ-સ્ક્રિલિંગ વેરવાની હિંમતભરી નેતૃત્વકતા દેખાડી નથી !

યુનિવર્સિટી, સા. પરિષદ, દિલ્હી/ગુજરાત સા. અકાદમી જેવાં તંત્રોમાં જે કાંઈ ધ્યાન-તિખારા ઊરી રહ્યા હોય એ બાબતોમાં મારું ધોર અજ્ઞાન ધરાર સ્વીકારું છું. પણ આ 'પ્રત્યક્ષીય'ની દીપશિખા મને થોડુંક લખવા દોરી ગઈ બરી.

સર્વપ્રथમ, રમણભાઈ, તમારી મુદ્રાપકડ, અભ્યાસમંડિત, સુચિત્તિત અને પ્રશ્નપરક ગદ્યશૈલી ગમી ગઈ. પીઠ વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ એક કાળે વિંતનાત્મક ગદ્ય ગ્રંથ પ્રગટ કરેલો. મારું સર્જનાત્મક વલાણ વધુ એટલે એવું ગજું તો નહીં, પણ તમારા જવાબદારીભર્યા હાથે જે વિગતો રમતી

મેલાઈ છે એ ચિંતન ઉપરાંત પરિષદ વિશે, ચિંતા પ્રેરે એવી પણ છે.

ગાંધીજારાના નવજીવન પ્રકાશને આખું પુસ્તક પ્રકાશિત કરેલું : 'ત્યારે કરીશું શું ?' એ રીતે, કરણીય શું - એનો તમે ઉપયોગી નકશો આરેખ્યો છે તે હાલના તંત્રવાહકોને કિંચિત્ પણ હલાવશે ? તો બાત બન જાય...

તાતા તીર જેવો તમારો પ્રશ્ન : 'ક. લા. સ્વાધ્યાય મંદિરના સંશોધકોએ' (નામો કેમ ન દીધાં ?) 'આ દાયકામાં શું પ્રગટ કર્યું ? કયાં પ્રકાશનો કર્યા ?' આનો તો સંલગ્ન સંશોધકોએ જ ખશીઓતરીને જવાબ દેવાનો છે - ગુજરાતી સાહિત્યરસિક જનતાને. દાન-સહાય-ગ્રાન્ટ દેતી વ્યક્તિઓ તેમજ સંસ્થાઓએ પણ આ સવાલનો ભારો ઉપાડવો ઘટે, એટલું જ નહીં જ્યાં તમસ્ય અને તામસી-રાજકી પરિબળોના કરોળિયા જાયા હોય ત્યાં સંમાર્જન કર્યું પડે.

પરિષદના પૂર્વ-પ્રમુખ શ્રી ધીરુભાઈન પટેલે, તમે નોંધ્યું છે, તેમ નર્ધૂ ભાવનાઓનું ગદ્વાગદ ગાન કરી કરીને સાહિત્યની સૂક્ષ્મ અને પરિષદની સ્થૂલ સેવા કેટલી કરી ? સ્વીદાક્ષિણ્યની ભાવનાને અનુસરી તંત્રાનુરાગીઓ, કવીશર દલપત્રરામને સમરીને 'ધીરે ધીરે' સુધારાના ધીરગંભીર સાદને કદાચ યાદ કરતા હશે ! એની સાથે, તમારું સમાપન-વાક્ય ('આધાર વિનાની ભાવનાઓનાં દેવાલયો રચવાં... એ હવે સાવ અપ્રસ્તુત કાલગ્રસ્ત ચેષ્ટા હશે') જોડવાની તક એટલા માટે જરૂરું છું કે એમાં પૂર્વોક્ત ચિંતાત્મક ભાવિના ભેંકાર ભણકાર ભણાય-સંભળાય !

ગુજરાતી સાહિત્ય પરિષદનો વ્યક્તિલક્ષી નહીં એવો તત્ત્વ ઇતિહાસ લખાશે ત્યારે આ 'ંદ્યુગ' ભેખડની ધારે લટકી જૂલી રહ્યો હોવાનું દર્શય અતિ વાસ્તવિક લાગશે. આમ છતાં આશાતંતુને સાહિત્યની પંક્તિઓ વડે વળગી રહેવાનું ગમાડું : 'રાત જિતની હી સંગીન હોગી, સુબહ જિતની હી રંગીન હોગી.'

અમદાવાદ, ૧૮-૨-૦૬

- રાધીશયામ શર્મા

r

પ્રિય રમણભાઈ,

મને સારું-સારું ખાવું ગમે, સારું-સારું પહેરવું ગમે. ફૂલ-છીડવાઓને અડવું ગમે, પાણી પાર્ટ. શીપમાં રહેવું ગમે, વાળ રંગું. ત્રણ વાર બ્રાશ કરું. હસવામાં બહુ જ મજા પડે. આ બધું કહેવાનો અર્થ એટલો જ છે કે હું રસિક જીવ છું અને મને જીવન નામના રહસ્યમાંથી સૌંદર્ય જે પ્રગતી આવે છે

તેની બહુ લગની રહે છે. એટલે કલાસ્ટોફર્ચ ભોગવવામાં, વળી મારા વડે એ રચાય એટલું રચવામાંથી મને ખાસ રસ છે. આ મૂળભૂત બાબત વિશેનાં ધોરણો મને જ્યાં જ્યાં ન જળવાતાં જ્ઞાય ત્યાં ત્યાં હું બોલ્યા વિના રહી ન શકું. હવે તમે જ્ઞાવો છો એમ, જો ગુજરાતી સાહિત્ય પરિષદમાં ‘વહીવટી-તંત્ર પર વધુ ભાર’, તેને લઈને ‘વહીવટી દાબ’નો અનુભવ, ‘તંત્ર-પરકર્તા’, ‘સંગીન વિદ્યાપ્રવૃત્તિનો અભાવ’ વગેરે બધું થયું હોય કે થવા માંગ્યું હોય, તો મને એ બધા બખડકન્તરતન્તરમાં રસ નથી. કેમકે હું એ બધાંથી મને બહુ દૂર પરી ગયેલો અનુભવું હું. આ કશી ડંશાશ નથી, હકીકત છે.

પરિષદ સાહિત્યની સંસ્થા છે. સાહિત્યની છે માટે સંલગ્ન દરેકને પોતાનો આગામો ચહેરો હોવો જોઈએ – જે એની સાહિત્યસમ્પદનું ફળ હોય. એ સંસ્થા છે માટે સંલગ્ન દરેક પાસે આગામો અવાજ હોવો જોઈએ – જે એની સાહિત્યકલા નિસબતનું ફળ હોય. ઉમાશંકર-કાળે એવો ચહેરો અને એવો અવાજ ધરાવનારાઓની સંખ્યા ઢિક ઢિક મોટી હતી. એ સંખ્યા કમે કમે ઘટતી ચાલી : વચ્ચેનાં વરસોમાં ચહેરાવળા ઓછા થતા ગયા ને વર્તમાન લગીમાં તો સાવ જ ઓછા; વળી, અવાજ વગરના વધારે ને વધારે વધતા રહ્યા. મારું આ નિરીક્ષણ કોઈ ને કોઈ રીતે તમારાં મંતવ્યોને પુષ્ટ કરનારું લાગશે. તમારાં નિરીક્ષણોનો સાર, ધોવાણ છે અને હું આવું કહીને એ ધોવાણના મૂળમાં રહેલી પાયાની અછતને ચીધી રહ્યો હું.

પરિષદમાં લોકશાહી છે કે લોકશાહીનું માત્ર ખોખું ? જો લોકશાહી છે તો તેમાં દરેક બગાડને સુધારવાની કે કાયમ માટે નાન કરવાની જોગવાઈઓ હોવી જોઈએ. એ જોગવાઈઓનો સંલગ્ન સૌચે હેમેશાં ઉપયોગ કરવો ઘટે છે. મેં જોયું હતું કે ચહેરા અને અવાજવાળાઓ ઘટી ગયેલા તે છતાં, ચાર-છ જ્ઞા પાસે તો એ બંને વસ હતી, આજે પણ છે. પરંતુ તમે કહો છો એવા વહીવટી-દાબે એવા રાજકારણને પ્રસરાયું કે એ રહીસહી ચાર-છ વ્યક્તિઓ પણ સામસામે આવી ગઈ, એમની મોરાવિતી સામે પ્રશ્નો થયા, એમના સ્વત્ત પર સીધા કે આડકતરા પ્રહારો કરાયા. લોકશાહી જ્યારે દાવપેચ ને ઝીણી ઝીણી રમતો વડે જ નભતી હોય છે ત્યારે હકીકતમાં એ ભાયાતો વડે ચાલતી ઠકચત હોય છે કે પછી હજૂરિયાઓ વડે નભતી બાદશાહત. એનું બીજું નામ છે, લોકશાહીનું ખોખું.

પરિષદનાં સો વર્ષ પૂરાં થતાં, એવી આશા બંધાયેલી કે એમાં આમૂલ પરિવર્તનનું પ્રભાત ઊંઘડશે, પણ એ ન થયું. છેલ્લી ચૂંટણીઓએ દર્શાવી હીધું છે કે આ સંસ્થા હવે માત્ર મતદારોને હવાલે છે – એટલે કે મતદાર-બુદ્ધિને હવાલે છે. નરી કે તેમની સાહિત્ય-સૂચબૂજુને હવાલે – આમૂલ પરિવર્તનની આશા હવે આમ નિર્મળ થઈ ગઈ છે. ઘણાને તો બધું બચાબર જ લાગે છે – શેનું પરિવર્તન, શા માટે વગેરે એમની દલીલો છે. જ્યારે તમારા-મારા જેવા કે આપણા જેવાના થોડાક મિત્રો નિરાશ થઈ ગયા છે ને માને છે કે આ સંસ્થાને હવે કોઈ પોતિટિકલ અંક્ષણ જ ઉગારી શકશે – એટલે કે, જલદ અને સર્વવ્યાપી કશુંક આંદોલન. પણ તરતમાં એની કોઈ શક્યતા નથી. ચહેરા અને અવાજ વગરનાઓની વધતી વસ્તી વચ્ચે, સાચેસાથ, વાંજણી ફરિયાદો કરનારા ને તકવાઈ વચેટિયા પણ ઘૂસ્યા છે. તેઓ પણ ફાલતા રહ્યા છે તે હેવનાં વરસોમાં ફાલતા રહેશે, કેમકે પેલા પણ વધતા રહેશે. માટે આશા કે નિરાશા, અસ્થાને છે. છતાં, વાત તો ઊભી જ રહે છે. તમારો લેખ ‘શું કરવું જોઈનું હતું ને હજી પણ શું કરવું જોઈએ’ – જેવી અત્યંત વિધાયક ભાવનાથી રસબસ છે. એનું જેટલું મૂલ્ય કરીએ એટલું ઓછું. તમે ચીધેલી ઊંઘાપો અને તમે કરેલાં સૂચનો તમારી નિસબત બતાવે છે એ તો ખરું જ પણ એ નિસબત સંસ્થાઓ વડે થાનારં કઠિન કામોને વિશેની છે તેથી મૂલ્યવાન છે. મેં પણ અગાઉ કરવાનાં કામોની યાદી આપી છે (- જિબાસુએ જોઈ હશે. ન જોઈ હોય તેવા જો જોવા ચાહે તો જુએ ‘ખેવના’-૬ ત, સાપેન્ભર, ૧૯૮૮). તમારાં સૂચનોનો એક ઓંર વિશેષ પણ દર્શાવું. તમે જેટલાં કોઈ કામોની વાત કરી છે એ કાં તો આ સંસ્થાએ કર્યા છે, શરૂ કર્યા છે કે અધ્યારાં છોડ્યાં છે. તમે વળી એણે કરવા સરખાં નવાં ચીંધ્યાં પણ છે. એટલે કે તમે સીધું અને પૂરું કહી શકાય તેવું કરેક્ષણ સૂચાયું છે – ડાયરેક્ટ એન્ડ ઈન ટોટલ. એટલે જો તમને ન સાંભળો તો પરિષદ ભીતિ ભૂલે, એટલી મોટી છે એ વાત. હું ઈચ્છું કે સંકળાયેલા સૌ એમાં ધ્યાન પરોવે, તે-તેનો અભ્યાસ કરે ને બગાડને સુધારવાનું જટ શરૂ કરી દે. હું ઈચ્છું કે પરિષદનાં પ્રમુખ-સહિતનાં બદલાયેલાં સૌ સત્તામંડળોને તમારી વાતમાં પૂરો માલ છે એ વાતનું તાબડતોબ વ્યાન લાધી. હું એમ ઈચ્છું કે તમારા આ લેખ સંદર્ભ ખાસ મિટિંગ બોલાવાય ને તે માટે બધું એજન્ડા પર મુકાય. કોઈ વિરભદ્ર મિટિંગ મારો; હા, માગવી પડશે. જોઈએ

શું થાય છે...

કુશળતા તો લક્ષમાં રહેવી જ જોઈશે, ખરું ને ?

અમદાવાદ, હોણી-ધુળેટી; ૧૫ માર્ચ ૨૦૦૬ - સુમન શાહ

r

પ્રિય રમણભાઈ,

'પ્રત્યક્ષ'ના ઓક્ટો.-ડિસે. ૨૦૦૫ના અંકમાં છપાયેલો તમારો સંપાદકીય લેખ વાંચ્યો. તમે વખતોવખત પ્રત્યક્ષીયમાં આપજા સાહિત્યિક જીવન સાથે સંબંધિત કોઈ ને કોઈ પ્રશ્ન વિશે બને તેટલા તટસ્થ અને તર્કબદ્ધ રહી ચર્ચા કરો છો તેથી એ લેખો વાંચવા ગમે છે. આ વખતે ગુજરાતી સાહિત્ય પરિષદની પ્રવૃત્તિઓ વિશે તમે કેટલુંક નિર્ભર્ક નિરીક્ષણ કરી વિધાયક સૂચનો કર્યા છે તે ખરેખર ધ્યાનાર્દ છે. આમ તો તમારો લેખ વાંચી ઘણા વિચારો ઉદ્ઘાટને છે. એ બધાને મૂકવા જાઉં તો એક લેખ થઈ જાય. પરંતુ મારી એ ઈચ્છાને રોકી પ્રારંભમાં તમે કરેલા એક નિરીક્ષણ વિશે થોડી વાત કરીશ.

તમે જણાવ્યું છે કે છેલ્લા એકાદ દાયકામાં પરિષદમાં વિદ્યાપ્રવૃત્તિ મંદ પડી એનું કારણ પરિષદમાં વહીવિતીત્ત્ર પર વધુ ભાર મુકાવા માંડ્યો એ છે. તમારા આ અભિપ્રાયથી હું જુદી પંચ છું. મારા ઝ્યાલથી કોઈ પણ સંસ્થા કે કંપનીએ ઉત્તમ ફળ આપવું હોય તો એનું વહીવિતીત્ત્ર મજબૂત હોવું અનિવાર્ય છે. સાચો વહીવટકાર હંમેશા એ વસ્તુ પર ધ્યાન આપે છે, કારણ કે એનું લક્ષ્ય છે ઉત્તમ ફળ આપવું. એ માટે તે પોતાના ક્ષેત્રના ઉત્તમ માણસોને પોતાની પાસે બોલાવે છે, એમને બરોખર સાચવે છે અને એ માણસો પોતાની શક્તિનો ઉત્તમ હિસાબ આપી શકે એવું વહીવિતી માળખું ઊભું કરે છે.

હવે પરિષદ વિશે વિચારીએ. એનું લક્ષ્ય શું હોય ? ઉત્તમ સાહિત્યના સર્જન, વિવેચન અને સંશોધનનું. એ માટેનું વાતાવરણ પરિષદ ઊભું કરી શકે તો એનું વહીવિતીત્ત્ર ઉત્તમ કહેવાય. એના સૂત્રધારોએ પહેલાં ઉત્તમ માણસોને ભેગા કરવાની દિશામાં ડગ માંડળાં હતાં. પરિષદ ઉત્તમ માણસોને લાવી તો શકી, પણ એ માણસો પોતાની શક્તિઓનું ઉત્તમ પરિષામ આપી શકે એવું વાતાવરણ ઊભું ન કરી શકી. એમને સાચવી પણ ન શકી. એટલે ઉત્તમ માણસો કાં તો મનમાં કડવાશ લઈને ખસી ગયા, કાં તો ત્યાં રહીને કુંડિત થઈ ગયા. એટલે પરિષદને પોતાનાં કામ બીજી, ત્રીજી, ચોથી હોણના માણસો પાસે કરાવવાં પડ્યાં. એમાંથી જે ફળ મજયાં

તે આપજી સામે છે. પરિષદ ઉત્તમ ફળ ન આપી શકે તે માટે વહીવિતીત્ત્રનો દાબ નહીં, નબળું વહીવિતીત્ત્ર જવાબદાર છે.

પ્રશ્ન થાય કે પરિષદનું વહીવિતીત્ત્ર નબળું કેમ બન્યું ? મને લાગે છે વહીવટકારોનું લક્ષ્ય સાહિત્ય પરથી ખસી ક્યાંક બીજે કેન્દ્રિત થઈ ગયું છે. જ્યારે વ્યાપક હિત પરથી ખસી સંકૃતિત હિતો તરફ વહીવટકારનું ધ્યાન કેન્દ્રિત થાય ત્યારે એ સંસ્થા ઉત્તમ ફળ ન આપી શકે. પણ રમણભાઈ, પરિષદ જ શા માટે, આપજી ઘણી જાહેર સંસ્થાઓ ઉત્તમ ફળ નથી આપી શકતી, કારણ કે વહીવટકારો સંસ્થાના મૂળ લક્ષ્યને ચૂકી જતા હોય છે. અને ઘણી વખત તો પોતે લક્ષ્ય ચૂકી ગયા છે એની સભાનતા પણ એમનામાંથી ચાલી ગઈ હોય છે.<sup>T</sup>

વડોદરા, ૧૭-૨-૦૬

- જ્યંત ગાડીત

r

પ્રિય રમણભાઈ

સંંગ અંક પદના 'પ્રત્યક્ષીય' બદલ તમને વિચારપૂર્વકના અભિનંદન ! તમારાં મોટા ભાગનાં નિરીક્ષણો સાથે મારે સહમત થવાનું બને છે. જોકે અસહમતિ એકબે પાયાના મુદ્દાઓએ છે.

તમે આરંભે ૧૯૭૩-૧૯૮૬ દરમિયાનની પરિષદની વિદ્યાકીય પ્રવૃત્તિઓનો જે ચિત્તાર આપ્યો છે તે સાચો જ છે. એ પછી વિદ્યાપ્રવૃત્તિ મંદ પડતી ગઈ એ પણ સાચું. પણ એ તંત્ર-પરકતા વધવાને કારણે ? આયોજનપૂર્વકનું તંત્ર તો પરિષદમાં કે દાઢે હતું ? ને તોય તમે દશાવિલા ગાળામાં વિદ્યાપ્રવૃત્તિ તો થઈ જ શકી હતી. તંત્રનો સામનો કરીને કરાઈ હતી ! તમે જ કહો છો કે ચંદ્રકાન્ત ટોપાવીળાએ વિદ્યાપ્રવૃત્તિનો હાથ ઉપર રાખ્યો. તો એમના અનુગામીના હાથે શું ઓછું આવ્યું ? એમ કહોની કે ટૂંકા પડ્યા !

છેલ્લા દાયકામાં વિદ્યાપ્રવૃત્તિ મંદ પડી તેનો દોષ તંત્રનો નથી. એ પરિષદના ત્રણ કાયમી વિદ્ધાનોનું મૌલિક પ્રદાન છે ! ને તંત્ર વિદ્યાપરક ન બન્યું તે પરિષદના તાંત્રિકોની ખૂલ્લી છે ! તમે કહો છો કે સંસ્થાએ આનો હિસાબ કેમ ન મંગ્યો. સંસ્થાએ એટલે કોણો ? સંસ્થાવતી હિસાબ તો પરામર્શકશી ચિમનલાલ ચિવેટીએ માંગવાનો હતો. ને એમની પાસેથી

[T એક 'ઈ-ઉ'માં લાયાયેલો પત્ર, લેખકની સંમતિથી, પ્રચલિત જોડણીમાં કરી લીધો છે. - સંપા.]

સંસ્થાએ. આજેય એમણે એ હિસાબ આપવો બાકી છે. સત્તિશેષ તો, અધૂરા હિસાબને નામે જે કવિઓનો ઈતિહાસ પ્રગટ કરાયો છે તે અંગેનો ! એ વાત ઉપર ફરી આવીશું.

પણ પરિષદની મૂળભૂત સમસ્યા તો છે, દસ્કાઓથી એડહોલ્ક પદ્ધતિએ ચલાવાયેલો – ચલાવવા દેવાયેલો – પરિષદનો વહીવટ. તંત્ર-પરકરા અને વિદ્યાપ્રવૃત્તિની મંદી એ બન્ને અલગ પ્રશ્નોનાં મૂળ મને પરિષદની વહીવટી શૈલીમાં જરૂર છે. રઘુવીરનું એમાં કેન્દ્રસ્થાને હોંનું એ અગત્યની બાબત જરૂર છે. પણ હું એ અંગે રઘુવીરને સ્વેચ્છાએ એમાં નિમિત્ત બન્નાર અને પરિષદના બહોળા વિદ્ધુગણને, અનુકૂળ માધ્યમ જાણી રઘુવીરને સતત કેન્દ્રસ્થાને જાળવી રાખનાર બે સ્વતંત્ર પરિબળો તરીકે જોઉં છું. જરા વિગતમાં ઉત્તરીએ –

આડમાથી દસમા દાયક દરમિયાનની પરિષદની વિદ્યાકીય તેમ જ લોકાભિમુખ પ્રવૃત્તિઓના સંકલનનું શ્રેય તમે પરિષદમંત્રી રઘુવીરને આપો છો તેમાં જે વિગતદોષ છે તે અંડલાઈન કરીને એક ઉમેરણ એ પણ કરું, કે વચ્ચાળાં ચાર વર્ષ દરમિયાન રઘુવીર પરિષદના કોઈ જ હોક્ક ઉપર નહોતા. એ ચાર વર્ષો દરમિયાન ડૉ. ચંદ્રકાન્ત ટોપીવાળાના વડપણ હેઠળની ક.લા. સ્વાધ્યાયમહિરની સીધી કામગીરીને બાદ કરતાં સંસ્થાની કામગીરી લગભગ થીજી ગયેલી. તે એટલી હદે, કે બેઠકોમાં કોરમ પણ નહોંનું થતું ! સાર એટલો, કે રઘુવીરના સીધા દોરીસંચાર વિના પરિષદમાં ડગલું ય ભરી શકવાની ક્ષમતા નથી એવો સર્વાનુમત વર્ષોથી કેળવાયેલો છે. જ્યંત કોડારી કે ચંદ્રકાન્ત ટોપીવાળા જેવા અપવાદોમાંથી પ્રેરણા લેવાની તત્ત્વરતા ચૂંટાયેલા સભ્યોમાં અઝેભાગે ગેરહાજર જ રહી છે. હવે તમે જ કહો કે ‘અગ્રણી’ ‘અગ્રણી’ ન રહે તો કેમ ન રહે ? જે સંસ્થામાં ઉમેદવારી નોંધાવાને ચૂંટાયેલા હોદેશારો પણ ‘અગ્રણી’ની છત્રી પકડીને ચાલવાની પરંપરા પાળતા હોય એ સંસ્થાને તો ગોવર્ધન પણ કેમ બચાવે ?

રઘુવીર અને પરિષદના સંબંધ વિશે ગુજરાતી સાહિત્ય પ્રદેશમાં જાણીતું પદ છે : ‘રઘુ કરે સો હોય.’ જ્યાં પદ છે ત્યાં પૂજા પણ હરો. વ્યક્તિ રઘુવીરનો સામનો કરવાને બદલે તેમની મૂર્તિ સ્થપાઈ. કોણે સ્થાપી આ મૂર્તિ ? વેલ, એ રહસ્ય ભાંગવા કરતાં જેટલી વહેલી એ મૂર્તિ ભાંગીએ એટલું પરિષદ ને સર્જક રઘુવીર બેઉ માટે લાભકર્તા થશે.

છેલ્લા ત્રણ દાયકાથી રઘુવીરે મંત્રીથી ટ્રસ્ટી સુધીનાં વિવિધ પદો ઉપર રહીને જે – તે મુદ્દત દરમિયાન તે-તે પદની

મર્યાદાસરનાં જ કામો કર્યા છે ? કે પછી, પદ કોઈ પણ હોય, પરિષદના તમામ વિભાગોના વહીવટને લગતા નાનામોય તમામ નિર્ણયો એમની સૂચના કે આદેશથી જ લઈ શકાયા છે ? જો એમ જ થયું છે તો એમાં હું સ્વતંત્ર નિર્ણય ન લઈ શકતા હોદેશારોનો દોષ મોટો ગણીશ.

આ રીતે સતત પરિષદના કેન્દ્રમાં રહેવાની રઘુવીરની હોંશ હતી એમ ધારી લઈએ તોપણ, એક વ્યક્તિની આ જાતની હોંશ પૂરી કરવામાં જૂજ અપવાદોને બાદ કરતાં કેટલાએ બંધારણીય રાહે સ્પષ્ટ વિરોધ કર્યો ? કેટલાં રાજનામાં પડતાં ?

સત્તાના આવા વિધાતક કેન્દ્રીકરણ તરફ આંખ આડા કાન કરવામાં પરિષદના ચૂંટાયેલા સભ્યોની માનસિકતા ઉધારી નથી પડતી ? સૌને સાચવીને સત્તા સાચવવાની રઘુવીરની આવડતના મૂળાં સચ્ચાઈ જવા તત્પર સભ્યોનું ભારોભાર યોગદાન ખરું કે નહીં ?

સંસ્થાને એક શિખરે પહોંચાડ્યા પણી અગ્રણી પછો વળી જાય ને બીજાઓને માર્ગ કરી આપે એવી ‘દીષ પરંપરા ન પળાઈ’ એનો તમે ખરખરો કરો છો. ખરો ખરખરો તો એ વાતે કરવો રહ્યો કે લોકશાહી ઢબે ને બંધારણીય રાહે કામ કરવા વચ્ચનબદ્ધ સંસ્થાને ત્રણત્રણ દાયકાથી ડગવે ને પગવે એકના એક ‘અગ્રણી’નો ખપ શા સાચુ પડે ? ને જે સંસ્થામાં ચૂંટાયેલા સભ્યોને પોતાનાં કામો ‘અગ્રણી’ના દોરીસંચાર વિના કરવાં જ ન હોય એ વળી સંસ્થા કેવી ? તમારી પાસેથી જાણેલું અવતરણ ઉપયોગમાં લઈ તો ‘સંચે શક્તિ કલ્પી યુંગ’ એ પરિષદ માટે કેમ સાચું નહીં ? કે પરિષદમાં હજુ કલિયુગ નથી બેઠો એમ માનવું ?

છેલ્લાં ચાર વર્ષ દરમિયાન (૨૦૦૨-૨૦૦૫) પરિષદની કારોબારી સમિતિના કેટલાક સંક્રિય સભ્યોએ એકમેકથી પણ સ્વતંત્ર રહીને પરિષદના વહીવટી પ્રશ્નોને સુલજાવવાની નક્કર મથ્યમાં કરી છે એવો મારો દાવો છે. ‘અગ્રણી’ના દોરીસંચારની પરવા ન કરીને કામે વળગેલા ચૂંટાયેલા સભ્યોના રસ્તામાં અસહકારથી માંડીને બદનક્ષી સુધીનાં વૈવિધ્યપૂર્ણ રોડાં નાખનાર એ ‘અગ્રણી’ નહીં, પણ એ ‘અગ્રણી’ની આડમાં પોતાનો પ્રમાદ પોષતા પરિષદના કાર્યકરો અને કર્મચારીઓ હતા. ને તેમ છતાં આ ગાળામાં પરિષદ રચનાત્મક રાહે પ્રશ્નોની જેટલી મોંઢામોંઢ થઈ શકી છે એટલી અગાઉ ભાગ્યે જ થઈ હતી. આ કેવી રીતે શક્ય બન્યું ? -

- વાતેવાતે રઘુવીર પાસે દોડી ન જતાં, ઠરાવો અને બંધારણને અનુસરવાથી.
- પરિષદ્પ્રમુખને શિરે સંસ્થાના વહીવટી વડા તરીકેનો અને કારોબારી સમિતિને માથે કામનો ભાર છે તે સ્થિતિ સ્વીકારીને તથા તે મુજબના બંધારણીય સમીકરણને સપાટી ઉપર લાવીને.
- પરિષદ્ધની વહીવટી અને આર્થિક સ્થિતિનો અભ્યાસ કરીને તથા તે ઉપર સતત નજર રાખીને.
- સ્વતંત્ર અભિપ્રાયો પ્રગટપણે વિવિધ બેઠકોમાં સ્પષ્ટપણે રજૂ કરીને. અને તેની ચર્ચા દરમિયાન વખત આવ્યે પ્રમુખ અને અથવા રઘુવીરથી વિરુદ્ધના મને મક્કમ રહીને.
- પરિષદ્ધનો વહીવટ પારદર્શક બને તે માટે લોકશાહી રાહે સતત મથતા રહીને.
- વખતોવખત મુદ્દાસર લેખિત રજૂઆત કરીને.

આના સામા પક્ષે દસકાઓ જૂની સ્થિતિ એ રહી છે કે મોટા ભાગના ચૂંટાયેલા સભ્યો પરિષદ્ધના બંધારણનો કે એજન્ડા, ઠરાવો અને મિનિટ્સનો અભ્યાસ કરવા જેટલી પણ તસ્ટી લેતા નથી. મધ્યસ્થ સમિતિના મોટા ભાગના સભ્યો વક્તાઓનાં નામો સૂચવવાથી વિશેષ કશી કાર્યવાહી અંગે ચર્ચા કરવા જેટલો પણ રસ દાખવતા નથી. ચૂંટાયેલા સભ્યોની આ પ્રકારની નિઝિયતાને પરિણામે સંસ્થાનો વહીવટ વ્યક્તિકેન્દ્રી બને ને સંસ્થા ‘અન્યોન્યહિતવર્ધક સભા તરીકે ફ્રસ્ટ’ થતી ચાલે એમાં કોઈને આશર્ય ન થવું જોઈએ.

હકીકતમાં તો, મુનશી કે ઉમાશંકર કે રઘુવીર કે યદુવીર કે કોઈ પણ વ્યક્તિ કે જૂથ નહીં, સંસ્થાના બંધારણીય હેતુઓ કેન્દ્રમાં હોવા ખાપે. પરિષદ્પ્રમુખ પણ યોય ઉપર ભલે, પણ કેન્દ્રમાં ન જ હોય. રઘુવીરમાં પરિષદ્ધના તમામ નાનામોટા દોષો ઓફાવા જેટલી મહત્તમ નથી એ મારો સ્પષ્ટ મત છે. સંસ્થાને વિકસાવવા અંગેનું એમનું દર્શન રોમેન્ટિક અને અવ્યવહારુ હોઈને હંમેશાં મર્યાદિત જ રહ્યું છે એમ પણ મને લાગ્યું છે. પણ એ માત્ર એમનું વ્યક્તિગત જ નહીં, પણ એ ગાળાની લાગતલગાટ સાતથી આઈ મધ્યસ્થ સમિતિઓના ચૂંટાયેલા સભ્યોનું સહિયાસું દર્શન હતું એમ જ હું તો માનું. એટલે કે, ઉમાશંકરથી માંઠીને તમારામારા સૌના દર્શનની આ જાંખપ હતી. માટે, આજપર્યત જેમણે રઘુવીરના યશમાં ભાગ પડાયો છે એ તેમના ચુરુલઘુમિનોએ સૌએ પરિષદ્ધની હાલની સ્થિતિ માટે પોતાને ભાગે આવતો દોષ કબુલ કરવો જોઈએ.

મૂર્તિવંત રઘુવીરમાં ભોળાભાવે, ને પરિષદ્ધનું હિત સાધવાના ગ્રામીણ સંસ્થા-સંયોજન-વિભાવથી પરિષદ્ધની ભૂલો પરતે ઢાંકપિછોડો કરવાનો પણ મહાદીષ રહેલો છે. તેવે પ્રસંગે પણ એમના સમવયસ્કો કે વડીલોને પરિષદ્ધનું હિત આગળ ધરી પહેલ કરવાનું સૂઝાયું નથી. ઉદાહરણથી આ મુદ્દો સ્પષ્ટ થશે.

ઇતિહાસનો કહેવાતો પાંચમો ભાગ પ્રગટ થયો તે શું સાચેસાચ આખેઆખો પાંચમો ભાગ છે ? ના. એ સાડાચારમો છે. એટલે કે ક. લા. સ્વાધ્યાયમંદિરની છેલ્લા દાયકાની કામગીરી ભલે ઓછી પણ એક આજા ભાગ જેવી તો છે એવો ભમ ઊભો કરી એનું ક્ષમાપાસું ઉપસાવી પ્રજાને છેતરવાનો આ નિજીય આમ તો પરામર્શન સમિતિનો હોઈ શકે. પણ તમાસ કરશો તો આ પાપનું નૈવેદ્ય પણ ‘કૃષ્ણપર્ણ’ કરવામાં આવશે એવી મને આશંકા છે.

ઉપરના ઉદાહરણથી એ સ્પષ્ટ થશે કે રઘુવીરની મૂર્તિ સ્થપાઈ એમાં રઘુવીરથી વિશેષ એમની મૂર્તિના બગભગતોએ એનો વધુ ગેરલાભ ઉંગલ્યો છે એ બાબત કારણરૂપ છે. પરિષદ્ધનું હિત એ મૂર્તિ અને પેલા બગભગતો બેને રિવરફન્ટ પ્રોજેક્ટમાં દાન કરી દેવામાં છે.

રઘુવીર, સંસ્થાની સામૂહિક હેસિયતને અભાવે પણ, પોતાના મુત્સુદીપણાના બળે, અંગત કલ્યાન મુજબનું ઊડાન કરવા-કરાવવાની જે રોમેન્ટિક ખેવના સતત રાખ્યા કરી તે તેમનો વધુ એક મહાદીષ ! જેને પરિણામે, એમજો હંમેશાં સ્વેચ્છાએ એકલે હથે ખેતર ખેડવાનો ઉપાડો લીધો, અને પરિષદ્ધના અન્ય સૌ સભ્યોએ ખેડટાડો આંખ આડા કાન કરતા રહીને સીજીન બેસતાં વરસોવરસ લીલોસૂકો પોંક ખાધો. કેટલાકે વળી પોંકને ખોરો પણ જાહેર કર્યો. ને કેટલાક આસપાસનાં બીજાં ખેતરો ભાણી પણ વળ્યા. પણ પરિષદ્ધના ખેતરની વાત કરીએ તો ક્યારેક જ્યારે કેટલાકને ઓછો તો કેટલાકને વધુ પોંક મણ્યો, ત્યારે લાગતાવળગતાઓએ, એકલદોકલ, ખેડૂતસાહેબ પાસે પહોંચી જઈ પોતપોતાના ખોબા જેવી રાવ નાંખો. ને મુત્સુદી ખેડૂતશીએ એ અંગે પણીના વર્ણ ન્યાય કરવાનું વચ્ચેન દર્દી છૂટાછૂટી હોઈને પણ બેગા જણાતા સૌને ખેતરને શેડે બેસાડી રાખ્યા. આમ, સૌ કાલની આશાએ સાંકડમૂક અને અડાખેપડાખે ખેતરશેડે બેસી રહ્યા. પણ કાલ કોણો દીઠી ?

જેને તમે ‘ખેવના’થી ‘આરપાર’ લગી વિસ્તરેલી ‘કમનસીબ’ ‘પરિષદ્ગાથા’ કહો છો તે ‘નિરીક્ષક’ સુધી જે

રીતે વિસ્તરી એમાં પરિષદના વિશુદ્ધિકરણના એ યોજનાબદ્ધ તરકટનું રહસ્ય સમાયેલું છે એ કરી તમે સાવ ચૂકી ગયા છો. વળી, આ છમકલાને તમે તેજાબ-પરીક્ષાણ ગણાવતા હો તો શાસ્ત્રીય ઢેભે સંસ્થાની કામગીરીનું મૂલ્યાંકન કરી તેને અંગે સચોટ ઉપાયો સૂચવવા સુધીની મારા જેવા એક અદના કરોબારી સભ્યની કોર કમિટીના હેવાલ અંગેની મહિનાઓની કામગીરીને તો તમે શું કહેશો? પરિષદનું પોસ્ટમોર્ટમ?

રમણભાઈ, પરિષદ અંગેની તમારી ટીકાના મુદ્દાઓ ‘આરપાર-નિરીક્ષક’ની પેલી ‘પરિષદગાથા’ના કંકરા-કાદવથી સાવ ભિન્ન, ને ભિન્ન સ્તરના છે. તો પછી લાલ આંગે પરિષદની પ્રત્યક્ષ થવાને બદલે પીળા પત્રકારોની શૈલીમાં તમારી જ નિર્ભેણ દસ્તિને તમે ‘પરિષદની આરપાર’ એવું શીર્ષક શી રીતે સૌંપી શક્યા? નહીંતર પછી, એ તમામ કાદવાસ્થળીની સાર્વંત છાણવટ કરી દૂધ ને પાણી અલગ તારી બતાવવાની જવાબદારીમાંથી કેમ અળગા રહ્યા? શાહી પ્રકશના વાતોડિયા વાયરસ તમને પણ આમ અમસ્તા જ અડી લાગ્યાં કે શું? હું તો આને નિરીક્ષકદોષ કહીશ.

સરવાળે, તમે સ્વીકારો કે ન સ્વીકારો, આપણા વતી હું તો સ્વીકારીશ કે પરિષદનો સ્પષ્ટ ને વાજબી વિરોધ કરવામાં આપણે એક દાયકો મોડા પડ્યા છીએ. તોય, બેટર લેટ ધેન નેવર!

પરિષદ હવે શું કરવું તે વિશેના તમારા વિચારો સાચે જ મહત્વના છે. શતાબ્દી પ્રકાશનશ્રેષ્ઠી, વાર્ષિક ગ્રંથસૂચિ, સાહિત્યકોશ-સંવર્ધન, પરબ, સ્વાધ્યાયપીઠો, એચ. એમ. પટેલ અનુવાદકેન્દ્ર, પુસ્તકપ્રદર્શનો, પરીક્ષાપ્રવૃત્તિ અને છેવટે પરિષદના ઈતિહાસ વિશેનાં તમારાં તમામ નિરીક્ષણો સાથે હું સંપૂર્ણપણે સહમત છું. પણ...

...જો પરિષદ પાસે સમ ખાવા જેવું પણ સંધર વહીવિશી માળખું બચ્યું હોય, તો તો હાલ ને હાલ આ બધાં નિરીક્ષણોને અમલમાં મૂકવા જેવાં છે. પણ, શું વાતનીક ભોય ઉપર આજે આમાંનું દસમા ભાગનું કામ કરવુંથી સંભવ છે? છેલ્લા દાયકામાં વિદ્યાકીય પ્રવૃત્તિઓના બારામાં ક. લા. સ્વાધ્યાયમંદિરે જે ભોપાલનું કાઢી બતાવ્યું છે એ પછી એ અંગે કશી આશા રાખવાને આપણી પાસે કારણ રહેણું નથી.

તમારી અપેક્ષા મુજબ પરિષદ માટે સાહિત્ય અને વિદ્યાવિસ્તાર માટેની કલ્યાનશીલ યોજનાઓ અંગે જ સંક્ષિય રહેવાનું હાલ એટલે અસંભવ છે કે તમે જેણે વહીવટ-તંત્રની ‘આંતરિક ઘડભાંજ’ કહો છો તે કોઈ મામૂલી જવર નથી, બર્ડ

ફ્લૂ છે! ગુજરાતની આ શતાબ્દી સંસ્થાને નામશોષ કરી શકવા એ પૂરેપૂરો સમર્થ અને સજજ છે!

આજના દિવસે જે કામ તાકીદનું બની રહે છે તે છે, ‘સંદે શક્તિ કલ્યા યુગે’ એ ન્યાયે નવેસરથી ખેતર ખેડવાનું, એ માટે પહેલાં બીજ, ને હળ અને પછી હંકનારા ને વેંગારનારા જોઈશે, ને પછી સારા વરસાદની ઉમેદ... અન્યથા, જેમ ગુજરાતી ભાષા અને સાહિત્યનું, તેમ, ગુજરાતી સાહિત્ય પરિષદનું ભવિષ્ય પણ ધૂધણું ને વધુ ધૂધણું જ બનતું રહેવાનું એ વિશે મને લેશમાત્ર આશંકા નથી.

અમદાવાદ, ૨૪-૨-૦૬

- પરેશ નાયક

તા.ક. ક્યારેક પરિષદના ટ્રસ્ટીમંડળ અને ચુંટાયેલી સમિતિઓ વચ્ચેની વિઘાતક ખાઈ વિશે પણ લખવું છે. શું કરું? વખત નથી બચતો. બચે છે તે વીતંડાવાઈ ‘નિરીક્ષકો’ ખાઈ જાય છે. એમને તમારી પેટે ‘પ્રત્યક્ષ’ થતાં શીખવો ને!

- પરેશ.

r

સેહી મુ. રમણભાઈ,

‘પરિષદની આરપાર’ જોવાની ફરજ પડી અને એ પણ શતાબ્દીયાજે જ. સમૂહમાધ્યમોનો આભાર માનવો જોઈએ! તમારી ‘પ્રત્યક્ષીય’ (અગ્રેલેખ)માં એક ઊડી નિસબત ચોક્કસ વરતાય છે જે તમારા પરિષદ સાથેના પૂર્વનુસંધાનને કારણે તેમજ એક સાહિત્યિક ગ્રંથસમીક્ષાસામચિકના સંપાદકના નાતે હોવાનું પણ સમજાય છે.

મારા મતે પ્રશ્નની તેજાબપરીક્ષાણ પ્રક્રિયા હાથ ધરવી જ હોય તો હજુ થોડા આગળ જવાની જરૂર છે. ગુજરાતી સાહિત્યકારની કોઈ ઊંચેરી ઠસેજ કેમ ઊભી થઈ આવતી નથી? સાહિત્યકારોની જમાતને સમાજ કેમ ગંભીરતાથી દેતો નથી? સમાજના જાહેર પ્રશ્નોની વેળાએ એ સ્વતંત્ર, સ્વાયત્ત અને ઊંચેરો બનીને બહાર આવેલો કદ્દી દેખાયો છે ખરો? હા, નામપૂરતા ઠરાવો કરીને તેણે ફાઈલ ટીકિટાક જાળવી છે જે પુરાવારૂપે રજૂ કરી શકાય!

પરિષદ ગુજરાતાનિયમનતંત્રની કામગીરી બજાવે તે અવશ્ય અપેક્ષિત છે. પરંતુ તેમ કરવા જતાં તેણે ચારેબાજુથી ઘણી બાદબાકી કરી છે અને તેણું આ પરિણામ છે. સુરેશ જોખી, નિર્જન ભગત, લાભશક્ર ઠાકર જેવા ખરા સાહિત્યકારો એકાળે વિમુખ હતા. તો બીજી તરફ ચંદ્રકાંત બક્ષી, સુરેશ દવાલ, ગુણવંત શાહ જેવા લોકપ્રિય-પ્રજાપ્રિય

સાહિત્યકારોને પણ વિમુખ કરાયા. રામમનોહર લોહિયા જેમને બગાઈ (gadfly) કહેતા તેવા હિંમત ખાટસૂરિયા, સરુપ ધ્રુવ, હીરેન ગાંધી, મનીષી જાની, નીરવ પટેલ જેઓ સાહિત્યનો સામાજિક અનુબંધ સાબૂત રાખવા સક્રિય હતા તેમના મુદ્દાઓને સભાનપણે નજરઅંદાજ કરવામાં આવ્યા.

આજે હવે પરિષદ અમદાવાદમાં અને અધ્યાપકોમાં અટવાઈ ગઈ છે એમ કહીએ તો બહુમતીવર્ગને મારું જ લાગશે. અધિવેશન અને વ્યાનસત્રના મેળાવડા જરૂર થતા રહે છે પરંતુ સાહિત્યકારોનો સ્વતંત્ર અવાજ તમને ક્યાંયે સંભળાય છે ખરો ? આ હોય ને તો વહીવટ અને બીજા પ્રશ્નો ગૌરા બની જાય. મકાન ને હોલ ને પ્રદર્શન ને 'પરબ' ને પ્રકાશન આ બધાં તો વાનાં છે પણ હું વાત 'ગ્રાણ'ની કરું છું. ઘણા બધા તો ભાગબાટીમાં પડ્યા છે. આ વ્યાખ્યાન અને આ નિમણૂક, આ ઠનામ અને આ પુસ્તક કે સંપાદન. વળી આ બધું ગુજરાતી અસ્મિતા મુજબ સૌજન્યપૂર્વક ને સિફતીથી થાય છે. નહીં તો જાહેરજીવનને વરેલા અગ્રણીનો પગ સુધાં 'ખોખરી જાલર'ને ઠનામ આપવાના કુડાળામાં કેવી રીતે પડે ?

એચ. એમ. પટેલ અનુવાદ પ્રકાશન કેન્દ્રનો ખ્યાલ સર્જનાત્મક ગુજરાતી સાહિત્યને બિનગુજરાતીઓ સુધી પહોંચાડવાનો હતો. ભંડોળ પણ ઉભું કરવાનું હતું. ડૉ. ભોગીલાલ સાંડેસરાના વિદેશસ્થિત કુટુંબીજનોએ દાન આપ્યું. બિનસર્જનાત્મક કૃતિઓના અનુવાદો અને અંગેજમાંથી ગુજરાતી અને ભારતની અન્ય ભાષાઓમાંથી ગુજરાતી કરવાની દરખાસ્તો ઘણી આવતી રહી જે કામ કેન્દ્રએ નહોંતું કરવાનું. વળી પ્રકાશનો કરીએ તો તેના વેચાણનું શું એવો હરહંમેશનો પ્રશ્ન તો મોં ફાડીને ઊભો જ હતો.

મારે અનુવાદકણ વિશે પ્રકાશન તથા અત્યાર સુધીમાં અંગેજમાં મુકાયેલા ગુજરાતી સાહિત્યની સૂચિનું કામ કરવું હતું. પછી કર્યું ગુજરાતી સાહિત્ય અગ્રમીતાના ધોરણો હાથ પર લેવું તેની યાદી તજ્જીવની મદદથી તૈયાર કરવી હતી. લાલુભાની સહાય મળતી હતી. વિનોદ મેઘાણીએ કરેલો અનુવાદ આવી દ્વિધાભરી પરિસ્થિતિમાં હાથ પર ન લઈ શકાયો તેનો રંજ મને કાયમ માટે રહેશે. નિરંજન ભગતનાં ચૂંટેલાં કાવ્યોનો અનુવાદ પ્રકાશિત કરી શકાયો તેનો બધો યશ કવિ અને અનુવાદકને જાય છે. પરિષદની અંદરોઅંદરની ખટપત અને એમાં મિત્રોની સામેલગીરીએ મને અંદરથી ઘણો વ્યાખ્યાત કર્યો. હું માત્ર સમયાવધિ પૂરી થાય એની રાહ જોતો

રહ્યો અને અંતે રાજનામું મોકલી આપ્યું.

જે પરિષદને બે-ત્રણ હજાર સભ્યો-ગ્રાહકોવાળું મુખપત્ર 'પરબ' હોય તે પોતાની સંજીવિ પેશ કરવા બસો-પાંચસો શુભેચ્છક-ગ્રાહકોવાળા 'નિરીક્ષક'ના મંચનો ઉપયોગ કરવા જાય અને પેલા અગ્રણી વળી તેમ હોશેહોંશે પરિષદગ્રોત્યર્થે બધું કરવા દે ! ઘણાબધા હિસાબો ગુજરાતના સાપ્તાહિક વિચારપત્રના ધોબીઘાટ પર ચૂક્તે થયા હોવાનું કોણ નથી જાણતું ? જેમ પરિષદનું, તેમ ગુજરાતી સાહિત્યકારોનું અને તેમ જ ગુજરાતના બૌદ્ધિકોનું અને તેના વિચારપત્રનું. આ malaise (અ-સ્વસ્થતા)ના મૂળિયાં ક્યાં ક્યાં ફેલાય છે તે જોઈ-જાણોને છળી મરાય તેવું છે.

'પરબ' તો નહીં કરી શકે કારણ તેની એક પરંપરા છે. પ્રત્યક્ષ' તેના નામને સાર્વદ્રક કરવાનો ધર્મ સુપેરે બજાવવા તત્ત્વ જાણાય છે ત્યારે તેને અભિનંદન અને આ થોડુંક લાંબું અને દૂરનું દર્શન નજરઅંદાજ ન થાય તે હેતુથી.

વડોદરા, ૨૦-૨-૦૬

- ડંકેશ ઓળા

r

તંત્રીશ્રી,

'પ્રત્યક્ષ' (૫૬), ભાવનગર થઈને [અર્થી] મળ્યું 'પ્રત્યક્ષીય'માં 'ભાવનાઓનું ગફગદ ગાન' કહ્યું છે તે મેં પણ 'પરબ'માં અનુભવેલું.

પરિષદ વિશે તમે લખ્યું તેમ [સ્થિતિ] 'કમનસીબ' છે. મારા જેવાને દૂરથી જોતાં થાય કે આ કે તે વ્યક્તિને બદલે બીજ આવે તોય અત્યારે આથી વિશેષ કેટલુંક થઈ શકે એમ છે ? ઉ.જો.એ. 'સંસ્કૃતિ' વિશે એવું કંઈક લખેલું કે આપણા સમગ્ર લેખકસમૂહનું જે સ્તર (-મૂળમાં 'નૂર') છે તેથી ઊંચું કોઈ સામાચિકનું ન હોઈ શકે. પરિષદ કે આપણી બીજ સંસ્થાઓ પણ એકદરે આપણા સમાજનું જે સ્તર અત્યારે છે તેનાથી ઊંચે બધું ન ઊડી શકે. સમાજનું એ સ્તર ઊંચું લાવવાના પ્રયાસો જેઓ કરે છે તેમણે જે વધુ જોર લગાવવું રહ્યું.

અમદાવાદ, ૨૪-૧-૦૬

- મહેન્દ્ર મેઘાણી

r

પ્રિય રમણભાઈ,  
સેહ-સ્મરણ

'પ્રત્યક્ષીય' (ડિસેમ્બર, ૨૦૦૫)ના સંદર્ભે બે વાત લખવાનું મન થયું; અને તે આ :

તમે કહો છો એમ, ખરે જ, આઠમો દાયકો પરિષદ-પ્રવૃત્તિનો વિદ્યા-પ્રવૃત્તિના ઉજાશનો દાયકો છે; પણ પછીનો સમય તો નિસ્તેજ જ પ્રતીત થાય છે !

આમ તો ગુજરાતી સાહિત્ય પરિષદનો ઈતિહાસકમ આવો ચઢાવ-ઉત્તાર દાખવે જ છે ! છતાં, છેલ્લા બે દાયકામાં કેમ એવી છાપ ઊભી થાય છે કે વહીવટી પાંખ ઈષ મુક્ત પ્રવૃત્તિને નૃગળાવે જ છે !?

શું વિદ્યા અને વહીવટ વચ્ચેનો ગજગ્રાહ ન જ મિયાવી શકાય ? વિદ્યા ઉદારતામુખી રહે અને વહીવટ તો વર્ચસ્વ-જ્ઞાવમાં જ સાર્વકર્તા ભાગે ? આ વિષમ પરિસ્થિતિ છે, અને તેનું નિવારણ વહીવટી પાંખે આંતરનિરીક્ષણ કરીને સત્તવરે કરવાનો સમય પાડી ગયો છે. તમારો આ ઊહાપોહ એનું આરંભાંધું બની રહો.

વળી, ગુજરાતી સાહિત્ય પરિષદનું આ શતાબ્દી પર્વ છે, ત્યારે સંસ્થાને 'ગુજરાત ભારતવાસી' હોવાની પોતાની ઓળખ માટેની પ્રવૃત્તિનો વ્યાપ રચવો જોઈએ. સાહિત્યના માધ્યમ દ્વારા ગુજરાતની સાંસ્કૃતિક આબોહવાનો સંચાર કરતા રહેવાની નેમ પરિષદનાં અનેક કાર્યોમાં સ્થાવી રહેવી જોઈએ. સજ્જન-વિવેચન - સંશોધન - સંકલન જેવી વિદ્યાવિસ્તારની વૈયક્તિક અને વગ્યા ધોરણે અત્ર-તત્ત્વ થતી રહેતી પ્રવૃત્તિઓનું સમ્યક દાખિએ સંયોજન કેવી રીતે હાથ ધરાય, એ દિશામાં પરિષદ-વહીવટ-પરિવારે સક્રિય ધ્યાન ઠેરવવું જોઈએ.

ગુજરાતીભાષી સારસ્વતો અંગત રુચિ-અરુચિનાં વલણોથી ગ્રસ્ત જણાય છે. ઠેકેદારોને ઉછેરવાની અને વળી સ્વતંત્ર રહેવાનું ઈચ્છાતાને ઉપેક્ષાપૂર્વક, મોકો મળ્યો ઉપખાસથી ખસેડવાની પેરવી વિસ્તારવાનું વલણ છેલ્લા બે દાયકાથી ચાલ્યા કરે છે. સાહિત્યક્ષેત્રનાં ભુલાયેલાં સ્વજનો પાસેથી સ્મૃતિમંજૂલા ફંઝીસવાની તક મેળવી, અવિભિત્ત મનોગતોનું આકલન કરવાનો પ્રકલ્પ કોઈને સૌંપાય તો 'ગુજરાતી સાહિત્ય પરિષદનો ઈતિહાસ' હકીકતનિષ્ઠ બનાવી શકાય.

'પરબ'ની ભૂમિકા મહત્વની બની રહેવી જોઈએ. ઉત્તમ લેખનસામગ્રી માટે વિદ્વાનોને નિમંત્રણ આપતા રહેવું અને સંભો નક્કી કરીને વ્યાપક સાહિત્યલેખન/પ્રવૃત્તિને આવરી લેવાં એ કર્તવ્ય 'પરબ' બજાવે તો મોટી સંસ્થાનું મોટું સામયિક એ બની રહે. બાકી તો, વૈયક્તિક ભૂમિકાએ શરૂ થતાં ઘણાં સામયિકો કેટલાંક તો સંપદ (ઓસેટ) રૂપે નહીં પણ

આપણો માથે જવાબદારી(વાયેબિલિટી) રૂપે હ્યાત છે. આ છેલ્લા મહિનાઓમાં જ કેટલાંક નવાં સામયિકો શરૂ થયાં. કયા વિશેષ ધ્યાયથી ? એ સંજોગોમાંચ 'પરબ'નું ઉત્તરદાયિત્વ વહે છે. એ નહીં થાય તો કશો સેતુ જ નહીં રચાય.

આઠમા-નવમા દાયકાની પરસ્પર તુલના કરીને, પૂરી નિસબત અને ઉત્તરદાયિત્વથી, પ્રત્યક્ષીયમાં ઉઠાવાયેલા પ્રશ્નો અને એ પરિસ્થિતિમાં બહાર આવવા માટેનાં અપાયેલાં હંગિતો સાથે હું સર્વથા સંમત છું.

કુશળતા પ્રાર્થું છું.

વડોદરા, ૩-૩-૦૬

- સુભાષ દવે

r

પ્રિય રમશ્યભાઈ,

તમારું 'પરિષદની આરપાર' સંપાદકીય સૌ સંપ્રેષ સાહિત્યપ્રેમી વ્યક્તિને સ્પર્શી શકે તેટલું સજ્જવ અને મૂળગામી છે. તમે વિદ્યાકીય પ્રવૃત્તિનો ઉત્કર્ષ ઈચ્છનાર એક ચેતનવંતી વ્યક્તિના કેન્દ્રથી ગુજરાતી સાહિત્ય પરિષદના સત્તાવાહી બેઠોળ ચહેરાને સંયત સ્વરે હદયની ભાષાથી ઉઘાડો પાડ્યો છે. પરિષદની વિદ્યાકીય પ્રવૃત્તિઓમાં પડેલાં ગાબડાંગોનાં કારણ જાણવા માટે જે વેધક પ્રશ્નો ઉધાવ્યા છે તે ખૂબ જ જરૂરી હતો. તમારી ચિંતામાં સહભાગી થવા નિમિત્તે મારા વિચારો રજૂ કરું છું. તમારા સંપાદકીય નિમિત્તે આ વિચારો પ્રગટ કરવાની મને જે તક મળી છે તે બદલ હું તમારો આભારી છું.

મને એવું લાગે છે કે આપણો સૌઓ ભેગા મળીને એક બૌદ્ધિક મંચની રચના કરવી જોઈએ. આપણે સૌ કલાપ્રિય છીએ પરંતુ દુઃખની વાત એ છે કે આપણી વચ્ચે બૌદ્ધિક સંવાદની કોઈ ભૂમિકા જ રહી નથી. એને કારણે ગુજરાતી સાહિત્ય પરિષદ હોય કે ગુજરાત સાહિત્ય. અકાદમી હોય કે અન્ય કોઈ અંગત સાહિત્યિક વર્તુળો હોય તેમના સંચાલકોની સ્વહિતલક્ષી પ્રવૃત્તિઓનું દબાણ રહેણું હોય છે. સાહિત્ય અકાદમી સત્તા મેળવવાની હોંસાતોંસીને કારણે સરકારી વહીવટદારોના હાથ નીચે એક વહીવટી દફ્તર બની ગઈ છે. ગુજરાતી સાહિત્ય પરિષદમાં પણ મંત્રીપદ માટેની હોડ વચ્ચે એકબીજા પર થૂંક ઉગડવામાં જરાય સંકોચ દાખલ્યો નથી. અંગત સાહિત્યિક વર્તુળો સમાન વિચારની ભૂમિકા વિના તેમની પ્રભાવકતા ગુમાવી રચાય છે. તમે નોંધ્યું છે તે મુજબ વહીવટદારોનો દાબ વધતો રહ્યો છે એટલું જ નહીં પણ તેમની પ્રવૃત્તિઓનો વિરોધ કરનારાઓને એ લોકો સતત હંસિયામાં

ઘડકી દે છે. ચેતનશીલ સાહિત્યપ્રેમીનો આત્મવિશ્વાસ કીણ કરી નાખવાની કૂર રમતો રહે છે. હવે એ સત્તાભૂષ્યા સરમુખત્વારો તેમની તમામ મર્યાદાઓ વટાવી ચૂક્યા છે. આવી કોકટીબરી પરિસ્થિતિમાં માર્ગ કરવા માટે એક બૌદ્ધિક મંચની રચના અનિવાર્ય છે.

વહીવટકારોની સત્તા માત્ર સાહિત્યિક સંસ્થાઓ પૂરતી મર્યાદિત નથી રહી પરંતુ ખાનગી ટ્રસ્ટ, ફાઉન્ડેશન, ધર્મ-સંતો અને આચાર્યો સુધી વિસ્તરેલી છે, ભરતો લઈને બેઠી છે. એક સવાલ હમણાં હમણાં મને ખૂબ જ સત્તાવ્યા કરે છે કે સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ આજે ઉમંગ અને ઉલ્લાસથી સાધુસંતો અને આચાર્યોની નિશ્ચામાં ભેગા થતા જોવા મળે છે, તો તે બધા એવા કોઈ ટેકાઓ વિના માત્ર સાહિત્યપ્રીતિના બળે શા માટે સંવાદ કરતા નથી? જો એ ધાર્મિક-સાંસ્કૃતિક અનુષ્ઠાનો કે પર્વો નિમિત્તે પરસ્પરથી જુદી જીવનભાવના અને સાહિત્યભાવના ધરાવનારા ભેગા થઈ શકે છે તો તેમાં કોનું ખેંચાણ નિર્ણાયક બનતું હોય છે તેનો વિચાર કરવાની જરૂર છે. એવાં ખેંચાણો વધુ ને વધુ પ્રમાણમાં ગતિમાન બન્યાં છે તેને કારણે વહીવટકારોના હાથ વધુ મજબૂત બન્યા છે. દરેક જુથ જાણે અંબું પુરવાર કરવા તત્પર બનવા લાગ્યું છે કે અમારે માથે પણ સાધુસંતો કે આચાર્યોની છત્ર-છાયા છે! સાધુસંતો અને આચાર્યો સમાજના મૂળધારો હોઈ પણ શકે પણ તેમની ભૂમિકા અને સંદર્ભો જુદાં છે. રાજ-મહારાજાઓ અને બાદશાહોના દરબારમાં કવિતાની વાણીનો ખુશામતખોરી માટે વાપરનારા લાલચું અકવિઓ હતા તેમ આજે સ્પષ્ટવકતાઓને અસ્પૃષ્ય ગણનારાઓ સાધુસંતોના પગમાં આળોટા હોય છે. આવી ખોખલી મનોવૃત્તિને કારણે વહીવટકારોના હાથ મજબૂત બન્યા છે.

સંસ્થાઓના હોદેદારો મહત્વાકાંક્ષિઓને તેમ જ ખુશામતખોરોને નાના મોટા લાભો પકડાવીને પોતાના ફાંસલા સખત કરી શકે છે. એ ફાંસલાઓથી ગરદન છોલાતી હોવા છતાં જૂકી જૂકીને સલામ કરનારાઓને કારણે વહીવટકારોનો દાબ વધ્યો છે. સાહિત્ય પરિષદ અને સાહિત્ય અકાદમીનાં સાહિત્યિક કાર્યોમાં જેમની પરંદગી થતી રહે છે તેમનાં નામોની યાદી બનાવીએ – કે નામસ્મરણ કરીએ તો અંદરનું ચિત્ર બહાર આવી જશે. એક જ નામનાં પુનરાવર્તનો અને કાર્ય કરવા માટે અશક્તિમાનોની ગણતરી કરવામાં પણ વહીવટનો રાજકીય ચહેરો ઢેખાશે. તેમની સત્તાને ઢીલી પાડવા માટે તેમના દ્વારા અપાત્ત લાભોનો દઢતાપૂર્વક અસ્વીકાર

કરવો જોઈએ. ઈનામો અને એવોડની નીતિરીતિને વખોડારાઓ સંસ્થાઓએ ઈનામ માટે રજૂ કરેલાં ફોર્મ ભરતા જ હોય છે. ઈનામોના ટેકે વિદ્ધાન તરીકે પંકવા માટે કહેવાતા વિદ્રોહીઓ પણ કરી ઓછા નથી. જ્યાં સુધી સરકારી, અર્ધસરકારી કે ખાનગી સંસ્થાઓ તરફથી સાહિત્યેતર ગુણવત્તાના બળે મળતા લાભો લેવાનો બહિષ્કાર કરવાનું વલણ જોર પકડશે. નહીં ત્યાં સુધી પરિસ્થિતિમાં કશો ફેર પડશે નહિએ.

વિનિપાતની આ આંધીથી બચવા માટે એક સંપ્રકાશીલ સંવેદનસભાર બૌદ્ધિક સંવાદ માટે આતુર સહદયો મળે તે ખૂબ જ જરૂરી છે. નાનાં નાનાં મન-દૃષ્ટિ, ગમા-અજ્ઞાગમા કે કાલ્યનિક સ્વર્ધભાવથી કુંઠિત બની જવા કરતાં ઉચ્ચ મતભેદોની તાર્કિક ભૂમિકાઓ સાથે મળીશું તો જ સત્તાધીશો પર નિયંત્રણ લાવી શકીશું. બાજનજર એવા આ સત્તાધીશો સંનિષ્ઠ સહદયની દરેક પ્રવૃત્તિ પર ચાંપતી નજર રાખતા હોય છે. સંનિષ્ઠ પ્રવૃત્તિકારોની ઔંતરિક શક્તિ કેમ તોડી નાખવી તેને માટે સાહિત્યની પ્રવૃત્તિનો અંચળો ઓઢી લાભો આપવાના પેંચા કરે છે. છેલ્લા દાયકાની આબોહવામાં આ સત્તાધીશોના વર્ચસ્વથી અનેક સહદયની વચ્ચે લોંગી દીવાલો ચણાતી રહી છે.

પણ આ એકીકરણનો આરંભ ક્યાંથી અને કેવી રીતે થશે તે પ્રશ્ન તો છે. એક સુધ્યવસ્થિત માળખું રચવા માટે તમે એક સંપાદક-આયોજક તરીકે વિચારગોચિનું આયોજન કરો તો કેવું!

સાહિત્યિક સંસ્થાનાં તમામ જાહેર કાર્યોની તટસ્થ સમીક્ષા નિયમિતપણે કરાવી શકાય. સ્થાપિત હિતો સામે શસ્ત્ર ઉગામનારે સૌ પ્રથમ પોતે મરજીવો છે તે સભાનપણે સ્વીકારી લેવું પડે. દાઢી-દૂધમાં પોતાનો પગ ચાખીને સવાર-સાંજ રંગરૂપ બદલતા તકવાદીઓના સમૂહથી કશું નક્કર પરિણામ આવી શકે નહીં.

ગુજરાતી સાહિત્ય પરિષદની જન્મકુંડલીમાં વારે વારે ચાહુ આડે આવવાની ઘટના બનતી જ આવી છે. પરિષદને સત્તાધીશોના પંજામાંથી છોડાવીને સાબરમતીને કિનારે તેનો વસવાટ કરાવ્યાને આજે અર્ધશતાબ્દી થવામાં છે ત્યારે ફરી અનેક ચાહુ તેની ચંદ્રકલાને ગળી ગયા છે તો તેને પુનઃ કેવી રીતે મુક્ત કરી શકાય તેને માટે શ્રેણીબદ્ધ ‘વિચારગોચિનું આયોજન કરવાનું વિચારી શકાય. ‘પરિસંવાદ’, ‘કાર્યશિબિર’, ‘શાનસત્ર’, ‘વ્યાખ્યાનમાળા’ જેવી સંજ્ઞાઓએ તેમની ગરિમા

ગુમાવી દીધી છે. આ સંજ્ઞાઓ બિનસાહિત્યિક હસ્તકોપોને કારણે માત્ર વિવિધિનાનો બની જવા પામી છે.

વેરાન વગડામાં આકરા તાપમાં સળગતાં સુક્કાં ઝાડ જેવો સમય સાચે જ જિરવવો કઠિન છે પણ એવી વાસ્તવિકતાથી ભાંગી પડવું એ જ માનવ નિયતિનો દિતિહાસ નથી. આરોહણ પણ તેની નિયતિ રહી છે. રહેવી જોઈએ.

વડોદરા, ૮-૩-૨૦૦૬

- જીયેશ ભોગાયત્તા

સેહીશ્રી રમણભાઈ,

આ વખતના 'પ્રત્યક્ષીય'માં તમે જાત નીચોવિને લખ્યું છે. 'પ્રત્યક્ષ' દ્વારા તમે જે આપી રહ્યા છો તેનો આનંદ].... મારી અંગત ફિલસ્ફોઝ Individualismની જ્યાં સંસ્થા ત્યાં જડતા, હુંસાતૂસી, rivalry, power war હોય. અલબત્ત, મનુષ્ય સામાજિક પ્રાણી છે એટલે Social Institutions (કુદુલથી લઈને રાષ્ટ્ર સુધી) વગર ચાલે જ નહીં, પણ 'પ્રત્યક્ષ' તમે એક વ્યક્તિની હેસિયતથી ચલાવો છો એટલે જ આ ઊંચાઈએ લઈ જઈ શક્યા છો.

ગાંધીધામ, ૩૧-૧-૦૬

- માવજી સાવદા

પ્રિય રમણભાઈ,

તમારું પરિષદ વિશેનું 'પ્રત્યક્ષીય' વાંચ્યા પણી આ પત્ર. મારે જે કહેવું છે તે મુદ્દસર મૂકું :

૧. કોઈ પણ સંસ્થા એ જે હેતુથી શરૂ કરવામાં આવી હોય એ હેતુ સિદ્ધ કરી ન શકે એવી હાલતમાં આવી જાય ત્યારે એ સંસ્થા એક પ્રકારની કટોકટીમાંથી પસાર થઈ રહી છે એમ કહેવાય. હું માનું છું કે પરિષદ અત્યારે આ પ્રકારની કટોકટીમાંથી પસાર થઈ રહી છે. પરિષદ, તમે કહું છું એમ, ઓછી વિદ્યાપરક અને વધુ તંત્ર-પરક બની ગઈ છે. જો આમ ને આમ ચાલશે તો ભવિષ્યમાં એ એક સરકારી કચેરી બની રહેશે.

૨. સાહિત્ય પરિષદની આ પરિસ્થિતિ માટે કોણ અને શા માટે જવાબદાર છે એની ચર્ચા કરવાનો હવે કોઈ અર્થ નથી. આપણે બધા જ જાણીએ છીએ તેમ જ્યાં સુધી ચંદ્રકાન્ત દોપીવાળા પરિષદના નિયામકપદે હતા ત્યાં સુધી પરિષદની વિદ્યાપ્રવૃત્તિઓ પ્રમાણમાં સારી રીતે ચાલી હતી. ત્યાર પણ રમેશ દવે એ ગુણવત્તા જાળવવામાં નિષ્ફળ ગયા છે.

૩. પરિષદ પર અત્યારે કોનું શાસન ચાલે છે અને

એ શાસન કેટલે અંશો ગુજરાતી સાહિત્યને પોષક બની શકે એમ છે એ વિષે પણ વધુ કંઈ કહેવાની જરૂર મને જણાતી નથી. ઘણાબધા મિત્રોએ એની વાત કરેલી છે અને હું એમની વાત સાથે સંમત છું. રઘુવીર ચૌધરી, ભોગાભાઈ પટેલ અને અન્યો પણ પોતે સર્જક છે, એમને વાઇસવાતંત્ર શું છે અને સંસ્થાસ્વાતંત્ર શું છે એની પૂરેપૂરી ખબર છે - એવું હું એમના સાહિત્યને વાંચીને કહી શકું છું. તેમ છતાં તેઓ, ખાસ કરીને રઘુવીર ચૌધરી અને ભોગાભાઈ પટેલ, એ મૂલ્યોનું જતન કરવામાં નિષ્ફળ ગયા છે એની હું સખેદ નોંધ લાઉં છું અને એવી આશા પણ રાખ્યું છું કે એ ધર્મનું પાલન કરીને પરિષદને પ્રગતિશીલ બનાવશે. કનૈયાલાલ મુનશીએ પરિષદની શી દશા કરેલી એ વાતમાંથી ધડો લેવો જોઈએ. મુનશીના જમાનાએ એક ઉમાશંકર જોશી તિભા કરેલા. આજે તો એવા ઉમાશંકર જોશી તિભા થાય એવું લાગતું નથી. એ પરિસ્થિતિનો ગેરલાભ ન લેવાય એની કાળજી આ વડીલ સાહિત્યકારો લેશે તો યોગ્ય થશે.

૪. કેટલાય સાહિત્યકારો પરિષદથી નારાજ છે. કેટલાક જે રઘુવીર ચૌધરી, ભોગાભાઈ પટેલ કે એમના અનુયાયીઓને માયું છે એ પોતાને નથી માયું એટલા માટે નારાજ છે તો વળી કેટલાક પરિષદની વિચારસરણી અને જે શરીતે એ વિચારસરણી અમલમાં મૂકવામાં આવી રહી છે એનાથી નારાજ છે. આમાંના પહેલા પ્રકારના સાહિત્યકારોને બાજુ પર રાખી બીજા પ્રકારના સાહિત્યકારોને પોતાની પડખે લેવા માટે પરિષદે પ્રયાસ કરવા જોઈએ. એ સાહિત્યકારો પરિષદ વગર પણ સારું કામ કરી શકે છે એ વાત પરિષદ ભૂતવી ન જોઈએ. આ સાહિત્યકારોને પરિષદ-વિરોધી સાહિત્યકારો તરફે ન જોવા જોઈએ. એ સાહિત્યકારોને જો પરિષદની ચિંતા જ ન હોત તો એ એની ટીકા કરત જ નહિ. બની શકે કે એ સાહિત્યકારો પાસે પરિષદને ગતિશીલ બનાવવા માટે કોઈક નવા જ વિચારો હોય. હું માનું છું કે પોતાની ભાષામાં જ સર્જન કરતા સર્જક પાસે જતાં પરિષદે નાનમ ન અનુભવવી જોઈએ. મને બચાવર યાદ છે : વડોદરામાં વર્ષી પૂર્વે સાહિત્ય પરિષદનું અધિવેશન યોજાયેલું ત્યારે રઘુવીર ચૌધરી સુરેશ જોશીને તેડવા આવેલા (હું અહીં જાણી જોઈએ આમંત્રવા કે બોલાવવા શબ્દો નથી પ્રયોજતો). આરંભે સુરેશભાઈએ આનકાની કરેલી. પણ પણી રઘુવીર ચૌધરીના આગ્રહને વશ થઈને એ પરિષદને સંબોધવા ગયા હતા. એ એતિહાસિક ઘટના વડોદરાના કેટલાક મિત્રો આજે

પણ યાદ કરે છે. (ઇથું કે રઘુવીર ચૌધરીને પણ યાદ હોય.) હું જાણું છું કે પરિષદથી રિસાયેલા બધા જ સાહિત્યકારો સુરેશ જોખી નથી તેમ છતાં એમની પાસે જઈ, એમના અસંતોષનું કારણ સાંભળી, જો એ કારણ વાજબી હોય તો એને દૂર કરવામાં નાનમ શાની?

૫. આ ઉપરાંત એવા કેટલાય સાહિત્યકારો છે જેમની સર્જનશક્તિમાં આજું કૌવત નથી પણ તેઓ ખડેપગે પરિષદની અર્થાત્ પરિષદ સાથે સંકળાયેલા મહાનુભાવોની સેવા કરવા તૈયાર હોય છે. પરિષદ એવા સાહિત્યકારોને આડકતરી રીતે પણ એક સંદેશો તો પહોંચાડી ઢેવો જોઈએ કે પરિષદમાં ખુશામતનું નહિ, સાચાં મૂલ્યોનું ચલણ ચાલે છે.

૬. પરિષદની સામે જે કંઈ ઊઠાપોહ થયો છે એ ઊઠાપોહને પરિષદે ગંભીરતાથી લેવો જોઈએ. તમે આટલાં સૂચનો કર્યા. એ વાંચા પછી મને એમ લાગ્યું કે એ સૂચનોનો અમલ કરવામાં પરિષદને કોઈ વાંધો ન હોવો જોઈએ. અને જો એમ હોય તો તમને એક પત્ર લખવો જોઈએ. ઊઠાપોહ કરનારે પરિષદવિરોધી ન ગણવો જોઈએ. મેં એક વાર રઘુવીર ચૌધરીની વિરુદ્ધમાં લાગ્યું ત્યારે ઘણાએ મને રઘુવીરવિરોધી/પરિષદ-વિરોધી વગેરે બિનુદીથી નવાજેલો. અને એ પણ ખાનગીમાં. કોઈએ મારાં વિધાનોમાં રહેલો આકોશ જોયો ન હતો. આપણાને આવી ટેવ પડી ગઈ છે. હું તો માનું છું કે પરિષદે પોતાને ગતિશીલ બનાવવા માટે સાહિત્યકારો પાસેથી તેમ જ સમાજના વિવિધ વર્ગો પાસેથી પણ સૂચનો મંગાવવાં જોઈએ અને એ સૂચનો પર ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. હું પરિષદનો પ્રમુખ હોઉં કે નિયામક હોઉં એટલા માત્રથી હું બીજાથી ચિદ્યાતો છું એવા કોઈ અમભૂત મારે ન રહેવું જોઈએ.

૭. પરિષદે પૈસા નથી-ની બૂમો પાડવાનું પણ બંધ કરવું જોઈએ. પૈસા તો જોઈએ એટલા મળી રહે જો પરિષદ પુરવાર કરે કે એ પૈસાનો દુરુપયોગ નહિ થાય. અહીં દુરુપયોગનો અર્થ પૈસા ખવાઈ જવા એવો નથી કરવાનો. જે કામ માટે દાન મળ્યું હોય એ કામ જો ઉચ્ચ ગુણવત્તા ન જાળવે તો હું એને પણ પૈસાના દુરુપયોગ તરીકે જ ઓળખાવીશ. પરિષદે બીજું કશું જ નથી કરવાનું, પોતે જે કામ કરવા માગે છે એની એક યાદી બનાવી, એ માટે કેટલા ભંડોળની જરૂર છે અને જો એ ભંડોળ મળશે તો એ કામ પોતે કઈ રીતે પાર પાડવા માગે છે એટલું જ સ્પષ્ટ કહેવાની જરૂર છે. પરિષદ જો એકબે સારાં કામ કરશે તો ઘણા દાન

આપવા આગળ આવશે.

૮. પરિષદ ગુજરાતી ભાષા વિકાસ-કેન્દ્ર શરૂ કરવું જોઈએ. અને આ કેન્દ્રના નેજા હેઠળ પી.ડી.સી. યુવાન/યુવતીઓ માટે ગુજરાતી વ્યાકરણનો પ્રમાણપત્ર કોર્સ અને બી.એડ., એમ.એડ. થયેલાં યુવાન/યુવતીઓ માટે ગુજરાતી વ્યાકરણનો ડિપ્લોમા કોર્સ શરૂ કરવા જોઈએ. જે આ કોર્સિસ વે એને નોકરીમાં પાંચ ટકા ગેસ આપવાની નીતિ સ્વીકારવા સરકારને ભલામણ કરવી જોઈએ. જો સરકાર એ ભલામણ સ્વીકારશે તો લોકો ગાંધના પૈસા બચ્ચાને પણ આ કોર્સ કરવા માટે આવશે. એનાથી આજે નહિ તો કાલે ગુજરાતી ભાષાનું શિક્ષણ સુધરશે. આ ઉપરાંત કોલેજના અધ્યાપકો માટે ગુજરાતી ભાષાવિજ્ઞાનનો કોર્સ પણ આપવો જોઈએ. એટલું જ નહિ, પરિષદ સાહિત્ય-સિદ્ધાંત પર પણ ઉનાણ કોર્સિસ શરૂ કરવા જોઈએ. અહીં (અમેરિકામાં) કોર્સલ યુનિવર્સિટી એવા કોર્સિસ આપે છે જેમાં આખા જગતમાંથી વિદ્યાર્થીઓ આવતા હોય છે. તે પણ ઊંચી ફી ભરીને. આપણે પણ એવું કેમ ન કરી. શકીએ?

૯. એટલાં કેટલાંક વરસોથી ગુજરાતી સાહિત્યમાં પૂર્વ-પાશ્ચિમનો ઝડપો ચાલી રહ્યો છે. આ ઝડપોએ હવે તો વરવું રૂપ લીધું છે. પૂર્વની તરફેણ કરનારા સુરેશ જોખી કે હરિવલભ ભાયાઝી જેવાની બેજવાબદાર ટીકા કરતાં બે વાર વિચારતા પણ નથી. આ પ્રકારના વિવેચકોને, બાડી હોય એમ, ટેકો આપનારા પણ મળી રહેતા હોય છે. આને કારણે ગુજરાતી સાહિત્યમાં એક પ્રકારની અસહિષ્ણુતાનું વાતાવરણ બીજું થયું છે. પરિષદે એ અસહિષ્ણુતાનું પ્રમાણ ઓળું કરવા કંઈક કરવું જોઈએ. બીજું કંઈ નહિ તો પુરોગામી સાહિત્યકારોનાં યોગ્ય મૂલ્યાંકનો થાય એવો સેમિનાર તો પોજાવો જોઈએ.

૧૦. મેં જોયું છે કે પરિષદનાં શાનસત્રો અને અધિવેશનો એક પ્રકારનો મેળો બની રહેતાં હોય છે. હું માનું છું કે પરિષદે અમાંથી પણ બધાર આવવું જોઈએ અને શાનસત્રો અને અધિવેશનોને ગંભીર સાહિત્યિક પ્રવૃત્તિઓ બનાવવી જોઈએ.

૧૧. ક. મા. મુનશી અને રઘુવીર ચૌધરી તથા ભોગાભાઈ પટેલ જેવા સાહિત્યકારોને કારણે સાહિત્ય પરિષદને ફાયદો પણ થયો છે અને નુકસાન પણ. જે ફાયદો થયો છે એનો આપણે સ્વીકાર કરવો જોઈએ. પણ જે નુકસાન ગયું છે એ આપણે સ્પષ્ટ ચીધી બતાવવું જોઈએ.

૧૨. સાહિત્ય પરિષદની પોતાની વેબસાઈટ હોવી જોઈએ. હવે પરબ અને અન્ય પ્રકાશનો પણ ઇન્ટરનેટ પર મૂકવાં જોઈએ, એટલું જ નહિ, આપણે જે કંઈ પ્રકાશનો કરીએ અમને યુનિકોડમાં કંપોઝ કરાવીને એની સી.ડી. પણ સાચવવી જોઈએ. યુનિકોડમાં સચવાયેલી ગુજરાતી ભાષાના ઘણા ઉપયોગો છે. માનો કે દસ વરસ પછી કોઈએ ગુજરાતી ભાષાનો ડેટા આધારિત શબ્દકોશ બનાવવો હોય તો એને એ પ્રકારની સામગ્રી કામ લાગશે. જે સાહિત્ય ટેક્નોલોજીનો સ્વીકાર નહિ કરે એનો વિકાસ અટકી જો. આપણે એક વાત સ્વીકારવી જોઈએ કે ટેક્નોલોજી એ કેવળ યંત્રો નથી. ટેક્નોલોજી માનવજીતની ઉત્કાંતિ સાથે સંકળાયેલી છે.

આશા રાખ્યું કે પરિષદ સાથે સંકળાયેલા મહાનુભાવો આ વણમાર્ગાં સૂચનો વિશે પણ ગંભીરતાપૂર્વક વિચાર કરશે અને પરિષદને બને એટલી વધારે ગતિશીલ બનાવશે.

ફિલાટેલ્ફીયા, ૧૮-૩-૨૦૦૬

- બાબુ સુથાર

r

પ્રિય રમણભાઈ,

કુશળ હશો..

પરિષદ-વિવાદને લક્ષ્યનું તમારું 'પ્રત્યક્ષીય' વાંચ્યું. પરિષદની વર્તમાન પરિસ્થિતિથી તમે દુઃખી છો એની સાથે મારા જેવા મિત્રોને સામેલ કરશો. પરિષદ સરેળા નહીં કરેલાં કામોની તમે વિગતપ્રચુર યાદી આપી છે તથા કરવા જેવાં કામોનો સંકેત કર્યો છે તેમાં પરિષદ પ્રત્યેની તમારી ખરેખરી નિસબત છીતી થાય છે. વળી, સાહિત્યના પરિષદ પ્રકાશિત હિતિહાસોના પુનઃ સંપાદનમાં કે કારોબારીના સક્રિય સભ્ય તરીકે તમે સંસ્થાને સતત મૂલ્યવાન માર્ગદર્શન પૂરું પાડ્યું છો તેથી તમને પરિષદની નીતિરીતિ સામે ટીકા કરવાનો પૂરો અધિકાર છે.

તદે બેસીને તમાશો જોનારાની ટીકાથી તમારું 'પ્રત્યક્ષીય' અલગ છે. પ્રવાહમાં જુકાયા વિના એની તાણનો અનુભવ ન થાય.

પરિષદને એચ. ડે. કોલેજના નાનકડા ખંડમાંથી વિશ્વાળ પ્રાંગણવાળા મહાલયમાં લાવનારાઓ ખરેખરા ધન્યવાદને પાત્ર છે. પ્રકાશ વેગડની ભથ્થમણના કારણો ચી. મં. ગ્રંથાલય જેવું નભૂનેદાર ગ્રંથાલય મળ્યું. એમની સેવાઓનો વધુ લાભ ન લઈ શકાયો તે ખરેખર દુઃખદ ઘટના છે. જ્યંત કોઈને પણ પરિષદ પ્રત્યે નાગરજી થઈ જાય એ હુદ્દ અનુભવ થયેલો એ પણ અમે જ્યારે વિદ્યાર્થી તરીકે સંભળતા.

ત્યારે દુઃખી થતા. સત્ત્વહીનોની ઠેળી જમા થતી જાય, પદવાંછુઓ વડીલો ભીખ પિતામહ થતા જાય ત્યારે વસ્ત્રાહરણની ઘટના ઘટે જ.

હું એટલું ચોક્કસ માનું છું કે પરિષદ કેવી હોવી જોઈએ એ એક આદર્શ છે. જેનો તુટ્ટિગુણ કઈ સંતોષાય નહીં. મૂલ્યધારણા, સાહિત્યરુચિની ઓટના આ દિવસોમાં પરિષદને ઊની-અંચ ન આવે તેવું બને ખંતું? સંસ્થાની સિદ્ધિઓ જો સમૂહકાર્યની ફળશ્રુતિ છે તો સંસ્થાની મર્યાદાઓ પણ સામૃદ્ધ જવાબદારીવાળી જ હોવી જોઈએ. એના માટે એકાદ વ્યક્તિની જવાબદારી હોઈ શકે નહીં.

અન્ય રાજ્યોની સરખામણીમાં તો આપણી પરિષદ જરાય ઉત્તરતી નથી. આ જગતાએ જુદા જુદા અભિગમો ધરાવતા સર્જક-વિવેચકો એકમેડને હોંશથી મળે છે. પરિષદ સાથે ચીધા નહીં સંકળાયેલા સર્જકવિવેચકો પણ પ્રસંગોપાત્ર સહકાર આપે છે. મને જ્યારે સાહિત્ય અકાદમી (ફિલ્હી)ની ટ્રેવેલગ્રાંટ મળેલી ત્યારે હું કલકત્તા ગયેલો. 'બંગીય સાહિત્ય પરિષદ'નું અંધારેભર્યું ગ્રંથાલય, રેફિયાળ તંત્ર, સાક્ષાત જોયેલું. એના કર્તાહૃતાઓ એકાદબે ચોપડી લખનારાઓ, વેપારવણજમાં ગ્રસ્ત મહાનુભાવો હતા! ત્યાં મહત્વપૂર્ણ તમામ સર્જકો પરિષદથી વેગળા રહે છે. જો આપણે ત્યાં પણ આવું થશે તો આપણા ગોવર્ધનભવનમાં પણ અંધારું થતાં વાર નહીં લાગે.

સંસ્થાઓ ચલાવવી અધરી છે. એની વહીવરી અને વિદ્યાકીય બેઠ પ્રવૃત્તિઓ 'જડ' ન બની જાય તે માટે સહિયારો પ્રયાસ જરૂરી છે. આર્થિક મદદ માટે ઉદાર દાતાઓ ખોળવા, વિદ્યાકીય કામો માટે વિદ્વાનોને મનાવવા - બધું અધરું હોય છે. વિવિધ અવાજોવાળાને એકોસાથે સંભળવા/સંભાળવા એ તો એકાદ નાની સંસ્થા સાથે સંકળાયેલા હોઈએ તોપણ ખબર પડે કે કેટલા વીસે સો થાય !

પરિષદની સિદ્ધિઓ સહિયારી છે તેથી એની મર્યાદાઓને સહિયારી માનીને નદીકિનારે નહીં પણ મહીં જુકાવીને મથીએ એ જ આજની ઘડીએ મળે યોગ્ય લાગે છે. બાકી તો મત આપવાની તસ્કી ન લેતા માણસો ભણ રાજકારણની જ્યાં ત્યાં ચર્ચા કરે છે તેવું લાગે છે.

તમારી જેમ સહુ પ્રવેશીને, ચકારીને પ્રતિક્રિયા આપે તે જ સાચી ટીકા.

વડોદરા; ૧૨-૨-૦૬

- ભરતના વંદન

r

## આદરણીય રમણભાઈ,

તમારો તંત્રીલેખ ‘પરિષદની આરપાર’ પરિષદનાં સો વર્ષે ખરેખર તો દરેક ગુજરાતી સાહિત્યપ્રેમીઓને સ્પર્શે એવો છે. પરિષદનાં સો વર્ષે આ Cultural audit – સાંસ્કૃતિક હિસાબ કરવાનો, મંથન કરવાનો યોગ્ય સમય છે. તમારો લેખ પરિષદની સોઈ આટકોને ટીકા કરી નાખવી એવા આવેશથી દૂર રહ્યો છે એથી આ મંથન પરિષદના તત્ત્વવાહકો વિધાયકરૂપે લે એમ ઈચ્છાએ. પણ જેવના ‘માં પરેશ નાયક વિભિત્ત પરિષદના પ્રાણપ્રશ્નો’ અનુંગે ચાલેલી પત્રચર્ચા પણ તત્ત્વવાહકોને પ્રાણરૂપ જ્ઞાન નથી, કેમકે એમાંના કોઈએ ખુલાસો સુધાં કરવાની તરસી લીધી નથી. મને તમારો લેખ પણ આમ જ એળે જશે કે શું ? – એવી ભીતિ રહે છે, કેમકે તેઓ કશીયે ટીકા સાંભળવા ટેવાયેલા લાગતા નથી. સાચી રીત તો એ હતી કે પરિષદ પ્રજાની જ સંસ્થા હોય તો એની સામે ઉઠેલા પ્રશ્નો અંગે જવાબદાર વ્યક્તિએ સંઘળી હકીકતોની સંદર્ભ સમેત સ્પષ્ટતા કરી હોત.

વિદ્યાપ્રવૃત્તિ જ પરિષદના કેન્દ્રમાં રહેવી જોઈએ. ઊંચી વિવેચન-સંશોધન સજ્જતા ધરાવતા વિદ્વાનો પરિષદથી દૂર થતા ગયા હોય તો એ વિશે પરિષદને કશું વિચારવાનું નથી ? વહીવટી માળાખા અને નગાયું એવાં પરિષદ પદોથી દૂર હતીને આ સજ્જ પેઢીનો જે લાભ લેવાએ જોઈતો હતો એને ઉપેક્ષિત રાજવાનું વલણ સાહિત્યને માટે શોકકારક છે. એવા વિદ્વાનોના માર્ગદર્શન હેઠળ નવો-નેચી સાહિત્ય સંશોધકોની પેઢી તૈયાર થાય, પરિષદ એનું પ્રેરકબળ બને, ગુજરાતી ભાષા, સાહિત્યના જિજ્ઞાસુઓને માટે સંસ્થા એક વર્કરૂપ જેવી બને એવા પ્રયત્નો થવા જોઈએ. પરિષદ એવું સુનિયોજિત તત્ત્વ, દર વર્ષે ઓછામાં ઓછી આટલી પ્રવૃત્તિઓ તો કરવી જ એવું સમયપત્રક ધરાવતું હોત તો જુદીજુદી દિશાની કોશપ્રવૃત્તિથી એ ધમધમતું હોત. બાળસાહિત્ય, ભાષાશાસ્ત્ર, લોકસાહિત્યથી માંડીને આધુનિક સાહિત્ય-વિષયક આજ લગી પ્રકાશિત થયા છે એનાથી વધુ સંદર્ભગ્રંથો એ તૈયાર કરી શકી હોત. પરિષદની આંખ સામે જ સદ્ગ્રા થયેલી વિશ્કોશ સંસ્થાએ વીસ જેટલા દળદાર કોશગ્રંથો અને એટલા જ સંદર્ભગ્રંથો ગુજરાતના હાથમાં મૂકી આયા છે. પરિષદે કરવા જોઈતા પ્રકલ્પો અન્ય સંસ્થાઓએ, વ્યક્તિગત સાહસે શા માટે કરવા પડે ભલા ? શક્તિઓને વેરવિભેર કરી નાખવાને બદલે એકસ્યુરે બાંધવાનું કામ પરિષદ દ્વારા થંડું જ ઘટે. પ્રકાશિત પુસ્તકોના વ્યાપક પ્રસાર-પ્રચાર ને વેચાણ માટેના કોઈ આયોજન વિના સો પુસ્તકોના પ્રકાશનનો હવાઈ ખ્યાલ બામક નીવડી શકે એવો

જ છે. એના બદલે સાહિત્યના અવભ્ય દસ ગ્રંથો પરિષદ તહીન સસ્તી કિંમતે ઉપલબ્ધ કરાવી આપે તોય ઘણું. અરે, પાંચેક સાહિત્ય-સંશોધનના અભ્યાસી વિદ્યાર્થીઓને ફેલોશિપ આપીને, સંશોધનમાં પ્રેરિને એ ગ્રંથોને પ્રકાશિત કરે તોયે બસ છે. એક દાયકાના પ્રકાશિત ગ્રંથોની સંપૂર્ણ સૂચિ પરિષદ પાસેથી મળવાની આશા નથી, કેમકે એવા દસ્તાવેજકરણની, સંદર્ભ કેન્દ્ર રચવાની એની તૈયારી નથી. પ્રકાશ વેગડના આ બહુમૂલ્ય પ્રદાનને યાદ કરી વિધવિધ સૂચિઓ તૈયાર કરાવવાની પ્રેરકતા ક્યાંથી ઉછીની લાવવાની છે ?

૧૯૮૪માં ‘પરબ’ દ્વારા મળેલા ‘તુલનાત્મક કાવ્યશાસ્ત્ર’ના વિશેષાંક પછી ૧૯૮૭માં ‘પ્રંથાવલોકન’ જેવો વિશેષાંક પ્રસિદ્ધ થયો છે. અન્ય સામયિકોની તુલનાને બાજુ પર રાખીએ પણ પરિષદના એક સામયિક લેખે એને ‘શાનની અખૂટ પરબ’ કહેવામાં આવતી હોય અને એક પણ સાચવવા યોગ્ય વિશેષાંક ‘પરબ’ આપી ન શકે, કોઈ અતિથિ સંપાદકને પણ યાદ ન કરાય, એ સ્થિતિ જ આપણને સૌને ઘણુંબધું સૂચવી હે છે.

કાલોલ, ૧૫-૨-૦૬

- કિશોર વ્યાસ

r

પ્રિય મિત્ર રમણ સોની,

‘પ્રત્યક્ષ’ ઓફિચીલ-ડિસે. ૦૫ના અંકમાં છપાયેલું ‘પરિષદની આરપાર’ એ તમારું નિરીક્ષણ વાંચ્યું. ગુજરાતી વાઙ્મય અને પરિષદના લગભગ તમામ સાચા ચાહકોના મંત્રબ્યનો એમાં પડધો પડે છે. જમા-ઉધારનું સરવૈયું તમે તત્ત્વસ્ત્રાથી છતાં સંવેદનાથી તારબ્યું છે. છેલ્લા બે-ત્રણ દાયકાથી પરિષદ ગુજરાતી સાહિત્યરસિક પ્રજાની વાજબી આકંક્ષાઓને તોષતી નથી અને વિવિધ ‘પ્રાંચો’માં (અને અર્થમાં) ગુંચાવાઈ ગઈ હોય તેવું તો લાગે જ – તેના સંચાલકોને સુધાં. બહુ ગંજાવર ભવન બિસ્માર થતું જોવા જેવો આ વથાકર અનુભવ છે.

થયું તે થયું. હવે આ કળણમાંથી તેને બહાર કાઢી, વિદ્યા-વિસ્તરણનાં રૂડાં કામ કરતી કરીએ. બે-ચાર સૂચનો – ૧. સમારંભના ઠઠારાથી અને મોજમજાના જલસાથી સંમેલનોને મુક્ત રાખીએ.

૨. ગુજરાતી પ્રજા ધનસમૃદ્ધ છે પણ વાચનદરિદ છે. અહીં ખાસ કોઈ વાચનરસિયા જ નથી. જેનો પનારો સાહિત્ય-સંશોધન સાથે છે, તે શિક્ષકો વાંચે છે ? (આ વંગ નથી). જેનું કર્તવ્ય વાંચવાનું છે તે સાહિત્યના લાખો ઉચ્ચ શિક્ષણ કક્ષાના વિદ્યાર્થીઓ વાંચે છે ?

- સંપન્ન ધૂધાર્થીઓ, ડોક્ટરો, વકીલો, ઊંચા હોદ્દા ધરાવતા અધિકારીઓ, ગૃહિણીઓ વાંચે છે ? હા, છાપાં ! બાનપાન અને મનોરંજન સિવાય ગુજરાતીને – ગુજરાતના – મુંબઈ ઈ.ના તથા વિદેશ વસ્તાને – કંઈ રુચતું જણાતું નથી.
3. પરિષદનું પહેલું અને પરમ કામ ગુજરાતીઓને વાચન કરતા કરવાનું છે. નગદ પુસ્તકો, ઉત્તમ સામાન્યિકો નિષ્પન્ન કરી, પ્રદર્શનો યોજી, શહેરમાં કાર્બકમો યોજી, કોલેજો – યુનિ.ઓમાં પહોંચી. રીતસરની ઝૂંબેશ ચલાવવી પડે. અને આ કોણ કરે, જો પરિષદ ન કરે તો ? અને આ ન કરે તો પરિષદ બીજું શું કરે ? અને આ જો કરે; ઉત્તમ કૃતિઓ વંચાય, ખરીદાય, ચર્ચાય, તો પછી બધું જ આપોઆપ થવાનું – વિવેચન ને સંશોધન ને શિબિર ને સંમેલન ને ભાષાઅધ્યયન ને સંખાકોશ વગેરે વગેરે.
4. ગુજરાત પાસે ધનિકો છે, સંપત્તિ છે, સાધનસુવિધા છે. માગો તે મળો. એનો ઉચિત સુંદર વિનિયોગ કરી ઉત્કૃષ્ટ વાડુમયનો વેર વેર, ચોરેચોરે, શાળાએ શાળાએ, મનીરે ઉત્સવે, મેળે નવરાત્રિએ પ્રચાર ન થાય ? દસ વરસમાં સારાં પુસ્તકો ચાપોચાપ ઊપડે, એતું કરે તો જાણીએ કે ગુજરાતી સાહિત્ય પરિષદ જીવે છે, ધબકે છે.

રાજકોટ, ૧૩-૨-૨૦૦૬

– મહેશ ધોળકિયા

માનનીય રમણભાઈ,  
હુમણાં હુમણાં ગુજરાતી સાહિત્ય પરિષદનાં સો વર્ષ નિમિત્તે લખાણો પ્રગટ થાય છે. એમાં મોટે ભાગે ફિલ્મિયાનો સૂર, અણગમો, આક્રોષો, રહિયા વગેરે દેખાય છે. તે પરિસ્થિતિમાં, આપે પરિષદની સારી બાજુઓ પણ જોઈ રેથી એ સંસ્થાના સામાન્ય સભાસદ તરીકે આનંદ થયો. સાથોસાથ આપે – શું કરવું, કેમ કરવું, શું થવું બાકી છે એનો અણસાર પણ આપ્યો છે.

તમારું લખાણ વાંચતાં એમ પણ થયું કે મૂળ પ્રશ્ન શું છે, ક્યાંથી પ્રગટ્યો છે – એ નિદાન બાકી લાગે છે.

પરિષદ એક ટ્રસ્ટ છે. તેના અંગે ફિકર કરવા જેવું લાગે તો ચેરિટી કમિશનને જણાવાય. પરંતુ પ્રખ્યાત સાહિત્યકાર અવસાન પામે તો મરણનોંધની બે લીટી પણ ભાગ્યે છાપતાં પ્રચાર-પ્રસાર માધ્યમો પરિષદ વિશે અગ્રલેખો કેમ લાગે છે તે પ્રશ્ન તમને ન થયો ?

આપણે જાણીએ છીએ કે છેલ્લા બેત્રાણ દશકથી જાણીતી-માનીતી સંસ્થાઓ પર કબજો જમાવવા માટે રાજકીય વિચારધારાનો આશરો લઈ ધૂસણખોર તત્ત્વો સક્રિય થયાં છે ને આવું અતિકારમાં ભારતભરમાં ચાલે છે. યુનિવર્સિટી હોય કે સાહિત્ય અકાદમી હોય કે અધ્યાપક સંઘ જેવા નાના એકમ હોય; અથવા ભોપાલના કલાભવનથી લઈને જે.એન.યુ. જેવી સંસ્થા હોય – ટ્રૂકમાં ગ્રાંટ-ભક્તી જીવો કલા, શિક્ષણ કે સાહિત્યની સંસ્થાના કેન્દ્રમાં ધર્સી જવા તત્ત્વર હોય છે. કલા કે શિક્ષણના છાચ પ્રેમીઓની આ ચેષ્ટા ચાલતી હોય છે – લોકતંત્ર કે સ્વાયત્તતાને નામે. પરંતુ ડૉ. ભાયારી કહેતા હતા એમ સ્વાયત્તતા આપણને રાસ નથી આવતી ! આપણી સાહિત્ય અકાદમીનો કચો હોકેટાર અકાદમીની પ્રકાશન-પ્રવૃત્તિમાં સંપાદક કે અનુવાદક નથી બન્યો ? એવું જ બને છે અભ્યાસકમ સમિતિઓમાં.

બીજો મુદ્રો છે – લોકશાહી પારદર્શિતા સંસ્થાના વહીવટાં હોવી જોઈએ, તેવી આપણી અપેક્ષા. મૂળમાં આ વિભાવના જ અધૂરી છે. લશકરમાં, શિક્ષણમાં, કલામાં ટેણું કહે તેમ નહીં તેનો તજ્જશ કહે તેમ થવું જોઈએ. જ્યારે ગુજરાતી સાહિત્યમાં, તજ્જશ ગણાતા લોકો તો પરિષદમાં ફરકતા પણ નથી. સત્ત્વશીલ લોકો કે સર્જકો દૂર રહેશે તો શૂન્યાવકાશ પૂરવા અલ્યસત્ત્વ પરિબળો હંમેશાં તૈયાર હોય છે. એટલે, થાય છે કે આપે સૂચચાઓ છે તે પરિષદનાં કાર્યો કોણ કરાવશે ? કેવી રીતે કરાવશે ? આ ચિંતા સહિતારી બનવાનું બીજું કારણ પણ મળે છે. એક મુરબ્બીએ – લાભશંકર પુરોહિતે – એક વાતચીતમાં મને કહેલું કે ‘સત્ત્વશીલ હોય કે અલ્યસત્ત્વ હોય, સહુને મહત્વાકંશા ચાખવાનો, વિકસાવવાનો અવિકાર છે !’ પણ મહત્વાકંશા વિકસવાને બદલે વકરે તો ?

છેલ્લે એક વાત એ કે સો વરસ દરમિયાન પરિષદે એટલો વિકસ સાધી લીધો કે તે અદોરળી બની ગઈ છે. પ્રકાશન, સંપાદન, સંશોધન, પરિસંવાદ, ઈનામ, અધિવેશન, ચૂંટણી... એ બધું જોતાં મારા જેવાને લાગે કે પરિષદ એક કેન્દ્રવાળી નહીં પણ અનેક કેન્દ્રો વાળી – નાના નાના એકમો વાળી હોય. બાકી એક જ સ્થળો અને સમયે સાથે રહેતો સંઘ સો વરસ સુધી બધાં કાર્યોમાં સતત ગુણવત્તા જાળવતો રહે એ અપેક્ષા વધારે પડતી છે.

જામજોધપુર, ૧૦-૨-૨૦૦૬

– મનોજ રાવળ

માનનીય રમણભાઈ,  
હુમણાં હુમણાં ગુજરાતી સાહિત્ય પરિષદનાં સો વર્ષ નિમિત્તે લખાણો પ્રગટ થાય છે. એમાં મોટે ભાગે ફિલ્મિયાનો સૂર, અણગમો, આક્રોષો, રહિયા વગેરે દેખાય છે. તે પરિસ્થિતિમાં, આપે પરિષદની સારી બાજુઓ પણ જોઈ રેથી એ સંસ્થાના સામાન્ય સભાસદ તરીકે આનંદ થયો. સાથોસાથ આપે – શું કરવું, કેમ કરવું, શું થવું બાકી છે એનો અણસાર પણ આપ્યો છે.

તમારું લખાણ વાંચતાં એમ પણ થયું કે મૂળ પ્રશ્ન શું છે, ક્યાંથી પ્રગટ્યો છે – એ નિદાન બાકી લાગે છે.

પરિષદ એક ટ્રસ્ટ છે. તેના અંગે ફિકર કરવા જેવું લાગે તો ચેરિટી કમિશનને જણાવાય. પરંતુ પ્રખ્યાત સાહિત્યકાર અવસાન પામે તો મરણનોંધની બે લીટી પણ ભાગ્યે છાપતાં પ્રચાર-પ્રસાર માધ્યમો પરિષદ વિશે અગ્રલેખો કેમ લાગે છે તે પ્રશ્ન તમને ન થયો ?

તમારું લખાણ વાંચતાં એમ પણ થયું કે મૂળ પ્રશ્ન શું છે, ક્યાંથી પ્રગટ્યો છે – એ નિદાન બાકી લાગે છે.

પરિષદ એક ટ્રસ્ટ છે. તેના અંગે ફિકર કરવા જેવું લાગે તો ચેરિટી કમિશનને જણાવાય. પરંતુ પ્રખ્યાત સાહિત્યકાર અવસાન પામે તો મરણનોંધની બે લીટી પણ ભાગ્યે છાપતાં પ્રચાર-પ્રસાર માધ્યમો પરિષદ વિશે અગ્રલેખો કેમ લાગે છે તે પ્રશ્ન તમને ન થયો ?

માનનીય શ્રી રમણભાઈ,

‘પરિષદની આરપાર’ શીર્ષક ડેટળ આપે પરિષદ વિશે ઘણા સુંદર મુદ્રા ચર્ચામાં આવરીને જે સચોટ માર્ગદર્શનરૂપે દર્શાવ્યા એ માટે ધન્યવાદ.

એક વાત ખાસ કે પરિષદ એક અદના ભાવક-ચાહકને પણ પોતીકી સંસ્થા લાગે તેમ કરવાની તત્ત્વ જરૂર છે. મેં એકવાર, ‘પરબ’ના વાચકોના પત્ર-વિભાગમાં ઘણા વિચારણીય વિચારો-મંતવ્યો પ્રગટ થયેલા છે તે સંક્ષિપ્ત કરીને પુસ્તક રૂપે પ્રકાશિત કરવાં જોઈએ – એવો એક પત્ર પરિષદના તંત્રવાહકો, ‘પરબ’ના સંપાદક, પરિષદના પ્રમુખને, જવાબી કાઈ સાથે, લખેલો. એનો ન તો ઉત્તર સાંપડજો કે ન એ પત્ર ‘પરબ’માં પ્રસિદ્ધ થયો. મારા લખવામાં કદાચ સાહિત્યિક ભાષા-શૈલી ન હોય એ વાત સ્વીકારું છું પણ મારા એક સ્પષ્ટ મંતવ્ય અંગે ઉત્તર મળવાની આશા ન રાખીશું ?

જેવના, ઉદ્દેશ, પ્રત્યક્ષ, કુમાર, શબ્દસૂચિ વગેરે સામયિકોના સંપાદકો વાચકોના યોગ્ય મંતવ્યને સ્થાન આપે છે. મારાં મંતવ્યોને પણ સ્થાન મળેલું છે. વળી, ‘આધુનિક સાહિત્ય સંજ્ઞાકોશ’ પ્રગટ થયો ત્યારે મેં ઉછી-ઉધારના પૈસા મેળવી એ ખરીદેલો ને વાંચીને કેટલાંક સૂચન સંપાદક શ્રી ચંદ્રકાન્ત ટોપીવાળાને લખી જણાવેલાં કે તરત જ એમજો લાગણીભર્યો. ઉત્તર લખ્યો તથા કોશનો જીણવટથી અભ્યાસ કરવા માટે મને ધન્યવાદ પાઠવવા સાથે આગામી નવી આવૃત્તિવેળા સૂચિત સુધારો કરવાની હેઠાધારણ આપેલી.

પરિષદ જો અદના સાહિત્યરસિકની સંસ્થા હોય તો એની પાસેથી પણ આવી ઓછામાં ઓછી અપેક્ષા તો રાખી શકાય ને ?

પરિષદનાં જ્ઞાનસત્રો, અધિવેશનોની ગતિવિધિ જેવા આખા કાર્યક્રમને માટે તટસ્થ સમીક્ષિત અહેવાલ પ્રસિદ્ધ થાય તો મારા જેવો અદનો ભાવક પણ એનો દિશાદોર પકડી શકે. એટલે આપના એ મુદ્રાને હું સંપૂર્ણ સમર્થન આપું છું.

ભુજ, ૨૧-૧-૨૦૦૬

– બાબુલાલ ગોર

r

તત્ત્વશી,

ઓક્ટો. – ડિસે. ૨૦૦૫ના અંકના ‘પ્રત્યક્ષીય’માં કંઈ વધુ ચર્ચાને ઉશ્કેરે એવું લાગતું નથી – તમારી વાત સાથે

મોટે ભાગે સંમત થવું જ પડે. પણ તમે આંગળી મૂકીને બતાવેલાં કેટલાંક દર્દી જ લા-ઈલાજ !

તમે વહીવટી શિથિલતા પરત્વે સંકેત કર્યો. સાચી વાત. પણ સમગ્ર વહીવટીતંત્ર પર કોઈ સુપ્રિમો (વહીવટી સુપ્રિમો, બંધારણીય નહીં) નીમવાનું કેમ સૂચવાય નહીં ? નજેક વર્ષ અગાઉ મારી પાસેથી, નિમંત્રણ આપીને, શતાબ્દી ગ્રંથમાળા માટે વાર્તાસંગ્રહની હસ્તપ્રત મંગાવવામાં આવેલી. તેથી મારા વ્યવસાયિક પ્રકાશકને બદલે મેં પરિષદને આપી તેમ છતાં ‘પરામર્થન થયા પછી યોગ્ય લાગે તે નિર્ણય થશે’ એવો જવાબ ! ને પછી દ્વ્યાજારી બતાવી એટલે ‘અરે હોય કંઈ ! એ તો ખાલી પ્રોસીજર જ’ એવો જવાબ. વળી પાછો એક કાગળ : ‘પરામર્થન બાકી !’ અરે, નિમંત્રણ આપો પછી શેના બબ્બે પરામર્થન ? ભલે, છેક હમણાં (જાન્યુ. ૨૦૦૬માં) સમાચાર છે કે, બટર તૈયાર થઈ જશે પણ છાપવાનું તો કોઈનું દાન મળ્યા પછી જ બનશે ! ભલા માણસ, કોઈને જમવા બોલાવીએ પછી, ‘બેસો શાંતિશી, લોટ-પાણી-લાકડાં આવશે ત્યારે રસોઈ થશે’ એમ ના કહેવાય. બધું ‘રેડી’ હોય તો જ હાકલો કરાય. વહીવટી શિથિલતા જ નહીં, ઉદાસીનતાનો મારો આ જત-અનુભવ. એટલે જ, આનો ઈલાજ તે કોઈ સત્તાધારી વહીવટી વડો નીમવો તે.

અમદાવાદ, ૨૪-૧-૨૦૦૬

– ૨જીનીકુમાર પંડ્યા

r

પ્રિય રમણભાઈ,

‘પ્રત્યક્ષ’ (ઓક્ટો. – ડિસે. ૨૦૦૫)નું સંપાદકીય વાંચ્યું પરિષદને સો વર્ષ પૂરાં થયાં છે ત્યારે એનું આવું સચોટ, સ્પષ્ટ અને છતાં સંક્ષિપ્ત સિંહાવલોકન તમારા સિવાય કોણ આપી શકે ? લાગતું તો ઘણાને હશે, પણ પરિષદના કેન્દ્રમાંથી બહાર ફેંકાઈ જવાના ભયે લખે કોણ ?

આમાં તમામ મુદ્રાને આવરી લેવામાં આવ્યા છે. પરિષદ કરવા જેવાં ઘણાં કામો કર્યા છે તેમ ઘણાં રહી પણ ગયાં છે, પરિષદના ઘણા પુરસ્કારો-પારિતોષિકો પરસ્પર અથડાય છે એ મુદ્રા પણ ખરે જ વિચારણા માગે છે. તમે એટલું સરસ રીતે, સ્પષ્ટ રીતે અને સર્વાંગી લખ્યું છે કે કંઈ ઉમેરવાનું બાકી રહી જતું નથી. ખૂબ ખૂબ ધન્યવાદ.

ભુજ, ૨૭-૧-૨૦૦૬

– ૨જીનીકાન્ત સૌની

r

૨૦૦૬ માર્ચ ૨૧

૧૫

## પરિચय મિતાકશી

સ્વીકાર-સમાલોચના માટે પ્રકાશકો અને લેખકો તરફથી મળેલાં પુસ્તકોની પરિચયનોંધ

સ્વીકાર-મિતાકશી વિભાગને હવે પુસ્તકો થોડોક વધુ પરિચય આપતા પરિચય-મિતાકશી વિભાગનું રજૂ કરવાનું ગાય્યું છે. આ પરિચય પુસ્તકોની પ્રકાશન-વિગતો ઉપરાંત વિષય-સામગ્રીના પણ વધુ નિર્દેશો આપશે. અલબન્ટ આ સંક્ષિપ્ત લાખાંશો મંતવ્યલક્ષી નહીં પણ વસ્તુ-વિગત-લક્ષી રહેશે. એ પછી અવલોકન-સમીક્ષા માટે આમાંથી જ પુસ્તકો પસંદ થશે. મળેલાં સર્વ પુસ્તકોને પ્રાથમિક પરિચયથી આવરી લેવાના જરૂરી પ્રયોજનથી આ ઉપક્રમ કર્યો છે. —સંપાદક

### કવિતા

**ક્રિયન પોઅમ્સ (અંગ્રેજી)** – ધીરુબહેન પટેલ. ઠીમેજ, મુંબઈ-અમદાવાદ, ૨૦૦૫; તૃ. ૧૦૮, રૂ. ૩૫ • રસોડાના વિષયને કેન્દ્ર કરીને નારી-સંવેદના આલેખતી ૧૦૦ અંગ્રેજી કાવ્યરચનાઓ.

ખખડતી જોયે કવિતા કોણ ? – સંપા. ચંદ્રકાન્ત શેઠ. ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, ૨૦૦૫; તૃ. ૨૨૪, રૂ. ૫૦ • લાભશોકર ઢાકરની ચંદ્રકાન્ત શેઠ ચૂટેલી ૧૧૬ કવિતાનો સંચય – સંપાદકના અભ્યાસલેખ સાથે.

ગજેન્ડનાં મૌક્કિસ્કો – સંપા. રમણલાલ યાણીક. ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, પુ.મુ. ૨૦૦૪; તૃ. ૨૦૬, રૂ. ૧૨૫ • સ્વ. ગજેન્ડ બુચની રચનાઓના ૧૯૨૮માં થયેલા મરણોત્તર સંપાદનનું અકાદમીએ કરેલું ‘યથાતથ પુનર્મુદ્રણ’. ૬૦ કાવ્યરચનાઓ ઉપરાંત આ સંગ્રહમાં કવિનાં કેટલાંક ગુજરાતી-અંગ્રેજી ગદ્યલખાંશો પણ સંચિત છે. આરંભે ગજેન્ડ બુચના જીવન-કવન વિશેનો અભ્યાસલેખ છે.

ચૂં... ચૂં... ચૂં... ચૂં... ચ્યાર્ટ... – વિરંધિ ત્રિવેદી. પ્ર. લેખક, વડોદરા, ૨૦૦૫; મુખ્ય વિકેતા શબ્દલોક, અમદાવાદ. ક્ર. ૭૨, રૂ. ૪૦ • ચારીસ બાળકાયોનો સંગ્રહ.

છીનેને આવ તું... – રાજેશ વાસ ‘મિસ્કિન’ આર.આર. શેઠ, મુંબઈ-અમદાવાદ, ૨૦૦૫; તૃ. ૧૧૨, રૂ. ૭૦ • ૧૦૦ ગજલ-રચનાઓનો સંગ્રહ.

ત્રિવેદી ગજલ – ભૂપેન્દ્ર શેઠ ‘નીલમ’. પ્ર. હંસાબહેન શેઠ, જામનગર, ૨૦૦૫; તૃ. ૨૪, રૂ. ૨૫ • કવિની ગુજરાતી ગજલ રચનાઓ – એના હિંદ્રી-ઉર્દૂ અનુવાદો સાથે. ઉર્દૂ અનુવાદ સતીન દેસાઈએ કરેલા છે.

નાયાબ નગીને – ભૂપેન્દ્ર શેઠ. અમૃતા પ્રકાશન, અમદાવાદ; ક્ર. ૧૧૬, રૂ. ૧૦૦ • ભૂપેન્દ્ર શેઠની પચાસ ગુજરાતી

ગજલરચનાઓ – એના (સતીન દેસાઈએ કરેલા) ઉર્દૂ અનુવાદો સાથે.

પડ્ઘા ને પડ્ઘાયા વચ્ચે – ચંદ્રકાન્ત શેઠ. ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, તૃ. ૧૮૫, રૂ. ૫૦ • પોતાની ચૂટેલી ૧૭૧ કાવ્યકૃતિઓનો, સર્જનની કેફિયત સાથેનો સંચય.

પરવાજકી ઓર – ભૂપેન્દ્ર શેઠ. અમૃતા પ્રકાશન, અમદાવાદ, ૨૦૦૪; ક્ર. ૬૮, રૂ. ૬૦ • હિંદી ગજલો.

પવન પગથિયાં – સંપા. ચંદ્રકાન્ત ટોપીવાળા. ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, ૨૦૦૪; તૃ. ૧૨૮, રૂ. ૭૫ • મનુભાઈ ત્રિવેદી ‘અરોદ’ની કવિતામાંથી સંપાદિત કરેલી ૧૧૦ કાવ્યકૃતિઓ – સંપાદકે કરેલા અભ્યાસલેખ સાથે.

પ્રેમ – ભૂપેન્દ્ર શેઠ. પ્ર. હંસાબહેન શેઠ, જામનગર, ૨૦૦૫; અર્ધકાઉન પ્ર. ૮૦ રૂ. ૨૫ • ‘પ્રેમવિષયક શેરો.’

કૂલદાં કૂલપરીનાં – ભૂપેન્દ્ર શેઠ. પ્ર. હંસાબહેન શેઠ. ૨૦૦૫; તૃ. ૪૨, રૂ. ૨૫ • બાળકાવ્યો.

તિરતિ, હું અને તું – મહેન્દ્ર અમીન. અરવરવ પ્રકાશન, પ્રાંતિજ, ૨૦૦૬; તૃ. ૧૮૨, રૂ. ૧૫૦ • કવિના અગાઉના સંગ્રહોમાંથી પણ પસંદ કરેલી તથા એ પછીની કાવ્યરચનાઓનો સંગ્રહ.

### વાર્તા

અનુઆધુનિક વાર્તાસૂચિ – સંપા. મોહન પરમાર. પાર્શ્વ, અમદાવાદ, ૨૦૦૫; ક્ર. ૧૮૨, રૂ. ૮૫ • ગુજરાતની ૧૧ ‘અનુઆધુનિક’ વાર્તાઓનું સંપાદન. સંપાદકે આરંભે અભ્યાસલેખ અને છેલ્દે દરેક વાર્તાના આસ્વાદો મૂક્યા છે ને વાતાકારપરિચયો કરાવ્યા છે.

કરુંતુક – મધુ રાય. ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, ૨૦૦૫; તૃ. ૨૧૨, રૂ. ૫૦ • મધુ રાયની ‘હરિ’ જૂથની તેમજ અન્ય ૨૬ હંગી વાર્તાઓ જેમાં થોડીક પૂર્વિઝાત પણ સમાવેલી છે.

દલિત વાર્તાસૂચિ – સંપા. મોહન પરમાર. પાર્શ્વ, અમદાવાદ,

૨૦૦૫; કા. ૧૬૮ રૂ. ૮૦ • આ વિષયની ૧૧ વાર્તાઓનું સંપાદન. આરંભે અભ્યાસલેખ અને અંતે વાર્તા-આસ્વાદો અને કર્તાપરિચયો.

**નારીની કથા :** પુરુષની લેખિની – સંપા. દર્શના ધોળકિયા. હર્ષ પ્રકાશન, અમદાવાદ, ૨૦૦૫; રૂ. ૨૮૦, રૂ. ૧૬૦ • ધૂમકેતુથી દશરથ પરમાર સુધીના પુરુષ લેખકોની નારીવિષયક વાર્તાઓમાંથી ૨૬ વાર્તાઓનો સંપાદિત સંગ્રહ. આરંભ સંપાદક લખેલા ‘પુરુષ લેખકોની વાર્તાઓમાં નારીસંવેદન’ અભ્યાસલેખ સાથે. દરેક વાર્તાને છેડે એના મૂળ સોતના નિર્દેશો કરેલા છે. ફટફટિયું – સુમન શાહ. પાર્શ્વ, અમદાવાદ, ૨૦૦૬; રૂ. ૨૨૪, રૂ. ૧૦૦ • લેખકની ૧૫ ટૂંકી વાર્તાઓનો સંગ્રહ. છેલ્લે પોતાની વાર્તાઓ વિશેની લેખકની કેફિયત, ‘અનુવચન’ રૂપે મુકાઈ છે. ફ્લેમિન્ઝો – પણા નાયક. ઈમેજ, મુંબઈ-અમદાવાદ, પુનર્મુદ્રણ ૨૦૦૪; રૂ. ૧૨૮, રૂ. ૮૦ • લેખિકાની રૂ ટૂંકીવાર્તાઓનો સંગ્રહ – બધી વાર્તાઓમાં ગુજરાતી પાત્રોનો સ્થળ/જીવન-પરિવેશ અમેરિકા છે એ આ વાર્તાઓનો લક્ષ્ણ વિશેષ છે. બંકુલેશની વાર્તાઓ – સંપા. શરીકી વિજઞાવણા. ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, ૨૦૦૪; રૂ. ૧૮૨, રૂ. ૫૦ • વીસમી સરી પૂર્વર્ધના ગુજરાતી વાર્તાકાર બંકુલેશ (રામજી અર્જુન ગજંકધ) ની વાર્તાઓમાંથી ૧૩ વાર્તાઓનું સંચિત સંપાદન – આરંભે સંપાદકનો મૂલ્યાંકનલક્ષી અભ્યાસલેખ; અંતે બંકુલેશના વાર્તાસંગ્રહો અને વાર્તાઓની યાદી.

**મણિલાલ હ. પટેલની વાર્તાસૂચિ** – સંપા. માય ડિયર જ્યુ. પાર્શ્વ, અમદાવાદ, ૨૦૦૫; કા. ૧૭૨, રૂ. ૮૦ • મણિલાલ પટેલની વાર્તાઓમાંથી ૨૦ વાર્તાઓનું સંપાદન-અભ્યાસલેખ સાથે.

**મોપાસાંની વાર્તાસૂચિ** – અનુ. જિતેન્દ્ર દેસાઈ. પાર્શ્વ, અમદાવાદ, ૨૦૦૫; કા. ૨૧૫, રૂ. ૧૦૦ • મોપાસાંની, ‘સ્ત્રી-પુરુષ સંબંધ’ વિષયની ૨૨ વાર્તાઓનો ગુજરાતી અનુવાદ.

**મોહન પરમારની વાર્તાસૂચિ** – સંપા. માય ડિયર જ્યુ. પાર્શ્વ, અમદાવાદ, ૨૦૦૫; કા. ૧૮૬, રૂ. ૮૦ • મોહન પરમારની વાર્તાઓમાંથી ૧૭ વાર્તાઓનું ચયન – સંપાદન, સંપાદકીય અભ્યાસલેખ સાથે.

**સંજીવની** – માય ડિયર જ્યુ. પાર્શ્વ, અમદાવાદ, ૨૦૦૫; કા. ૧૭૬, રૂ. ૮૫ • ૧૮ વાર્તાઓનો સંગ્રહ – આરંભે વાર્તા-વિષયક થોડીક વિચારણા અને અંતે ઓમની કેટલીક વાર્તાઓ વિશે વિવેચનો વિવેચન-પ્રતિભાવો.

**સંસાર** – સંપા. અસ્મા માંકડ. ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, ૨૦૦૪; રૂ. ૨૨૪, રૂ. ૫૦ • ગુલાબદાસ બોકરની

વાર્તાઓમાંથી ૨૦ વાર્તાઓનું ચયન – અભ્યાસલેખ સાથે.

## નાટક

આધુનિક ગુજરાતી એકાંકીઓ – સંપા. ઉત્પલ ભાયાશી. ભારતીય સાહિત્ય અકાદમી, નવી દિલ્હી, પુનર્મુદ્રણ ૨૦૦૧; રૂ. ૧૪૮, રૂ. ૧૨૦ • ૧૧ ગુજરાતી એકાંકી નાટકોનો સંચય – અભ્યાસલેખ સાથે.

કરેંગે યા મરેંગે – પ્રકાશ ત્રિવેદી. એન. એમ. ત્રિપાઠી, મુંબઈ, ૨૦૦૫; કા. ૧૨૫, રૂ. ૭૦ • ગાંધીજીને વિષય કરતું ઈતિહાસ લક્ષી ત્રિભંકી નાટક.

દસ્તો, પિંજર, ખાલ, કબૂતર – હરીશ નાગેચા. રનાદે, અમદાવાદ, ૨૦૦૫; કા. ૨૩૨, રૂ. ૧૨૫ • ‘પાંચ દશ્ય-શાય્ય નાટકો અને ત્રણ દશ્ય-શાય્ય નાટકોની પટકથાઓ.’

## નિબંધ, લેખ, ચાચિત્ર

કંકરીચાળો ને પથ્થરમારો – ચંદ્રકાન્ત શેઠ. આર.આર. શેઠ, મુંબઈ-અમદાવાદ, ૨૦૦૫; કા. ૧૨૬, રૂ. ૭૦ • વિનોદાત્મક ૩૦ લેખ-નિબંધો.

ગુજરાતી નિબંધસૂચિ – સંપા. કિશોરસિંહ સોલેંકી. પાર્શ્વ, અમદાવાદ, ૨૦૦૫; રૂ. ૧૮૨, રૂ. ૧૦૦ • ગુજરાતી નિબંધોનું સંપાદન – સંપાદકીય લેખ સાથે.

જેઓ કિરીક મૂડી ગયાં – જિતેન્દ્ર દેસાઈ. આર.આર. શેઠ, મુંબઈ-અમદાવાદ, ૨૦૦૫; કા. ૨૪૨, રૂ. ૧૨૫, • મુદ્રણ – પ્રકાશન -પત્રકારત્વ – શિક્ષાશાળ લોકસેવાનાં કોત્રોમાં પ્રદાન કરી ગયેલા કેટલાક દિવંગત મહાનુભાવો વિશેના ચાચિત્ર-લેખો.

મારું પ્રિય પુસ્તક – સંપા. સુરેશ દલાલ. ઈમેજ, મુંબઈ-અમદાવાદ, ૨૦૦૬; રૂ. ૩૭૫, રૂ. ૨૨૫ • મારું પ્રિય પુસ્તક વિશે ૧૦૦ જેટલા લેખકોના પ્રતિભાવો-લેખો.

માતૃ-પ્રદક્ષિણા – સંપા. દીપક મહેતા. ઈમેજ, મુંબઈ-અમદાવાદ, ૨૦૦૫; રૂ. ૧૮૮, રૂ. ૧૨૦ • મા વિશેનાં વિવિધ લેખકોનાં ચાચિત્ર-આદેખનો.

શુતરેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં – રસીલા કડીઆ. પ્ર. ચંદ્રકાન્ત કડીઆ, જૈન બોર્ડિંગ, ડ્રાઇવ ઇન રોડ, અમદાવાદ, ૨૦૦૬; ડાલ કાઉન્ ૧૮૪, રૂ. ૨૦૦ • પ્રાચીન હસ્તપ્રાપો ને એની વિધિપ્રોત્સાહન જાણકાર, પંડિત મુનિશ્રી પુષ્યવિજયજ્ઞાન શિષ્ય, સમગ્ર કારકીર્દી હસ્તપ્રતવિદ્યા-સહાયક ને શિક્ષક રહેલા સ્વ. લક્ષ્મણભાઈની કામગીરીનો પરિચય

આપતું ને વાર્તાલાપો દ્વારા એમનું ચરિત્ર આવેખતું પુસ્તક.

## લોકસાહિત્ય : સંપાદન, સંશોધન, વિવેચન

ડ અરવલ્લીના લોકેદ્વો – સંપા. નવજી ડાભી. શિવશંકર  
ચુનીલાલ જેશી ચેરિટેબલ ટ્રસ્ટ, ભાટ્ટાયા નિવાસ, ફોર્ટ, મુંબઈ,  
૨૦૦૫; ઢ. ૧૨૮, રૂ. ૬૦ • ખેડુભાંગા. – બનાસકંઈઠાના. તુંગરી  
બીલોના. શ્રદ્ધાપાત્ર દેવો, દેવસ્થાનકો, પૂજાવિધિ આહિની માહિતી  
આપતું ને આ દેવોનાં કેટલાંક સ્તુતિગીતોનાં સંપાદન.

અરવલ્લીનાં ઔષધો અને લોકવૈદ્યો – સંપા. વીરચંદ પંચાલ.  
શિવશંકર જોશી ટ્રસ્ટ, મુંબઈ, ૨૦૦૫; ૩. ૧૨૮, ૩. ૬૦ •  
અરવલ્લીના આદિવારી વિસ્તારના કેટલાક લોકવૈદ્યો ચાથેની  
મુલાકાત – પ્રશ્નોત્તરીઓ અને એને આધારે ઔષધો આદિની  
વિગતોની તારખણી – ભંગાદન

**ગરાસિયા લોકોત્સવ :** ગોર – સંપા.. વીરચંદ પંચાલ. શિવશંકર  
જોશી ટ્રસ્ટ, મુંબઈ, ૨૦૦૫; રે. ૧૨૮, રૂ. ૬૦ અનુસારના  
આદિવાસી વિસ્તારના ગોર = ગોરીવતના વિધિ, પરંપરાની  
ભૂમિકા સાથે એ બોલીઓનાં ગોરનાં ગીતોનું સંપાદન, છલવે  
શબ્દાથી કોણ.

સોખલા ગરાસિયાના હગ અને દેવરો - સંપા. નવજી ડાલી. શિવશંકર જોશી ટ્રસ્ટ, મુંબઈ, ૨૦૦૫; રૂ. ૧૨૮, રૂ. ૬૦ • ઉત્તર ગુજરાતના બનાસકંડા જિલ્લામાંના સોખલા ગરાસિયાઓના લોકોત્સવો હગ (= માનતા, બાધા) અને દેવરો-નાં લોકીનોને સંપાદન ષણ્ણલે શાબ્દાર્થકોશ.

સોખલા ગરાસિયાનં દિવાળી ગીતો અને વર્ત્તા - સંપા. નવજી  
ડાભી. શિવાંકર જોશી ટ્રસ્ટ, મુંબઈ, ૨૦૦૫; ૩. ૨૪૬, ૩.  
૧૨૦ • સંપાદન - અભ્યાસની ભૂમિકા સાથે દિવાળી ગીતો,  
વર્ત્તાઓનું સંપાદન, શબ્દાંકોશ સાથે.

સોખલા ગરાકિયાનાં હોળી ગીતો - સંપા. વીરચંદ પંચાલ.  
શિવશંકર જોશી ટ્રસ્ટ, મુંબઈ, ૨૦૦૫; રે. ૧૨૮, રે. ૬૦ •  
સંપાદન - સંશોધનની ભૂમિકા તથા એ પ્રદેશના હોળી ઉત્સવની  
વિગતો સાથે હોળી ગીતોનાં સંપાદન. છેલ્લે શબ્દાર્થકીશ.

સોખલા ગરાસિયાની વહી-વાર્તા - સંપા. વીરચંદ પંચાલ.  
શિવશંકર જોશી ટ્રસ્ટ, મુંબઈ, ૨૦૦૫; રે. ૧૨૮. રે. ૬૦ •  
એ વિસ્તારમાં આસો-કારતકમાં કહેવાતી મુળ બોલીમાંની વહી  
વાર્તાઓ અને એનાં માન્ય ગુજરાતીમાં રૂપાંતરો. અભ્યાસ-  
સંશોધનની ભમિકા સાથે.

T पહेलां आठ पुस्तकोनुं प्राप्तिस्थान : साराभाई धर्मशाळा,  
मानसग्रन्थालय अमेरि अंबाजी (बनासकुटी)

ગોપીયંદ – ભરથરીની વાર્તા – સંપા. ભગવાનદાસ પટેલ.  
 શિવશંકર જોશી ચેરિટેબલ ટ્રસ્ટ, મુંબઈ, ૨૦૦૫; ઢ. ૫૧૬, રૂ. ૨૫૦ • ‘આદિવાસી સભ્યતાની શોધ ભાષી’ નામે પોઠીના અભ્યાસલેખ સાથે, સંપાદિત કરેલી ‘ગોપીયંદ-ભરથરી’ અને બીજી દસ આદિવાસી વાતર્તોઓ – મૂળ બોલિમાં ને એના માન્ય ગુજરાતીમાં રૂપાંતર સાથેનું સંપાદન. (વાતર્તોમાં અનેક ગીતો પણ ગૃથાયેલાં છે.) છલ્યે, વાર્તાવાર શદ્ધાર્થસચિ.

ગ્રામીજા અને આહિવાસી કંઈપરંપરા – હસુ યાચ્ચિક. પ્ર. લેખક,  
અમદાવાદ, ૨૦૦૫; વિકેતા : ગૂર્જર, અમદાવાદ. ૩. ૧૭૨, ૩.  
૧૦૦ • જીવેરંચદ મેધાશીએ અને ભગવાનદાસ પેટે કરેલાં  
આહિવાસી કંઈપરંપરાની કૃતિઓનાં સંપાદનોનું વિવેચન-મૂલ્યાંકન  
કરતા અભ્યાસલેખોનો સંગ્રહ.

Study in the Tribal Literature of Gujarati – હસુદ્ગામાન  
યાજીક, નયન સૂર્યાનંદ લોકપ્રતિષ્ઠાન, મુંબઈ, ૨૦૦૪; ૩. ૨૨૨,  
૩. ૧૨૫ • ભગવાનદાસ પટેલ કરેલાં સંપાદનો-સંશોધન વિશેના  
અભ્યાસલેખો. અંગેજ અન્વયાદ નારાયણ એમ. કુસારો.

બિલેયન

અધ્યાંદસમીમાંસા - ચંદ્રકાન્ત ટેપીવાળા. પાર્થ, અમદાવાદ,  
૨૦૦૬; રી. ૧૨૮, રી. ૭૦ • ગુજરાતી કવિતામાં પ્રવર્તતા  
અધ્યાંદસની પચીસેક કવિઓનાં કાંબોને લઈને તપાસેલી વિવિધ  
તરાહોને આધારે ઉપસાવેલી અધ્યાંદસમીમાંસા. આરંભે  
અધ્યાંદસ. અંગે લેખકની, (કોણે?) લીધિલી. એક મલાકાત.

કાવ્યજીશાસ્ન અને ગાંધીમાંસા - અનુ. નગીનદાસ પારેખ.  
 સમ્યક પ્રકાશન, અમદાવાદ, ૨૦૦૫; વિકેતા : ગુજરાત,  
 અમદાવાદ, તૃ. ૨૦૮, રૂ. ૮૦ • નગીનદાસ પારેખ બંગાળીમાંથી  
 કરેલા અનુવાદો 'કાવ્યજીશાસ્ન' (અતુલયંક ગુપ્ત), તેમજ  
 અખુસઈદ અયુબના ત્રણ લેખો તથા 'ગાંધીમાંસ'ના  
 રવીન્દ્રનાથ તેમજ પ્રબોધયંક સેનના ત્રણ લેખો. એનું અનિલા  
 દલાલે કરેલે અંદલન

કિશોર જાદવ અધ્યયનગ્રંથ - સંપા. કિશોર જાદવ. પાર્શ્વ,  
અમદાવાદ, ૨૦૦૫; રૂ. ૨૮૦, રૂ. ૧૮૦ • કિશોર જાદવનાં  
નવલક્ષણાંબોવાત્તરંગણી અને એમની વાતાવરિયા; એમનું  
વિશેચન અને સંપાદન - અંગેના વિવિધ અભ્યાસીઓના  
વિશેચનનિબારને સંકલન અને સંપાદન

ગાજુલ - શક્રીલ કાદરી. પાર્થ, અમદાવાદ, ૨૦૦૫; ૩. ૧૪૨,  
૩. ૭૫ • ગાજુલ વિશેનો લેખકના શોધનિબંધનાં, સ્વરૂપચર્ચાનાં  
બે પ્રકરણો સમાવતો લઘંગ્રથ.

**ગુજરાતી નવલક્ષ્ય :** ફેર વિચારણા - જશવંત શેખડીવાળા. પાર્શ્વ, અમદાવાદ, ૨૦૦૫; ઢ. ૧૮૨, રૂ. ૧૨૦ • ગુજરાતની કેટલાક જાહીરી નવલક્ષ્ય કૃતિઓનું પુનઃમૂલ્યાંકન કરતા લેખો. ગુજરાતી ભાષાસાહિત્યનું અધ્યાપન - સંપા. માણિલાલ હ. પટેલ, કિશોરસિંહ સોલંકી. પાર્શ્વ, અમદાવાદ, ૨૦૦૬; ઢ. ૧૪૮, રૂ. ૧૦૦ • ગુજરાતી સાહિત્ય અને સાહિત્ય અધ્યાપન અંગેના વિવિધ લેખકોના લેખોનું સંકલન - સંપાદન.

**પ્રતિબદ્ધ - ભરત મહેતા.** પ્ર. લેખક, વડોદરા, ૨૦૦૫; વિકેતા : રાવલ પબ્લિકેશન, પાટણ, ઢ. ૨૩૮, રૂ. ૨૦૦ • દિવિતપીઠિત મનુષ્યોની સંવેદનાને વાચા આપતી ગુજરાતી, ભારતીય અને વિદેશી વાર્તા-નવલક્ષ્ય, કૃતિઓ, વિશે અભ્યાસલેખો.

**પ્રતિભાવક્ષણ - શ્રદ્ધા નિવેદી.** પ્ર. લેખક, અમદાવાદ, ૨૦૦૫; વિકેતા : ગૂર્જર, કા. ૨૩૨, રૂ. ૧૦૦ • વિવિધ વિવેચનલેખોનો સંગ્રહ.

**પ્રવચનો - હરિવલભ ભાયાણી.** ઈમેજ, મુંબઈ-અમદાવાદ, ૨૦૦૫; ઢ. ૧૧૬, રૂ. ૮૦ • સ્વ. હરિવલભ ભાયાણીના ભારતીય સાહિત્યસિદ્ધાંત, સંશોધન-વિવેચન, કાવ્યવિવેચન, ભાષાવિજ્ઞાન વિશેના વક્તાવ્યરૂપ લેખોનું રમેશ આ. ઓઝાએ કરેલું સંકલન.

**રંગભૂમિ ૨૦૦૪ :** ઉત્પલ ભાયાણી. ઈમેજ, મુંબઈ-અમદાવાદ, ૨૦૦૫; ઢ. ૧૨૦, રૂ. ૮૦ • ગુજરાતી, હિંદી, મરાಠી રંગભૂમિ અને નાટકો વિશેના લેખો.

**શબ્દને સથવારે - પ્રભાશંકર ફડકે.** પ્ર. નિમિષ ફડકે, અંજાર-કચ્છ, ૨૦૦૬; વિકેતા : અક્ષર ભારતી, અંજાર અને સાહિત્ય પરિષદ ભવન, અમદાવાદ, ઢ. ૧૮૪, રૂ. ૧૦૦ • કેટલાક કચ્છી લેખકો અને કચ્છી કવિતા વિશેના તથા મેઘદૂતના ગુજરાતી અનુવાદો' આદિ વિવેચનલેખોનો સંગ્રહ.

**શબ્દગંધા - હર્ષદ નિવેદી 'પ્રાસનેય'** પ્ર. લેખક, વડોદરા, ૨૦૦૫; વિકેતા : આર્દ્ધ પ્રકાશન, અમદાવાદ, કા. ૨૧૨, રૂ. ૧૨૦ • લેખકના સિદ્ધાંતલક્ષી તેમજ પ્રત્યક્ષ વિવેચનના લેખો. [પદ્યવાર્તાકાર] શામળ - પ્રસાદ બહલભાઈ. પાર્શ્વ, અમદાવાદ, ૨૦૦૫; ઢ. ૧૨૫, રૂ. ૮૦ • શામળ અને એના સર્જન વિશેના લઘુગ્રંથ.

#### અન્ય :

[હિલસૂરી, ધર્મ, માનસશાસ્ત્ર, વૈદ્યકીય વિજ્ઞાન, મુલાકાતો સર્વસંગ્રહો.]

અબ તો બાત ફેલ ગઈ (પના નાયક) - સંપા. સુરેશ દલાલ. ઈમેજ, મુંબઈ-અમદાવાદ, ૨૦૦૬; ઢ. ૨૭૬, રૂ. ૧૭૫ (ડોલર ૧૫) • પના નાયકનાં કાલ્યો, વાર્તાઓ, નિબંધો, ચિત્રાંત્રો, ક્રેફ્ટ - આહિમાંથી પસંદ કરેલી કૃતિઓનો સંપાદિત સંચય. જાહુઈ ચિરાગ : મન - હરેશ ધોળકિયા. ગોરુજ કિયેશન, ૧૦૪ ઉમિયાનગર, માંડવી (કચ્છ), ૨૦૦૫; ઢ. ૩૨, રૂ. ૨૫ • ચિત્રનલક્ષી સર્બંગ લેખ.

**બાળઉછેરમાં બાળસાહિત્યનું સ્થાન - ઈશ્વર પરમાર.** પ્રવીષ પુસ્તક ભંડાર, રાજકોટ, ૨૦૦૫; ઢ. ૫૬, રૂ. ૩૫ • બાળસાહિત્યનાં દશાંતો ગુંધીને બાળકની માનસિક માવજતની આવશ્યકતા ચીંધાંતું પુસ્તક. આ લેખન પરિષદ વ્યાખ્યાનરૂપે થયેલું.

**ભાગ્યવંતી ધરા શ્રેષ્ઠી - ડૉ. મનુ જીબી. આર. આર. શેઠ, મુંબઈ - અમદાવાદ, ૨૦૦૨; પ્રત્યેક પુસ્તિકા કા. ૩૨, દરેકના રૂ. ૨૦ • ડોક્ટર તરીકેના અનુભવથી અયોગ્ય ઉપચારો સામે સાવચેતી દર્શાવતી ને યોગ્ય સૂચનો કરતી ૨૦ પુસ્તિકાઓ : પ્રથમોપચારમાં શું ન કરવું ?, ગર્ભાવસ્થામાં શું ન કરવું ?, બાળઉછેરમાં શું ન કરવું ?, ઘરગઢ્યું બીમારીઓ, ઓપરેશન કરાવવું છે ?, શરીરને જીવવા ધો, દાંતમાં ચાંદી ?, બત્રીસલક્ષણી બત્રીસી, દંડે દાસ્તાન, ઊંઘની આલમ, આપણા મસાલા, નો એક્સ-રે, નો સોનોગ્રાફી, નો એમ.આર. આઈ., લેબટેસ્ટ કરાવવો છે ? ટીકા લગાયો, આ કીડની બગડે જ કેમ, શિવામ્બુજ, મનદર્પણ, નિર્વાણ્યાત્રા.**

**શોતાનનો શલ્લકોશ - સંપા. અનુ. પ્રકાશ વેગડ. આર.આર. શેઠ. મુંબઈ-અમદાવાદ, ૨૦૦૫; કા. ૧૨૦, રૂ. ૭૦ • કેટલાક ગુજરાતી શલ્લોના વિલક્ષણ ને રમૂજલક્ષી અર્થો આપત્તા કોશના રૂપે લખાયેલું હાસ્યપુસ્તક.**

**સંતોનું સાંનિધ્ય - કાર્ટિક્યે ભણ.** ઈમેજ, મુંબઈ-અમદાવાદ, ૨૦૦૫; ઢ. ૧૩૬, રૂ. ૬૦ • કેટલાક સંતોના સાંનિધ્યનો મહિમા-અનુભવ આલેખતા લેખો.

**સાક્ષરનો સાક્ષાત્કાર :** ૮, ૯, ૧૦ - રાધીશયામ. શર્મા. રન્નાદે પ્રકાશન, અમદાવાદ, ૨૦૦૫; પ્રત્યેક ગ્રંથ ઢ. ૪૪૦, પૃષ્ઠ, પ્રાચેકના રૂ. ૩૦૦ • પ્રત્યેક ગ્રંથમાં ૪૫-૫૦ જેટલા સાક્ષરો સાથેની પ્રશ્નોત્તરી અને ભૂમિકા રૂપે લેખકે કરેલાં એમનાં સંક્ષિપ્ત ચિત્રાંકનો.